



ભવિષ્ય તરફના માર્ગો

૨૨મો વાર્ષિક અહેવાલ ૨૦૨૦-૨૧

ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ લિમિટેડ
(ગુજરાત સરકારનું સાહસ)

CIN : U45200GJ1999SGC035995

GST No : 24AAECG8707D1ZU

૨૨મો વાર્ષિક અહેવાલ

૨૦૨૦-૨૧

ભવિષ્ય તરફના માર્ગો

ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ લિમિટેડ
(ગુજરાત સરકારનું સાહસ)

રજિસ્ટર્ડ ઓફીસ

ભયતળીયે, નિર્માણ ભવન, સેક્ટર-૧૦ એ,

ગાંધીનગર - ૩૮૨૦૧૦ (ગુજરાત)

ફોન નં. (+૯૧-૭૯-૨૩૨૫૨૯૧૨,, ૨૩૨૫૨૯૧૫) ફેક્સ નં.: (+૯૧-૭૯-૨૩૨૫૨૦૯૦)

Email : info@gsrdc.com Webside : www.gsrdc.com

(સીઆઇએન :યુ૪૫૨૦૦જીજે૧૯૯૯ એસજીસી ૦૩૫૯૯૫)

બોર્ડ ઓફ ડિરેક્ટર્સ

ચેરમેન

શ્રી પૂર્ણેશકુમાર આઇ. મોદી

મા. મંત્રીશ્રી અને માર્ગ અને મકાન વિભાગ, માર્ગ પરિવહન, નગરિક ઉદ્યોગ,
પ્રવાસન વિભાગ

વહીવટી સંચાલક

શ્રી અશોક કે.પટેલ

મુખ્ય ઇજનેર, માર્ગ અને મકાન વિભાગ, ગુજરાત સરકાર

સંચાલકો

શ્રી એસ. બી. વસાવા, સચિવ, માર્ગ અને મકાન વિભાગ, ગુજરાત સરકાર

શ્રી દિનેશ નિમાવત, નાણા સલાહકાર, માર્ગ અને મકાન વિભાગ, ગુજરાત સરકાર

શ્રી પ્રકાશ મકવાણા, નાયબ સચિવ, મહેસૂલ વિભાગ, ગુજરાત સરકાર

શ્રી સુરેશ પટેલ, મુખ્ય કારોબારી અધિકારી, સુર્યા ગ્રુપ

ઓડીટર

મે. ઇનાની એન્ડ ઇનાની, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, અમદાવાદ

બેંક

યુનિયન બેંક

રજિસ્ટર્ડ ઓફીસ

ભોયતળીયે, નિર્માણ ભવન, સેક્ટર-૧૦ એ, ગાંધીનગર-૩૮૨૦૧૦

નિયામક મંડળનો અહેવાલ

પ્રતિ,

સભાસદો

કંપનીના કામકાજ અને વ્યાપાર અંગેનો, ૩૧ માર્ચ, ૨૦૨૧ અંતિત ૨૨મો વાર્ષિક અહેવાલ અને એ જ તારીખે પૂરા થતાં વર્ષ માટેના ઓડિટ કરેલા નાણાંકીય પત્રકો રજૂ કરતાં આપના નિયામકો આનંદ અનુભવે છે.

૧. કંપનીની નાણાંકીય સમીક્ષા અથવા મુખ્ય કામગીરીનું વર્ણન :

તારીખ ૩૧મી માર્ચ, ૨૦૨૧ના રોજ પૂરા થતાં વર્ષ માટેની કંપનીની નાણાંકીય કામગીરી ટૂંકમાં નીચે મુજબ છે.

(રૂપિયા લાખમાં)

વિગતો	૨૦૨૦-૨૧	૨૦૧૯-૨૦૨૦
આવક		
કામગીરીમાંથી આવક	૮૦૮૭.૭૭	૭૨૨૬.૮૦
અન્ય આવક	૪૨૬.૨૯	૫૮૯.૪૨
કુલ આવક	૮૫૧૪.૦૬	૭૮૧૬.૨૨
ખર્ચ		
અન્ય સંચાલનલક્ષી અને વહીવટી ખર્ચ	૬૩૮૭.૯૨	૭૨૪૬.૯૫
ઘસારો અને ઋણમુક્તિ અંગેનું ખર્ચ	૪૨૬.૫૪	૪૨૩.૩૦
કુલ ખર્ચ	૬૮૧૪.૪૬	૭૬૭૦.૨૫
અગાઉના સમયગાળાની બાબતો અને કરવેરાં પહેલાનો નફો	૧૬૯૯.૫૯	૧૪૫.૯૭
અગાઉના સમયગાળાનું સમાયોજન		૯૨.૯૫
કરવેરા પહેલાંનો નફો	૧૬૯૯.૫૯	૨૩૮.૯૨
કરવેરા સંબંધી ખર્ચ		
(ક) ચાલુ કરવેરા	૪૮૨.૨૧	૩૯.૮૮
(ક) મેટ ક્રેડિટ એંટાઇટલમેન્ટ	(૩.૬૫)	(૨૮.૧૬)
(ખ) વિલંબિત કરવેરા અંગેની જવાબદારી (મિલકતો)	૨૧.૮૨	૫૭.૩૯
(ગ) પાછળના વર્ષના કરવેરા		(૪.૪૯)
કરવેરા પછીનો ચોખ્ખો નફો	૧૧૯૯.૨૦	૧૭૪.૩૦
શેર દીઠ આવક/ (ખોટ)	૨૩.૯૮	૩.૪૯

૨. વર્ષ દરમિયાન કંપનીએ કરેલી કામગીરીનું ટૂંકુ વર્ણન :

આપનું નિગમ, જાહેર- ખાનગી ભાગીદારીના ધોરણે તેમજ જાહેર ભંડોળનો ઓછામાં ઓછો ખર્ચ થાય એવા અન્ય પ્રકારે માર્ગો તૈયાર કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય ધરાવતું ગુજરાત સરકારની સંપૂર્ણ માલિકીની કંપની તરીકે સ્થાપવામાં આવેલું નિગમ છે. આ કંપની પૂર્વબાંધકામ પ્રવૃત્તિઓ સહિત, આવી તમામ પરિયોજનાઓ સંબંધી પ્રવૃત્તિઓ હાથ ધરે છે.

સમીક્ષા હેઠળનાં વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન કંપનીએ મુખ્યત્વે નીચે મુજબના પ્રોજેક્ટ્સ/ પ્રવૃત્તિઓ હાથ ધર્યાં છે.

- સંચાલન અને નિભાવ હેઠળ કુલ સાત પરિયોજનાઓ - હિંમતનગર બાઇપાસ, ભુજ-નખત્રાણા, કિમ-માંડવી અને ડીસા-પાંથાવાડા -ગુંદરી તથા ૩ વી.જી.એફ. માર્ગ પરિયોજનાઓની કામગીરી ચાલુ છે અને નિભાવ કામગીરી કરવામાં આવી છે.
- બગોદરા-તારાપુર-વાસદ માર્ગને છ-માર્ગીય બનાવવા માટેના કન્સેશન એગ્રીમેન્ટ ૧૩/૦૨/૨૦૧૧ના રોજ કન્સેશનર સાથે કરવામાં આવ્યા હતા. જે જરૂરી પ્રગતિ ન થવાના કારણે સમાપ્ત કરવામાં અને પડતા મૂકવામાં આવ્યા છે. મોડીફાઇડ અન્યુઇટીના આધારે બે પેકેજોના નવા ટેન્ડરો મંજૂર કરવામાં આવ્યાં હતાં અને બાંધકામ ચાલુ થયું છે.
- ભુજ-ભયાઉ માર્ગ પરિવહન માટેના કન્સેશન એગ્રીમેન્ટ તા.૧૩/૦૭/૨૦૧૧ના રોજ કરવામાં આવ્યા હતા. આ કામ ચાલુ હતું અને એના પર દેખરેખ નિયંત્રણ રાખવામાં આવતું હતું અને પરિયોજનાસંબંધી બાબતો પર ધ્યાન આપવામાં આવતું હતું, જેથી તે ઝડપથી પૂરું કરી શકાય.
- ભુજ-નખત્રાણા માર્ગ માટે કન્સેશનર એમ.એસ.કે. ભુજ નખત્રાણા ટોલ રોડ પ્રા. લિ. (એમ.એસ.કે. પ્રોજેક્ટ લિમિટેડ સાથે જોડાણ) સાથે અમલ કરાયેલ કન્સેશન કરાર, કામગીરી અને જાળવણીની જવાબદારી પૂર્ણ ન થવાને કારણે સમાપ્ત કરવામાં આવ્યો છે. જીએસઆરડીસી તરફથી કન્સેશનર સામે આબિટ્રેશનમાં દાવાઓ રજૂ કરેલ છે.
- જીએસઆરડીસી દ્વારા ભરૂચ-દહેજ રસ્તાને છ-માર્ગીય કરી તેના પર ટોલ ઉઘરાવવાનું કામ તા.૧૬મી ફેબ્રુઆરી ૨૦૧૭થી ચાલુ કરવામાં આવેલ, જેના પરિણામે નિગમની આવકમાં વધારાનો સ્રોત ઊભો થયેલ છે. તેના નિભાવની કામગીરી જીએસઆરડીસી સંભાળે છે.
- જીએસઆરડીસી દ્વારા સુરત-બારડોલી માર્ગને ચાર માર્ગીય બનાવવાનું કામ (લગભગ ૧૫ માઈલ લંબાઈના માર્ગ કામો) ઘણા વખત પહેલા પૂરું થઈ ચૂક્યું છે. દાસ્તાન ફાટક, સુરત-બારડોલી માર્ગ ખાતે ચાર માર્ગીય આર.આર.બી. પ્રવેશોનું કામ ચાલુ રહ્યું હતું.
- ચીખલી-સાપુતારા માર્ગ માટે વિગતવાર પ્રગતિ અહેવાલ તૈયાર કરવા માટે કન્સલ્ટન્ટ, હાઈવે એન્જિનિયરિંગની નિમણૂક કરવામાં આવી છે. કન્સલ્ટન્ટ જિઓ ડિઝાઇન્સ એન્ડ રિસર્ચ પ્રાઇવેટ લિમિટેડની નિમણૂક સયાણા આર.આર.બી.નો વિગતવાર પ્રગતિ અહેવાલ તૈયાર કરવા માટે કરવામાં આવી છે. જમીન સંપાદનની કામગીરી તા.૧૯/૦૩/૨૦૨૧ના રોજ પૂરી કરવામાં આવી છે.

૩. ડિવિડન્ડ :

કંપનીનો નફો કંપનીના જ વિકાસ માટે વાપરવાના દૃષ્ટિકોણથી આપના નિયામકો ૩૧ માર્ચ, ૨૦૨૧ અંતિત નાણાકીય વર્ષ માટે કોઈ ડિવિડન્ડની ભલામણ કરતા નથી.

૪. અનામતોની તબદિલી :

નિયામક મંડળે વર્ષનો રૂ. ૧૧૯૯.૨૦ લાખ (આશરે)નો ચોખ્ખો નફો અનામત અને પુરાંત ખાતે તબદિલ કર્યો છે.

૫. આ નાણાકીય પત્રકો જેની સાથે સંકળાયેલાં છે અને અહેવાલની તારીખ જે વર્ષની છે, તે નાણાકીય વર્ષના અંતે કંપનીની નાણાકીય સ્થિતિને અસર કરતાં વાસ્તવિક ફેરફારો અને પ્રતિબદ્ધતા :

આ નાકીય પત્રકો જેની સાથે સંકળાયેલાં છે અને અહેવાલની તારીખ જે વર્ષની છે, તે નાણાકીય વર્ષના અંતે કંપનીની નાણાકીય સ્થિતિની અસર કરતાં હોય તેવાં વાસ્તવિક ફેરફારો અને પ્રતિબદ્ધતા નથી.

૬. શેર મૂડી :

કંપની, રૂપિયા ૧૦નો એક એવાં ૫૦,૦૦,૦૦૦ શેર્સમાં વિભાજીત એવી રૂ. ૫,૦૦,૦૦,૦૦૦ (રૂ. પાંચ કરોડ)ની અધિકૃત શેરમૂડી ધરાવે છે. આ પ્રત્યેક શેર ઇશ્યુ થયેલાં, સબસ્ક્રાઇબ થયેલાં અને ભરપાઈ થયેલાં છે. તા.૩૧મી માર્ચ, ૨૦૨૧ના રોજ કંપનીની ભરપાઈ થયેલી શેરમૂડી રૂ. ૫,૦૦,૦૦,૦૦૦ (રૂ. પાંચ કરોડ) છે.

૭. નિયામકો અને મહત્વનો વ્યવસ્થાપકિય કર્મચારી વર્ગ :

સમીક્ષા હેઠળના વર્ષ દરમિયાન નીચે મુજબના ફેરફારો કરવામાં આવ્યાં છે. અહેવાલની તારીખે નિયામક મંડળની વિગત નીચે મુજબ છે.

ક્રમ નં.	નામ, પિતાનું નામ, સરનામું	ડી.આઇ.એન. / પી.એ.એન.	હોદ્દો	નિમણૂકની તારીખ	હોદ્દો છોડ્યાની તારીખ
૧.	શ્રી પૂર્ણેશકુમાર ઇશ્વરલાલ મોદી ઇશ્વરલાલ મોદીના પુત્ર સરનામું: ૪/સંઘધામ રો હાઉસીસ, અડાજણ ફાયર સ્ટેશન પાસે, અડાજણ, સુરત - ૩૯૫૦૦૯	૦૯૪૨૪૯૦૦	નિયામક	૨૩/૦૯/૨૦૨૧	ચાલુ
૨.	શ્રી નીતિનકુમાર રતિલાલ પટેલ, શ્રી રતિલાલ મંગલજીલાલ પટેલના પુત્ર સરનામું : નંબર-૮, મણિચંન્દ્ર, ભાગ- ૪, સુરધારા સર્કલ પાસે, થલતેજ, અમદાવાદ, ગુજરાત-૩૮૨૦૦૫૯	૦૬૯૩૬૮૩૮	નિયામક	૨૦-૬-૨૦૧૪	૨૩/૦૯/૨૦૨૧

૩.	શ્રી અશોકભાઈ કે. પટેલ સરનામું: ૨૦૧ ઇ૧ ટાવર, સમર્પણ ફ્લેટ્સ, ગવર્નમેંટ ઓફિસર્સ કોલોની, આઈડીબીઆઈ ક્વાર્ટર્સ સામે, ગુલબાઈ ટેકરા, અમદાવાદ	૦૦૯૪૦૩૬૯૪	વહીવટી સંચાલક	૧૨/૧૦/૨૦૨૧	ચાલુ
૪.	શ્રી હરેશકુમાર સી. મોદી શ્રી ચંદુલાલ મોદીના પુત્ર સરનામું: ૩૧/બી, ટ્યુલિપ બંગલોઝ, પાર્ટ-૨, સુરધારા સર્કલ પાસે, થલતેજ, અમદાવાદ, ગુજરાત- ૩૮૦૦૫૪	૦૮૬૨૬૩૧૬	વહીવટી સંચાલક	૦૬/૦૯/૨૦૧૯	૧૨/૧૦/૨૦૨૧
૫.	શ્રી અશ્વિની કુમાર યાદવ, શ્રી રાજેન્દ્રપ્રસાદ યાદવના પુત્ર સરનામું : બંગલા નં. ૨૧૫/એ, 'ખ' ટાઇપ, સેક્ટર-૧૯, ગાંધીનગર, ગુજરાત-૩૮૨૦૧૯	૦૬૫૮૧૭૫૩	નામનિયુ ક્ત	૨૧-૧૦-૨૦૧૬	૧૧/૧૧/૨૦૧૧
૬.	શ્રી સંદીપ ભાનુભાઈ વસાવા, શ્રી ભાનુભાઈ વસાવાના પુત્ર સરનામું : 'ખ'-૧૮, સેક્ટર-૧૯, ગાંધીનગર, ગુજરાત-૩૮૨૦૧૯	૦૨૦૩૭૯૧૮	નામનિયુ ક્ત	૦૭-૦૯-૨૦૧૬	ચાલુ
૭.	શ્રી ડી.બી. નિમાવત શ્રી હેમંતરામ ગોડીયાના પુત્ર સરનામું: "સ્પંદન" પ્લોટ નં - ૧૧૬/૧, ઇંકવાઈરી ઓફિસ પાછળ, સેક્ટર - ૭-સી, ગાંધીનગર, કોલકોતા-૭૦૦૦૬૭, ગુજરાત- ૩૮૨૦૧૯	૦૮૯૩૭૦૧૦	નામનિયુ ક્ત	૦૧/૦૫/૨૦૨૧	ચાલુ
૮.	શ્રી બાબુજી ગુલાબજી, શ્રી ગુલાબજી વાઘેલાના પુત્રસરનામું: પ્લોટ નં-૧૨૨૮૨ સેક્ટર ૪સી, ગાંધીનગર	-	નામનિયુ ક્ત	૦૭/૦૯/૨૦૨૦	૩૦/૦૪/૨૦૨૧
૯	શ્રી પ્રકાશ મકવાણા શ્રી નારણભાઈ મકવાણાના પુત્ર સરનામું: ૨, ચંદન, એસબીઆઈ સ્ટાફ સોસાઈટી, એસ.ટી વર્કશોપ પાસે,	૦૮૬૭૨૬૮૨	નિયમક	૨૨/૦૮/૨૦૧૯	ચાલુ

	બહેરામપુરા, અમદાવાદ, ગુજરાત-૩૮૦૦૨૧				
૧૦.	શ્રી સુરેશભાઈ ડાહ્યાભાઈ પટેલ, શ્રી ડાહ્યાભાઈ પુરુષોત્તમદાસ પટેલના પુત્ર સરનામું : ૨૫, શાલિન બંગ્લોઝ, સોમેશ્વર પાર્ક આઈ-૨ની સામે, ગુલાબ ટાવર નજીક, થલતેજ, અમદાવાદ, ગુજરાત-૩૮૦૦૫૪	૧૬૬૬૯૫૯	નિયામક	૨૬-૬-૨૦૧૪	ચાલુ
૧૧	શ્રીમતી દૃષ્ટી ગૌરવ વેસાસી, શ્રી જીતેન્દ્ર પંડ્યાના પુત્રી સરનામું : ૬૧, દ્વારકેશ ટાવર, બોડકદેવ, અમદાવાદ, ગુજરાત- ૩૮૦૦૫૪	બીએવાયપીપી ૭૪૫૧એચ	સેક્રેટરી	૨૯/૦૯/૨૦૧૬	૧૪/૦૬/૨૦૨૧
૧૨.	શ્રીમતી શીતલ અમીત શાહ સરનામું: પ્લોટ નં-૧૨/૧, સેક્ટર નં-૪-એ, ગાંધીનગર	ઇએફડબલ્યુપી એસ૦૧૯૮એ	ઇન ચાર્જ સેક્રેટરી	૧૪/૦૬/૨૦૨૧	ચાલુ

૮. કર્મચારીઓની વિગતો :

ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિયમ લિ. એ લિસ્ટેડ કંપની ન હોવાથી કલમ ૧૯૭(૧૨) તેમજ કંપનીઝ (એપોઇન્ટમેન્ટ એન્ડ રેમ્યુનેશન ઓફ મેનેજરીયલ પર્સોનેલ) રુલ્સ-૨૦૧૪, કર્મચારીઓની વિગતો અંગેનું પત્રક દર્શાવવાનું કંપનીને લાગુ પડતું નથી.

૯. બેઠકો :

વર્ષ દરમિયાન નિયામક મંડળની છ બેઠકો અનુક્રમે તારીખ : ૨૯-૦૬-૨૦૨૨, ૨૯-૧-૨૦૨૦, ૨૯-૧૨-૨૦૨૦, અને ૨૯-૦૩-૨૦૨૧ના રોજ યોજવામાં આવી હતી. બે બેઠકો વચ્ચેનો ગાળો કંપની અધિનિયમ ૨૦૧૩ હેઠળ નિયત કરવામાં આવેલાં સમયગાળાની અંદરનો હતો.

૧૦. નિયામક મંડળનું મૂલ્યાંકન :

કંપની અધિનિયમ ૨૦૧૩ની જોગવાઈઓને અનુસરીને, ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ લિમિટેડ એ રાજ્ય સરકારની કંપની છે. નિયામક મંડળની નિમણૂક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. મંત્રાલયનાં તારીખ : ૫-૬-૨૦૧૫નાં જાહેરનામા મુજબ કંપનીને અધિનિયમની કલમ ૧૩૪(૩)ના ખંડ (પી)ની જોગવાઈમાંથી મુક્તિ આપવામાં આવી છે.

૧૧. ઓડિટર્સ :

વર્ષ ૨૦૨૦-૨૧ માટે ભારતના કોમ્પ્રોલર અને ઓડિટર જનરલે તેઓના તા. ૧૬-૧૦-૨૦૨૦ના પત્ર ક્રમાંક : સીએ.વી./૩૩-૯૯/૬૮૯થી મેસર્સ ઇનાની એન્ડ ઇનાની, એકાઉન્ટન્ટ, અમદાવાદને નિગમના વૈધાનિક ઓડિટર તરીકે નિમ્ત્રા છે.

૧૨. ઓડિટરોનો અહેવાલ :

ઓડિટરોના અહેવાલમાં, કોઈ ટિકા-ટિપ્પણનો સમાવેશ થતો નથી. તેમના અહેવાલમાં હિસાબો અંગેની નોંધો અને ઓડિટરોની રિમાર્ક્સ સ્વયંસ્પષ્ટ છે અને તે અંગે કોઈ વધુ ટિકા-ટિપ્પણો કરવાના રહેતાં નથી.

૧૩. આંતરિક ઓડિટ અને નિયંત્રણ :

આંતરિક ઓડિટરો મેસર્સ જે.એસ. મહેશ્વરી એન્ડ કંપની, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના અહેવાલના તારણોની ચર્ચા “પ્રોસેસ ઓનર્સ” સાથે કરવામાં આવી છે અને કામગીરીની કાર્યક્ષમતા સુધારવા માટે ચાલુ ધંધાના આધારે, નિર્દેશ મુજબ યોગ્ય ઉપાયાત્મક પગલાં લેવામાં આવ્યાં છે.

૧૪. વાર્ષિક રીટર્નની તારીખ :

કંપની અધિનિયમ ૨૦૧૩ની કલમ ૯૨(૩) અને કંપનીઝ (મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન) રુલ્સ, ૨૦૧૪ના નિયમ ૧૨(૧)ની જોગવાઈ મુજબ વાર્ષિક રીટર્નની તારીખ એમ.જી.ટી-૯ રૂપે આ વાર્ષિક અહેવાલના ભાગ તરીકે જોડાણ-૧થી સામેલ છે.

૧૫. આ નાણાંકીય પત્રકો જેની સાથે સંકળાયેલાં છે અને અહેવાલની તારીખ જે વર્ષની છે, તે નાણાંકીય વર્ષના અંતે કંપનીની નાણાંકીય સ્થિતિને અસર કરતાં વાસ્તવિક ફેરફારો અને પ્રતિબદ્ધતા :

આ નાણાંકીય પત્રકો જેની સાથે સંકળાયેલાં છે અને અહેવાલની તારીખ જે વર્ષની છે તે નાણાંકીય વર્ષના અંતે કંપનીની નાણાંકીય સ્થિતિની અસર કરતાં હોય તેવાં વાસ્તવિક ફેરફારો અને પ્રતિબદ્ધતા નથી.

૧૬. વર્ષ દરમિયાન કંપનીના ચાલુ ધંધાને તથા કંપનીની ભાવિ કામગીરીને અસર કરે એવા કોઈ મહત્વના અને વાસ્તવિક હુકમો કોઈ રેગ્યુલેટર અથવા કોર્ટ અથવા ટ્રિબ્યુનલે બહાર પાડ્યાં નથી.

૧૭. કલમ ૧૮૬ હેઠળ લોન, ગેરંટી અથવા રોકાણો અંગેની વિગતો :

લોન અંગેની વિગતો	:	રૂ.૬૦૪.૧૨ કરોડ
રોકાણો અંગેની વિગતો	:	શૂન્ય
પૂરી પાડવામાં આવેલી ગેરંટી/ સિક્યુરીટી અંગેની વિગતો	:	શૂન્ય

*આ અંગેની જરૂરી વિગતો નાણાંકીય પત્રકોના સંબંધિત ભાગમાં દર્શાવવામાં આવી છે.

૧૮. સંબંધિત પાર્ટીઓ સાથે કરવામાં આવેલાં કરારો અથવા એગ્રીમેન્ટ :

વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન, કંપની અધિનિયમ ૨૦૧૩ની કલમ ૧૮૮ની પેટા કલમ (૧)માં જણાવવામાં આવેલ સંબંધિત પાર્ટીઓ સાથે કંપનીએ કરેલા કરાર અથવા ગોઠવણની વિગત શૂન્ય છે.

૧૯. સેકસ્યુઅલ હેરેસમેન્ટ ઓફ વિમેન એટ વર્કપ્લેસ (પ્રિવેન્શન, પ્રોહિબિશન એન્ડ રિડ્રેસલ) એક્ટ-૨૦૧૩ હેઠળ કંપનીની જવાબદારી :

કામકાજના સ્થળે સ્ત્રીઓની જાતિય સતામણી થતી રોકવા તારીખ ૯મી ડિસેમ્બર ૨૦૧૩ના રોજ “ધ સેકસ્યુઅલ હેરેસમેન્ટ ઓફ વુમન એટ વર્કપ્લેસ (પ્રિવેન્શન, પ્રોહિબિશન એન્ડ રિડ્રેસલ) એક્ટ-૨૦૧૩” બહાર પાડવામાં આવ્યો છે. આ અધિનિયમ હેઠળ કોઈ પણ સ્ત્રી કર્મચારીની કામના સ્થળે થતી જાતિય સતામણી અંગેની ફરિયાદની તપાસ કરવા માટે દરેક કંપનીએ આંતરિક ફરિયાદ સમિતિ ઊભી કરવી જરૂરી છે.

કંપનીએ કામકાજના સ્થળે સ્ત્રીઓની જાતિય સતામણી થતી રોકવા માટે એક નીતિ અપનાવી છે અને તેના અમલ માટે એક સમિતિ રચી છે. વર્ષ દરમિયાન કંપનીને સતામણીની કોઈ ફરિયાદ મળી નથી.

૨૦. ઊર્જા સંવર્ધન, ટેકનોલોજી ગ્રહણ, વિદેશી હુંડીયામણની અને ખર્ચ :

કંપની અધિનિયમ ૨૦૧૩ની કલમ ૧૩૪(એમ)ની જોગવાઈ કંપનીને લાગુ પડતી નથી. સમીક્ષા હેઠળના વર્ષ દરમિયાન આપની કંપનીએ વિદેશી હુંડીયામણમાં કોઈ આવક કે ખર્ચ કર્યા નથી.

૨૧. નિગમિત સામાજિક જવાબદારીઓ (સી.એસ.આર.) :

કંપનીઝ (કોર્પોરેટ સોશ્યલ રીસ્પોન્સીબીલીટી પોલીસ) રુલ્સ, ૨૦૧૪ના નિયમ-૯ મુજબની જાહેરાત કરવાનું ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ લિમિટેડને લાગુ પડશે. સી.એસ.આર જવાબદારી હેઠળ જરૂરી રકમ આપની કંપનીએ સમય મર્યાદામાં ખર્ચી નથી. આમ છતાં, આપની કંપનીએ ના.વ. ૨૦૨૦-૨૧ માટેની સી.એસ.આર. જવાબદારીની રકમ ના.વ. ૨૦૨૧૨૨માં ખર્ચવાનું નક્કી કર્યું છે.

૨૨. નિયામકોનું જવાબદારી પત્રક :

કંપની અધિનિયમ-૨૦૧૩ની કલમ- ૧૩૪ પેટા કલમ-૩ના ખંડ (સી)માં જણાવ્યા મુજબ નિયામક મંડળના અહેવાલ સાથે નિયામકોની જવાબદારીનું પત્રક રજૂ કરવું જરૂરી છે. નિયામક મંડળ આ સાથે નિયામકોની જવાબદારીનું નીચે મુજબનું પત્રક રજૂ કરે છે.

ક. વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં, હિસાબના લાગુ પડતાં ધોરણોનું યોગ્ય ખુલાસાઓ સાથે પાલન કરવામાં આવ્યું હતું.

ખ. નાણાકીય વર્ષના અંતે કંપનીના કામકાજની અને તે સમયગાળા દરમિયાન થયેલા નફા અને નુકસાનની સ્થિતિનું સાચું અને યોગ્ય ચિત્ર રજૂ કરી શકાય એ માટે વિવેકપૂર્ણ હિસાબી નીતિઓ પસંદ કરવામાં આવી છે અને તે નિરંતર લાગુ પાડવામાં આવી છે.

ગ. કંપનીની મિલકતોની સુરક્ષા માટે તથા છેતરપીંડી અને અનિયમિતતાઓ નિવારવા માટે, કંપની અધિનિયમની જોગવાઈઓ મુજબ, પર્યાપ્ત હિસાબી રેકર્ડ જાળવવામાં માટે યોગ્ય અને પૂરતી કાળજીલેવામાં આવી છે.

ઘ. વાર્ષિક હિસાબો ચાલુ કામકાજના ધોરણો તૈયાર કરવામાં આવ્યા છે.

ચ. લાગુ પડતા તમામ કાયદાઓની જોગવાઈઓનું પાલન થાય એવી પદ્ધતિઓ નિયામકોએ ઘડી છે અને આ પદ્ધતિઓ પર્યાપ્ત હોય અને અસરકારકરીતે કામ કરે એ સુનિશ્ચિત કર્યું છે.

૨૩. ઓડિટ સમિતિ

૩૧/૦૩/૨૦૨૧ના રોજ ઓડિટ સમિતિની રચના નીચે મુજબ હતી

ક્રમ નં.	નિયામકનું નામ	હોદ્દો
૧	શ્રી બી.જી. વાઘેલા	અધ્યક્ષ
૨	શ્રી સુરેશ પટેલ	સભ્ય

૨૪. નામનિયુક્તિ અને મહેનતાણાં સમિતિ

૩૧/૦૩/૨૦૨૧ના રોજ નામનિયુક્તિ અને મહેનતાણાં સમિતિની રચના નીચે મુજબ હતી

ક્રમ નં.	નિયામકનું નામ	હોદ્દો
૧	શ્રી પ્રકાશ મકવાણા	અધ્યક્ષ
૨	શ્રી સુરેષ પટેલ	સભ્ય

૨૪. ઋણ સ્વીકાર :

આપના નિયામકો માર્ગ અને મકાન વિભાગ, ગુજરાત સરકાર, ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ, કંપનીના બેન્કર્સ, પરામર્શકો અને સહયોગીઓ તરફથી મળેલા નિરંતર સહકાર અને સલાહ બદલ તેઓનો આભાર માને છે. તેઓના સહકાર અને સલાહથી જ આપની કંપની યશસ્વી કામગીરી કરી શકે છે.

આપના નિયામકો કંપનીના વિકાસ માટે કંપનીના કર્મચારીઓએ તમામ સ્તરોએ પૂરા પાડેલા સહકાર બદલ તેઓનો હૃદયપૂર્વક આભાર માને છે.

નિયામક મંડળના નામે અને તેમના વતી

પૂર્ણેશકુમાર મોદી

અધ્યક્ષ

સ્થળ : ગાંધીનગર

તારીખ : ૨૨/૦૨/૨૦૨૨

જોડાણ સૂચિ

જોડાણ	વિષય
૧	એમ.જી.ટી.-૦૯માં વાર્ષિક રિટર્નની તારીખ
૨	ઓડિટરોનો અહેવાલ અને વાર્ષિક હિસાબો
૩.	એમ.જી.ટી.-૧૧ (પ્રોક્સી)

જોડાણ- ૧

ફોર્મ નં. એમ.જી.ટી.-૯
વાર્ષિક રિટર્નની તારીખ

૩૧-૩-૨૦૨૧ અંતિત નાણાંકીય વર્ષના રોજ મુજબ

કંપની અધિનિયમ ૨૦૧૩ની કલમ ૯૨(૩) અને કંપની (મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન) રુલ્સ-૨૦૧૪ના નિયમ ૧૨(૧) મુજબ -

૧. રજિસ્ટ્રેશન અને અન્ય વિગતો

૧.	સી.આઇ.એન.	યુ-૪૫૨૦૦ જીજી-૧૯૯૯ એસ.જી.સી.ઓ. ૩૫૯૯૫
૨.	નોંધણી તારીખ	૧૨-૦૫-૧૯૯૯
૩.	કંપનીનું નામ	ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ.
૪.	કંપનીની કક્ષા / પેટા કક્ષા	શેર્સથી લિમિટેડ કંપની ગુજરાત રાજ્યની માલિકીની કંપની
૫.	નોંધાયેલી કચેરીનું સરનામું અને સંપર્કની વિગતો	ભોંયતળીયું, નિર્વાણ ભવન, સેક્ટર-૧૦-એ, ગાંધીનગર, ગુજરાત-૩૮૨૦૧૦ ફોન : + ૯૧-૭૯-૨૩૨૫૨૦૯૦ ઇમેઇલ : info@gsrdc.com વેબસાઇ : www.gsrddc.com
૬.	કંપની લિસ્ટેડ છે?	ના
૭.	કોઇ રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ હોય તો તેનું નામ, સરનામું અને સંપર્કની વિગતો	લાગુ પડતું નથી.

૨. કંપનીની મુખ્ય વ્યાપારી પ્રવૃત્તિઓ

(કંપનીના કુલ ટર્ન ઓવરના ૧૦ ટકા કે વધુ ફાળો ધરાવતી તમામ વ્યાપારી પ્રવૃત્તિઓ જણાવવી)

ક્રમ નં.	મુખ્ય ઉત્પાદન/ સેવાઓનું નામ અને વર્ણન	ઉત્પાદન/ સેવાનો એન.આઇ.સી.નો કોડ	કંપનીના કુલ ટર્નઓવરમાં ટકાવારી
૧.	બાંધકામ (માર્ગ વિકાસ)	૪૫	૧૦૦%

૩. શેર હોલ્ડિંગની પેટર્ન (કુલ ઇક્વિટીની ટકાવારી તરીકે ઇક્વિટી શેર મૂડીનું વિભાજન)

કક્ષાવાર શેર હોલ્ડિંગ

શેર હોલ્ડર્સની કક્ષા	વર્ષની શરૂઆતમાં (૧ એપ્રિલ ૨૦૨૦ના રોજ) ધારણ કરેલા શેર્સની સંખ્યા				વર્ષના અંતે (૩૧મી માર્ચ, ૨૦૨૧ના રોજ ધારણ કરેલા શેર્સની સંખ્યા				વર્ષ દરમિયાન ટકાવારી માં ફેરફાર
	ડીમેટ	વાસ્તવિક	સરવાળો	કુલ શેર્સની ટકાવારી	ડીમેટ	વાસ્તવિક	સરવાળો	કુલ શેર્સની ટકાવારી	
(ક) પ્રમોટર્સ									
(૧) ભારતીય									
(ક) વ્યક્તિ/ હિન્દુ સંયુક્ત કુટુંબ	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
(ખ) કેન્દ્ર સરકાર	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
(ગ) રાજ્ય સરકારી(રો)	શૂન્ય	૫૦,૦૦,૦૦૦	૫૦,૦૦,૦૦૦	૧૦૦	શૂન્ય	૫૦,૦૦,૦૦૦	૫૦,૦૦,૦૦૦	૧૦૦	શૂન્ય
(ઘ) બોડી કોર્પોરેટ	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
(ચ) બેન્કર્સ/ ના.સં.	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
(છ) અન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
(ક) પ્રમોટરનું કુલ શેર હોલ્ડિંગ	શૂન્ય	૫૦,૦૦,૦૦૦	૫૦,૦૦,૦૦૦	૧૦૦	શૂન્ય	૫૦,૦૦,૦૦૦	૫૦,૦૦,૦૦૦	૧૦૦	શૂન્ય
ખ. જાહેર શેર હોલ્ડિંગ									
૧. સંસ્થાઓ									
(ક) મ્યુચ્યુઅલ ફંડઝ	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય

(ખ) બેન્કર્સ / ના.સં.	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
(ગ) કેન્દ્ર સરકાર	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
(ઘ) રાજ્ય સરકાર(રો)	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
(ચ) વેન્યર કેપિટલ ફન્ડઝ	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
(છ) વિમા કંપનીઓ	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
(જ) એફ. આઇ.આઇ.	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
(ઝ) ફોરેન વેન્યર કેપિટલ ફન્ડઝ	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
(ટ) અન્ય (જણાવો)	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
પેટા-સરવાળો (ખ)(૧):	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
૨. બિન-સંસ્થા									
(ક) બોડી કોર્પોરેટ	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
(૧) ભારતીય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
(૨) દરિયાપારની	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
(ખ) વ્યક્તિઓ	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
૧. રૂપિયા એક લાખ સુધીની નજીવી શેર મૂડી ધારણ કરનાર વ્યક્તિગત શેર હોલ્ડર્સ	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
૨. રૂપિયા એક લાખથી વધુ રકમની નજીવી શેર મૂડી ધારણ કરનાર વ્યક્તિગત શેર હોલ્ડર્સ	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય

(ગ) અન્ય (જણાવો)	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
બિન નિવાસી ભારતીયો	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
દરિયાપારની કોર્પોરેટ બોડીઝ	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
વિદેશી નાગરિકતા ધરાવતાં	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
ક્લિયરીંગ મેમ્બર્સ	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
ટ્રસ્ટસ	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
વિદેશી સંસ્થાઓ (ડી.આર.)	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
પેટા સરવાળો. (ખ)(૨)	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
કુલ જાહેર શેર હોલ્ડિંગ (ખ)= (ખ)(૧)+ (ખ)(૨)	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
એકંદરે સરવાળો (ક+ખ+ગ)	શૂન્ય	૫૦,૦૦,૦૦૦	૫૦,૦૦,૦૦૦	૧૦૦	શૂન્ય	૫૦,૦૦,૦૦૦	૫૦,૦૦,૦૦૦	૧૦૦	શૂન્ય

ક્રમ નં.	શેર હોલ્ડરનું નામ	વર્ષની શરૂઆતમાં (૧-૪-૨૦૨૦ના રોજ ધારણ કરેલાં શેર્સની સંખ્યા			વર્ષનાં અંતે (૩૧-૩-૨૦૨૧ના રોજ) ધારણ કરેલાં શેર્સની સંખ્યા			શેર્સની ટકાવારીમાં વર્ષ દરમિયાન ફેરફાર
		શેર્સની સંખ્યા	કંપનીના કુલ શેર્સની ટકાવારી	કુલ શેર્સ પૈકી તારણનાં મૂકેલાં શેર્સની ટકાવારી	શેર્સની સંખ્યા	કંપનીના કુલ શેર્સની ટકાવારી	કુલ શેર્સ પૈકી તારણનાં મૂકેલાં શેર્સની ટકાવારી	
(ખ)	પ્રમોટરોનું શેર હોલ્ડિંગ							
૧.	ગુજરાતના માનનીય રાજ્યપાલશ્રી	૪૯,૯૯,૯૯૩	૧૦૦	શૂન્ય	૪૯,૯૯,૯૯૩	૧૦૦	શૂન્ય	શૂન્ય
૨.	શ્રી અશ્વીનીકુમાર ગજરાતના માનનીય રાજ્યપાલશ્રી સાથે સંયુક્ત રીતે.	૧	શૂન્ય	શૂન્ય	૦	શૂન્ય	શૂન્ય	શૂન્ય
૩.	શ્રી એસ. બી. વસાવા, ગજરાતના માનનીય રાજ્યપાલશ્રી સાથે સંયુક્ત રીતે.	૧	શૂન્ય	શૂન્ય	૧	શૂન્ય	શૂન્ય	શૂન્ય
૪.	શ્રી પી.આર. પટેલીયા, ગજરાતના માનનીય રાજ્યપાલશ્રી સાથે સંયુક્ત રીતે.	૧	શૂન્ય	શૂન્ય	૧	શૂન્ય	શૂન્ય	શૂન્ય
૫.	શ્રી એન. કે. પટેલ, ગજરાતના માનનીય રાજ્યપાલશ્રી સાથે સંયુક્ત રીતે.	૧	શૂન્ય	શૂન્ય	૧	શૂન્ય	શૂન્ય	શૂન્ય
૬.	શ્રી એ. એન. મીસ્ત્રી, ગજરાતના માનનીય રાજ્યપાલશ્રી સાથે સંયુક્ત રીતે.	૧	શૂન્ય	શૂન્ય	૧	શૂન્ય	શૂન્ય	શૂન્ય
૭.	શ્રી એ. એન. મીસ્ત્રી, ગજરાતના માનનીય રાજ્યપાલશ્રી સાથે સંયુક્ત રીતે.	૧	શૂન્ય	શૂન્ય	૧	શૂન્ય	શૂન્ય	શૂન્ય
૮.	શ્રી કે. એમ. પટેલ ગજરાતના માનનીય રાજ્યપાલશ્રી સાથે સંયુક્ત રીતે.	૧	શૂન્ય	શૂન્ય	૧	શૂન્ય	શૂન્ય	શૂન્ય
	સરવાળો...	૫૦,૦૦,૦૦૦	૧૦૦	શૂન્ય	૫૦,૦૦,૦૦૦	૧૦૦	શૂન્ય	શૂન્ય

(ગ) પ્રમોટરોના શેર હોલ્ડિંગમાં ફેરફાર (કોઈ ડેરફાર ન હોય તો સ્પષ્ટ જણાવવું)

ક્રમ નં.	વિગતો	વર્ષની શરૂઆતમાં શેર હોલ્ડિંગ		વર્ષ દરમિયાન એકત્રિત શેરહોલ્ડિંગ	
		શેર્સની સંખ્યા	કંપનીના કુલ શેર્સની ટકાવારી	શેર્સની સંખ્યા	કંપનીના કુલ શેર્સની ટકાવારી
	વર્ષની શરૂઆતમાં	૫૦,૦૦,૦૦૦	૧૦૦	૫૦,૦૦,૦૦૦	૧૦૦
	વર્ષ દરમિયાન શેર હોલ્ડિંગમાં તારીખવાર વધારો/ઘટાડો વધારા/ઘટાડાના કારણો જણાવવા (જેમ કે ફાળવણી/ તબદીલી/ બોનસ/ સ્વીટ ઇક્વિટી વગેરે)	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
	વર્ષના અંતે	૫૦,૦૦,૦૦૦	૧૦૦	૫૦,૦૦,૦૦૦	૧૦૦

(ઘ) સર્વોચ્ચ દસ શેર હોલ્ડર્સના શેર હોલ્ડિંગની પેટર્ન (જીડીઆર અને એડીઆરના નિયામકો, પ્રમોટરો અને હોલ્ડરો સિવાય)

ક્રમ નં.	સર્વોચ્ચ ૧૦ પૈકીના દરેક શેર હોલ્ડર માટે	વર્ષની શરૂઆતમાં શેર હોલ્ડિંગ		વર્ષ દરમિયાન એકત્રિત શેરહોલ્ડિંગ	
		શેર્સની સંખ્યા	કંપનીના કુલ શેર્સની ટકાવારી	શેર્સની સંખ્યા	કંપનીના કુલ શેર્સની ટકાવારી
	વર્ષની શરૂઆતમાં	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
	વર્ષ દરમિયાન શેર હોલ્ડિંગમાં તારીખવાર વધારો/ઘટાડો વધારા/ઘટાડાના કારણો જણાવવા (જેમ કે ફાળવણી/ તબદીલી/ બોનસ/ સ્વીટ ઇક્વિટી વગેરે)	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
	વર્ષના અંતે	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય

(ચ) નિયામકો અને મહત્વના વ્યવસ્થાપકીય કર્મચારીઓનું શેર હોલ્ડિંગ

ક્રમ નં.	પ્રત્યેક નિયામક અને વ્યવસ્થાપકીય કર્મચારીનું શેર હોલ્ડિંગ	વર્ષની શરૂઆતમાં શેર હોલ્ડિંગ		વર્ષ દરમિયાન એકત્રિત શેરહોલ્ડિંગ	
		શેર્સની સંખ્યા	કંપનીના કુલ શેર્સની ટકાવારી	શેર્સની સંખ્યા	કંપનીના કુલ શેર્સની ટકાવારી
	વર્ષની શરૂઆતમાં	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
	વર્ષ દરમિયાન શેર હોલ્ડિંગમાં તારીખવાર વધારો/ઘટાડો વધારા/ઘટાડાના કારણો જણાવવા (જેમ કે ફાળવણી/ તબદીલી/ બોનસ/ સ્વીટ ઇક્વિટી વગેરે)	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
	વર્ષના અંતે	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય

(છ) બાકી વ્યાજ/ ઉપાર્જિત પરંતુ ચુકવવાપાત્ર ન બન્યું હોય એવા વ્યાજ સહિત કંપનીનું દેવું.
(રૂ. લાખમાં)

	થાપણો સિવાયની તારણવાળી લોનો	તારણ વિનાની લોન	થાપણો	કુલ દેવું
નાણાકીય વર્ષની શરૂઆતમાં દેવું				
૧) મુદ્દલ રકમ	શૂન્ય	૩૮૮૩૦.૭૫	શૂન્ય	૩૮૮૩૦.૭૫
૨) ચુકવવાપાત્ર બનેલું પરંતુ ન ચૂકવેલું વ્યાજ	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
૩) ઉપાર્જિત પરંતુ ચુકવવાપાત્ર ન બનેલું વ્યાજ	શૂન્ય	૧૩૧૩.૭૦	શૂન્ય	૧૩૧૩.૭૦
સરવાળો.. (૧ + ૨ + ૩)	શૂન્ય	૪૦૧૪૪.૪૫	શૂન્ય	૪૦૧૪૪.૪૫
નાણાકીય વર્ષ દરમિયાન દેવામાં ફેરફાર				
ઉમેરો	શૂન્ય	૨૧૩૧૧.૪૭	શૂન્ય	૨૧૩૧૧.૪૭
ઘટાડો	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
ચોખ્ખો ફેરફાર	શૂન્ય	૨૧૩૧૧.૪૭	શૂન્ય	૨૧૩૧૧.૪૭

નાણાકીય વર્ષના અંતે દેવું				
૧) મુદ્દલ રકમ	શૂન્ય	૬૦૧૪૨.૨૨	શૂન્ય	૬૦૧૪૨.૨૨
૨) ચુકવવાપાત્ર બનેલું પરંતુ ન ચૂકવેલું વ્યાજ	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
૩) ઉપાર્જિત પરંતુ ચુકવવાપાત્ર ન બનેલું વ્યાજ	શૂન્ય	૧૯૭.૮૧	શૂન્ય	૧૯૭.૮૧
સરવાળો.. (૧ + ૨ + ૩)	શૂન્ય	૬૦૩૪૦.૦૩	શૂન્ય	૬૦૩૪૦.૦૩

૧૧. નિયામકો અને મહત્વના વ્યવસ્થાપકીય કર્મચારીઓનું મહેનતાણું

ક. વહીવટી નિયામક, પૂર્ણકાલિન નિયામક અને/અથવા વ્યવસ્થાપકનું મહેનતાણું

ક્રમ	મહેનતાણાની વિગત	વહીવટી સંચાલકનું નામ
		હરેશકુમાર સી. મોદી (૦૧/૦૪/૨૦૨૦ થી ૩૧/૦૩/૨૦૨૧)
૧.	કુલ પગાર	૧૯.૯૯ લાખ
	(ક) આવક વેરા અધિનિયમ-૧૯૬૧ની કલમ ૧૭(૧)ની જોગવાઈ મુજબ પગાર	શૂન્ય
	(ખ) આવક વેરા અધિનિયમ -૧૯૬૧ની કલમ ૧૭(૨) હઠળના ભથ્થા (તબીબી ખર્ચની પુનઃ ભરપાઈ)ની રકમ	શૂન્ય
	(ગ) આવક વેરા અધિનિયમ-૧૯૬૧ની કલમ ૧૭(૩) હેઠળ પગારના બદલે લાભ	શૂન્ય
૨.	સ્ટોક વિકલ્પ	શૂન્ય
૩.	સ્વીટ ઇક્વિટી	શૂન્ય
૪.	કમિશન - નફાની ટકવારી રૂપે - અન્ય, સ્પષ્ટ જણાવો	શૂન્ય
૫.	અન્ય, સ્પષ્ટ જણાવો	શૂન્ય
	સરવાળો... (ક)	૧૯.૯૯ લાખ
	અધિનિયમ મુજબ ટોચ મર્યાદા	શૂન્ય

ખ. અન્ય નિયામકોને મહેનતાણું

ક્રમ	મહેનતાણાની વિગત	વહીવટી નિયામકનું નામ				કુલ રકમ
		-	-	-	-	
૧.	સ્વતંત્ર નિયામક	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
	બોર્ડ સમિતિની બેઠકમાં હાજરી આપવા માટે ફી	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
	કમિશન	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
	અન્ય, સ્પષ્ટ જણાવો	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
	સરવાળો -૧	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
૨.	અન્ય બિન કારોબારી નિયામકો					
	બોર્ડ સમિતિની બેઠકોમાં હાજરી આપવા માટે ફી	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
	કમિશન	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
	અન્ય, સ્પષ્ટ જણાવો	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
	સરવાળો.. - (૨)	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
	સરવાળો... (૧ + ૨)	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
	વ્યવસ્થાપકીય કામગીરી માટેનું કુલ મહેનતાણતું	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
	અધિનિયમ મુજબ એકંદર ટોચ મર્યાદા	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય

(ગ) વહીવટી નિયામક/ મેનેજર/ પૂર્ણકાલિન નિયામક સિવાયના મહત્ત્વના વ્યવસ્થાપકીય કર્મચારીવર્ગનું મહેનતાણું

ક્રમ નં.	મહેનતાણાની વિગત	મહત્ત્વના વ્યવસ્થાપકીય કર્મચારી			
		મુખ્ય કારોબારી અધિકારી	મુખ્ય નાણાકીય અધિકારી	કંપની સેક્રેટરી	સરવાળો
૧.	કુલ પગાર	શૂન્ય	શૂન્ય	૬.૬૮ લાખ	૬.૬૮ લાખ
	(ક) આવક વેરા અધિનિયમ-૧૯૬૧ની કલમ ૧૭(૧)ની જોગવાઈ મુજબ પગાર	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
	(ખ) આવક વેરા અધિનિયમ -૧૯૬૧ની કલમ ૧૭(૨) હઠળના ભથ્થા (તબીબી ખર્ચની પુનઃ ભરપાઈ)ની રકમ	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય

	(ગ) આવક વેરા અધિનિયમ-૧૯૬૧ની કલમ ૧૭(૩) હેઠળ પગારના બદલે લાભ	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
૨.	સ્ટોક વિકલ્પ	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
૩.	સ્વીટ ઇક્વિટી	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
૪.	કમિશન - નફાની ટકવારી રૂપે - અન્ય, સ્પષ્ટ જણાવો	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
૫.	અન્ય, સ્પષ્ટ જણાવો	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
	સરવાળો... (ક)	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
	અધિનિયમ મુજબ ટોચ મર્યાદા	શૂન્ય	શૂન્ય	૬.૬૮ લાખ	૬.૬૮ લાખ

૧૨. ગુનાઓની સજા/ દંડ/ માંડવાળી

પ્રકાર	કંપની અધિ.ની કલમ	ટ્રેડિંગ વર્ણન	દંડ/ સજા/ લાદવામાં આવેલી ફીની માંડવાળીની વિગતો	સત્તા મંડળ (આર.ડી/ એન.સી.એલ. ટી./ કોર્ટ)	કોઈ અપીલ કરવામાં આવી હોય તો તેની વિગતો આપવી.
(ક) કંપની	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
દંડ	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
સજા	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
માંડવાળી	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
(ખ) નિયામકો	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
દંડ	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
સજા	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
માંડવાળી	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
(ગ) કસૂર કરનાર અન્ય અધિકારીઓ	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
દંડ	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
સજા	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
માંડવાળી	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય

ફોર્મ નં. એમ.જી.ટી. -૧૧

પ્રોક્સી ફોર્મ

(કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ ૧૦૫(૬) અને કંપનીઝ (મેનેજમેન્ટ એન્ડ એડમીનીસ્ટ્રેશન) ડુલ્સ,
૨૦૧૪ના નિયમ ૧૯(૩) મુજબ)

સભ્ય(સ્યો)નું નામ :		
નોંધાયેલું સરનામું :		
ઇ-મેઇલ આઇ.ડી.	ફોલિયો નં./ કલાયન્ટ આઇ.ડી.	ડી.પી. આઇ.ડી.

ઉપર જણાવેલી કંપનીના શેર્સ ધરાવતા સભ્ય હોવાથી હું/ અમેનીચે દર્શાવેલ

નામ :
સરનામું :
સહી, અથવા તે હાજર ન રહેતો

નામ :	ઇ-મેઇલ આઇ.ડી.
સરનામું	
સહી, અથવા તે હાજર ન રહે તો	

નામ :	ઇ-મેઇલ આઇ.ડી.
સરનામું	
સહી, અથવા તે હાજર ન રહે તો	

-ને તા. ૨૨-૦૨-૨૦૨૨ના રોજ બપોરે ૩.૦૦ વાગ્યે ભોંયતળીયે, નિર્માણ ભવન, સેક્ટર-૧૦-એ, ગાંધીનગર, ગુજરાત-૩૮૨૦૧૦ ખાતે નીચે દર્શાવવામાં આવેલા ઠરાવો કરવા માટે મળનાર કંપનીની ૨૨મી વાર્ષિક સામાન્ય સભા ખાતે અથવા તેની મોકુફ રાખવામાં આવેલી કોઇપણ બેઠકમાં મારા/ અમારા પ્રોક્સી તરીકે હાજરી આપવા અને મારા/ અમારા વતી મતદાન કરવા માટે નિયુક્ત કરું છું.

ઠરાવ ક્રમાંક :

ક્રમ નં.	ઠરાવ(વો)	મત	
		તરફેણમાં	વિરોધમાં
૧.	૩૧મી માર્ચ, ૨૦૨૧ અંતિત નાણાકીય વર્ષ માટેના નફા-નુકસાન ખાતા, સરવૈયા, નિયામકો અને ઓડિટરોનો અહેવાલ મંજૂર કરવા		

*ઇલેક્ટ્રોનિક સ્વરૂપે શેર્સ ધારણ કરનારા રોકાણકારોને લાગુ પડે છે.

રેવન્યુ સ્ટેમ્પ

તા..... ના રોજ સહી કરી

શેર હોલ્ડરની સહી

પ્રોકસી હોલ્ડરની સહી

રેવન્યુ સ્ટેમ્પ પર સહી

નોંધ :

- (૧) પ્રોકસી ફોર્મ બેઠક શરૂ થવાના ઓછામાં ઓછા ૪૮ કલાક પહેલાં કંપનીની રજિસ્ટર્ડ ઓફિસમાં જમા કરાવવામાં આવશે તો જ પ્રોકસી માન્ય ગણાશે.
- (૨) પ્રોકસીએ કંપનીના સભ્ય હોવું જરૂરી નથી.

લેટર હેડ
એટેન્ડન્સ સ્લીપ
(બેઠક ખંડના પ્રવેશ દ્વારા આપવી)

વાર્ષિક સામાન્ય સભાની તારીખ : ૨૨મી ફેબ્રુઆરી, ૨૦૨૨

હાજરી આપનાર સભ્યોનું પૂરું નામ :

લેજર ફોલિયો નં. / કલાયન્ટ આઈ.ડી. નં. ધારણ કરેલા શેર્સની સંખ્યા

(સભ્યના બદલે પ્રોકસી હાજરી આપે તો ભરવાનું)

..... (સરનામું)ની તા..... ના રોજ ખાતે મળેલી વાર્ષિક સામાન્ય સભામાં હું મારી હાજરી નોંધાવું છું.

(સભ્ય/ પ્રોકસીની સહી)

નોંધ :

૧. વધુ નકલો ઉપલબ્ધ ન હોવાથી સભ્યોને વાર્ષિક અહેવાલની તેઓની નકલો બેઠકમાં સાથે લાવવા વિનંતી છે.
૨. પ્રોકસી ફોર્મ બેઠક શરૂ થવાના ઓછામાં ઓછા ૪૮ કલાક પહેલાં કંપનીની રજિસ્ટર્ડ ઓફિસમાં જમા કરાવવામાં આવશે તો જ પ્રોકસી માન્ય ગણાશે.
૩. પ્રોકસીએ કંપનીના સભ્ય હોવું જરૂરી નથી.
૪. સંયુક્ત ધારકોના કેસમાં, સિનિયર સભ્ય દ્વારા વ્યક્તિગત રીતે અથવા પ્રોકસી મારફત આપવામાં આવેલો મત સ્વીકારવામાં આવશે. અન્ય સંયુક્ત ધારકોના મત સ્વીકારવામાં આવશે નહીં. સભ્યોના રજિસ્ટરમાં ક્રમવાર નોંધાયેલા નામોના આધારે સિનિયોરીટી નક્કી કરવામાં આવશે.
૫. આ પ્રોકસી ફોર્મ રજૂ કરવામાં આવે તો પણ સંબંધિત સભ્ય બેઠકમાં વ્યક્તિગતરીતે હાજર રહી મત આપી શકશે.

નં. એ.એમ.જી.-૧/ સીએસ/જીએસઆરડીસી/ ૨૦૨૦-
૨૧/ઓડબલ્યુ-૦૧૪૪
તા.૧૧/૦૨/૨૦૨૨

પ્રતિ

વહીવટી નિયામકશ્રી
ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ
નિર્માણ ભવન, ભોંયતળિયે,
સેક્ટર ૧૦-એ, ગાંધીનગર- ૩૮૨૦૧૦

વિષય : ૩૧મી માર્ચ, ૨૦૨૧ના રોજ પૂરા થતા વર્ષ માટે ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના હિસાબોનું ઓડિટ.

શ્રીમાન ,

૩૧મી માર્ચ, ૨૦૨૧ના રોજ પૂરા થતા વર્ષ માટેના ગુજરાત રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના હિસાબો અંગે, કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ ૧૪૩ (૬)(ખ) હેઠળ ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલનું “કોમેન્ટ સર્ટિફિકેટ” પ્રમાણપત્ર આ સાથે સામલ છે.

કંપની અધિનિયમ ૨૦૧૩ની કલમ ૧૪૩ (૬) (ખ) હેઠળ કંપનીએ, ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલનાં ટિકા-ટિપ્પણ અવી પ્રત્યેક વ્યક્તિને મોકલવાં જરૂરી છે જે કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ ૧૩૬(૧) હેઠળ ઓડિટ થયેલાં નાણાકીય પત્રકોની નકલો મેળવવા હકદાર હોય અને આ ટિકા-ટિપ્પણો, કંપનીના વૈધાનિક ઓડિટરોનો અહેવાલ જે સમયે અને જે સ્વરૂપે કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં રજૂ કરવાનો હોય તે જ સમયે અને તે જ સ્વરૂપે રજૂ કરવાનો હોય છે. કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલનો અહેવાલ રજૂ કરવાની તારીખની આ કચેરીને જાણ કરવા વિનંતી છે.

મુદ્રિત હિસાબોની છ નકલ આ કચેરીને મોકલવા વિનંતી.

આ પત્ર મળ્યાની પહોંચ પાઠવશો.

આપનો વિશ્વાસુ,

સહી/-

(નાયબ એકા. જનરલ (એમ.જી.-૧)

બિડાણ : ઉપર મુજબ

તા.૩૧મી માર્ચ, ૨૦૧૮ના રોજ પૂરા થતા વર્ષ માટે, ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના હિસાબો પર કંપની અધિનિયમ ૨૦૧૩ની કલમ ૧૪૩(૬)(બી) હેઠળ ભારતના કોમ્પ્રોલર અને ઓડિટર જનરલનાં ટિકા-ટિપ્પણ.

કંપની અધિનિયમ, ૨૦૧૩ હેઠળ નિર્દિષ્ટ કરવામાં આવેલ નાણાકીય અહેવાલની રૂપરેખા મુજબ, ૩૧મી માર્ચ, ૨૦૧૫ના રોજ પૂરા થતા વર્ષ માટેના ગુજરાત સ્ટેટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના નાણાકીય પત્રકો તૈયાર કરવાની જવાબદારી કંપનીના વ્યવસ્થાપક મંડળની છે. ઉક્ત અધિનિયમની કલમ ૧૩૯(૫) હેઠળ ભારતના કમ્પ્રોલર અને ઓડિટર જનરલ દ્વારા નીમવામાં આવેલા વૈધાનિક ઓડિટરોની જવાબદારી, અધિનિયમની કલમ ૧૪૩(૧૦) નિર્દિષ્ટ કરવામાં આવેલા 'ઓડીટીંગ એન્ડ એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ્ઝ' ના આધારે, અધિનિયમની કલમ-૧૪૩ હેઠળ આ નાણાકીય પત્રકો અંગે અભિપ્રાય વ્યક્ત કરવાની છે. જે તેઓના તા. ૩૦મી નવેમ્બર, ૨૦૨૧ના ઓડિટ અહેવાલ અન્વયે વ્યક્ત કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.

ભારતના કોમ્પ્રોલર અને ઓડિટર જનરલ વતી મેં ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના ૩૧મી માર્ચ, ૨૦૨૧ના રોજ પૂરા થતા વર્ષ માટેના નાણાકીય પત્રકોનું અધિનિયમની કલમ ૧૪૩(૬)(એ) હેઠળ પૂરક ઓડિટ (સપ્લીમેન્ટરી ઓડિટ) કર્યું છે. આ પૂરક ઓડિટ, વૈધાનિક ઓડિટરોના કામકાજ અંગેના કોઈ પણ કાગળો જોયા વિના, સ્વતંત્ર રીતે કરવામાં આવ્યું છે અને તે મુખ્યત્વે વૈધાનિક ઓડિટરો અને કંપનીના કર્મચારીવર્ગને કરવામાં આવેલી પૂછપરછ તેમજ પસંદ કરવામાં આવેલા કેટલાક હિસાબ રેકર્ડ્ઝની તપાસ પૂરતું મર્યાદિત છે.

મારા પૂરક ઓડિટના આધારે મારા ધ્યાન પર એવી કોઈ મહત્ત્વની બાબત આવી નથી જે અધિનિયમની કલમ ૧૪૩ (૬)(ખ) હેઠળના વૈધાનિક ઓડિટરના અહેવાલ અંગે અથવા તેને પૂરક હોય તેવાં કોઈ ટીકા-ટિપ્પણ ઊભાં કરે.

સ્થળ : અમદાવાદ

ભારતના કોમ્પ્રોલર ઓડિટરના નામે અને તેમના વતી

તારીખ :

સહી/-

(એચ. કે. ધર્મદર્શી)

પ્રિન્સિપાલ એકા. જનરલ (ઓડિટ-૨), ગુજરાત

સ્વતંત્ર ઓડિટરનો અહેવાલ

પ્રતિ,

સભાસદો

ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ લિમિટેડ

ગાંધીનગર (ગુજરાત)

સ્ટેન્ડ અલોન નાણાકીય પત્રકોના ઓડિટ અંગેનો અહેવાલ

અમે, ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ લિમિટેડ (કંપની)ના આ સાથેના નાણાકીય પત્રકો ઓડિટ કર્યા છે, જેમાં તા.૩૧મી માર્ચ, ૨૦૨૧ રોજ મુજબના પાકા સરવૈયા; ૩૧મી માર્ચ, ૨૦૨૦ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ માટેના નફા અને નુકસાન ખાતાના પત્રક, નાણાકીય પત્રકો અંગેની નોંધો, ૩૧મી માર્ચ, ૨૦૨૦ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ માટેના રોકડ - પ્રવાહ (કેશ - ફ્લો)નું પત્રક અને તે તારીખે પૂરાં થતાં વર્ષમાં મહત્ત્વની હિસાબી નીતિઓ તથા અન્ય સ્પષ્ટીકરણાત્મક માહિતીનો સમાવેશ થાય છે. (હવે પછી અહીં જેનો ઉલ્લેખ ભારતીય હિસાબી ધોરણ મુજબનાં નાણાકીય પત્રકો તરીકે કરવામાં આવ્યો છે.)

અમારા મંતવ્ય અને અમારી શ્રેષ્ઠ જાણકારી તથા અમને આપવામાં આવેલા ખુલાસા મુજબ આ નાણાકીય પત્રકો કંપની અધિનિયમ ૨૦૧૩ (“અધિનિયમ”) અન્વયે જરૂરી બબાતોની માહિતી, અધિનિયમની કલમ ૧૩૩ને કંપનીઝ સુધારેલા (ઇંડિયન એકાઉન્ટીંગ સ્ટેન્ડર્ડ્ઝ) રુલ્સ, ૨૦૧૫ સાથે વાંચતાં, તે હેઠળ નિર્દિષ્ટ કરવામાં આવેલાં, ભારતમાં સામાન્ય રીતે સ્વીકૃત હિસાબી સિધ્ધાંતોને સુસંગત રહીને ૩૧મી માર્ચ, ૨૦૨૧ના રોજ કંપનીના પાકા સરવૈયા અને કંપનીના કામકાજની સ્થિતિ અંગે અને તે તારીખે પૂરા થતા વર્ષ માટેના નફા, અને તેના રોકડ પ્રવાહ અંગે સાચું અને યોગ્ય ચિત્ર રજૂ કરે છે.

અભિપ્રાય માટેનો આધાર

અમે નાણાકીય પત્રકોનું અમારું ઓડિટ અધિનિયમ (એસએએસ)ની કલમ ૧૪૩(૧૦) હેઠળ નિર્દિષ્ટ કરવામાં આવેલાં ઓડિટિંગ અંગેનાં ધોરણો મુજબ કર્યું છે. એ ધોરણો હેઠળની અમારી જવાબદારીઓ વધુમાં અમારા અહેવાલના નાણાકીય પત્રકોના ભાગમાં, ઓડિટ માટેની ઓડિટરોની જવાબદારીઓમાં વર્ણવવામાં આવી છે. ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ “કોડ ઓફ એથીકસ” તેમ જ અધિનિયમની જોગવાઈઓ તેમ જ તે હેઠળ ઘડવામાં આવેલા નિયમો હેઠળ નાણાકીય પત્રકોના અમારા ઓડિટ સાથે સુસંગત એવી નૈતિક જરૂરિયાતો મુજબ અમે કંપનીથી સ્વતંત્ર છીએ અમે તે જરૂરિયાતો તથા “કોડ ઓફ એથીકસ” મુજબ અમારી નૈતિક જવાબદારીઓ નિભાવી છે. અમે માનીએ છીએ કે અમે મેળવેલા ઓડિટ પુરાવા નાણાકીય પત્રકો અંગેના અમારા ઓડિટ અભિપ્રાયને આધાર પૂરો પાડવા માટે પર્યાપ્ત અને યોગ્ય છે.

નાણાકીય પત્રકો અને તે અંગેના ઓડિટરોના અહેવાલ સિવાયની મહત્ત્વની બાબતો

અન્ય બાબતોની માહિતી તૈયાર કરવાની જવાબદારી કંપનીના નિયામકમંડળની છે. અન્ય બાબતોની માહિતીમાં નિયામકમંડળના અહેવાલ સાથેનાં જોડાણો સહિત નિયામકમંડળના અહેવાલનો સમાવેશ થાય છે, પરંતુ તેમાં નાણાકીય પત્રકો તથા તે અંગેના અમારા ઓડિટરોના અહેવાલનો સમાવેશ થતો નથી.

નાણાકીય પત્રકો અંગેનો અમારો અભિપ્રાય અન્ય માહિતીને આવરી લેતો નથી અને અમે તે અંગે કોઈપણ પ્રકારની બાંધધરી અમારા તારણમાં વ્યક્ત કરતા નથી.

નાણાકીય પત્રકોના અમારા ઓડિટના સંબંધમાં અમારી જવાબદારી ઉપર જણાવેલી અન્ય માહિતી ઉપલબ્ધ બને ત્યારે તે વાંચવાની અને તેમ કરતી વખતે તે અન્ય માહિતી નાણાકીય પત્રકો સાથે પ્રત્યક્ષરીતે વિસંગત છે કે કેમ અથવા અમારા ઓડિટ દરમિયાન અથવા અન્યથા અમને પ્રાપ્ત થયેલી જાણકારીથી જુદી પડે છે કે કેમ અથવા તે અંગે પ્રત્યક્ષ રીતે કોઈ ખોટું નિવેદન કરવામાં આવ્યું છે કે કેમ તે ધ્યાનમાં લેવાની છે.

અમે જ્યારે અન્ય માહિતી વાંચીએ ત્યારે અમે જો એવાં તારણ પર આવીએ કે આ અન્ય માહિતીમાં પ્રત્યક્ષરીતે કોઈ ખોટું નિવેદન કરવામાં આવ્યું છે તો અમારે તે હકીકત સંચાલનનો હવાલો ધરાવતા હોય તેઓને જણાવવી જરૂરી બને છે. અમારે આ અંગે કંઈ જણાવવાનું નથી.

ભાર મૂકવામાં આવેલી બાબતો

૧. અમે સ્ટેન્ડ અલોન નાણાકીય પત્રકોની નોંધ નંબર ૩૨, ૩૨.૧, ૩૨.૨ અને ૩૨.૩ તરફ ધ્યાન દોરીએ છીએ જે કંપની સામે થયેલા દાવાના પરિણામો અંગેની અનિશ્ચિતતાનું વર્ણન કરે છે.
૨. અમે સ્ટેન્ડ અલોન નાણાકીય પત્રકોની નોંધ ૩૫ તરફ ધ્યાન દોરીએ છીએ, જેમાં અનુદાન, લોન અને પેશગીઓ તેમજ અન્ય સિલકોની બાકી સિલકો દર્શાવવામાં આવી છે, જે હિસાબમેળ અને તેના પરિણામે કોઈ સમાયોજન કરવાં પડે તો, તેને અધિન છે.
૩. અમે સ્ટેન્ડ અલોન નાણાકીય પત્રકોની નોંધ ૩૬ તરફ ધ્યાન દોરીએ છીએ, જે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ અધિનિયમ ૨૦૧૬ની જરૂરિયાત મુજબ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના લેણાની કબૂલાત ન કરવા અંગેની છે.
૪. અમે સ્ટેન્ડ અલોન નાણાકીય પત્રકોની નોંધ-૧ "આવકની ઓળખ" અને ૩૮ તરફ ધ્યાન દોરીએ છીએ, જેમાં જણાવવામાં આવ્યું છે કે, પૂરતી નિશ્ચિતતાના અભાવે કેટલીક આવક ખરેખર પ્રાપ્તિ અથવા વસૂલીના આધારે ધ્યાનમાં લેવામાં આવશે.
૫. અમે સ્ટેન્ડ અલોન નાણાકીય પત્રકો ની નોંધ ૪૦ તરફ ધ્યાન દોરીએ છીએ, જે કંપનીની ભાવિ કામગીરી પર કોવિડ ૧૯ની પડનારી અસર વિશે વ્યવસ્થાપક મંડળના મૂલ્યાંકન અંગે છે.

અન્ય બાબતો

જુદા જુદા પ્રોજેક્ટ્સની કક્ષા નક્કી કરવી, તેમના વિકાસ, તે અંગેનાં ખર્ચની ફાળવણી, મૂડીકરણની ટ્રીટેમેન્ટ વગેરેની બાબતમાં અમે વ્યવસ્થાપકમંડળના ટેકેનિકલ/વાણિજ્યિક મૂલ્યાંકન પર ભરોસો રાખીએ છીએ.

વ્યવસ્થાપક મંડળની અને સ્ટેન્ડઅલોન નાણાકીય પત્રકો માટે સંચાલન સંભાળતા હોય તેમની જવાબદારી

કંપની અધિનિયમ, ૨૦૧૩ (અધિનિયમ)ની કલમ-૧૩૪(૫)માં જણાવેલી બાબતોના સંદર્ભમાં, અધિનિયમની કલમ ૧૩૩ હેઠળ નિર્દિષ્ટ કરવામાં આવેલાં હિસાબી ધોરણો સહિત, ભારતમાં સામાન્ય રીતે સ્વીકૃત હિસાબી સિધ્ધાંતો મુજબ કંપનીની નાણાકીય સ્થિતિ, અન્ય સર્વગ્રાહી આવક તથા કેશ-ફ્લો અને ઇક્વિટીમાં થયેલા ફેરફાર સહિત નાણાકીય કામગીરીનું સાચું અને યોગ્ય ચિત્ર દર્શાવતાં આ નાણાકીય પત્રકો તૈયાર કરવાની જવાબદારી વ્યવસ્થાપક મંડળની છે. આ જવાબદારીમાં કંપનીની મિલકતોની સલામતી માટે અને બીજી છેતરપીંડીઓ અને અનિયમિતતાઓ રોકવા અને શોધવા માટે અધિનિયમની જોગવાઈઓ મુજબ પૂરતા હિસાબી રેકર્ડ જાળવવાનો; યોગ્ય હિસાબી પદ્ધતિઓ પસંદ કરી અપનાવવાનો; યોગ્ય અને વિવેકી નિર્ણયો કરવાનો; યોગ્ય રીતે અમલમાં મૂકી શકાય એવાં પૂરતાં આંતરિક નિયંત્રણો ઘડવાનો અને તેમને લાગુ પાડવાનો સમાવેશ થાય છે જેથી કોઈ છળકપટ અથવા ભૂલને કારણે વાસ્તવિક રીતે ખોટાં વિધાનોથી મુક્ત હોય એવાં નાણાકીય પત્રકો યોગ્ય રીતે તૈયાર કરવાના સંદર્ભમાં ચોકસાઈ અને પૂર્ણતા સુનિશ્ચિત કરી શકાય. આ નાણાકીય પત્રકો તૈયાર કરવામાં વ્યવસ્થાપક મંડળ જો કંપની ને ફડયામાં લઈ જવા કે કંપનીનું કામકાજ બંધ કરી દેવાનો ઇરાદો ધરાવતું ન હોય તો, કંપનીની ચાલુ ધંધાના ધોરણે ચાલુ રહેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરવા અને ચાલુ ધંધા સંબંધિત લાગુ પડતી બાબતો જાહેર કરવા માટે જવાબદાર છે.

નિયામક મંડળ કંપનીના નાણાકીય અહેવાલ તૈયાર કરવા ઉપર દેખરેખ રાખવા માટે પણ જવાબદાર છે.

નાણાકીય પત્રકોના ઓડિટ અંગે ઓડિટરની જવાબદારી :

અમારો ઉદ્દેશ કોઈ છેતરપીંડી અથવા ભૂલને કારણે નાણાકીય પત્રકોમાં કોઈ ખોટું નિવેદન કરવામાં આવ્યું ન હોવાની યોગ્ય ખાતરી મેળવવાનો છે અને ઓડિટરોનો અહેવાલ બહાર પાડવાનો પણ છે, જેમાં અમારા અભિપ્રાયનો સમાવેશ થાય છે. યોગ્ય ખાતરી મેળવવી એ ઉચ્ચ પ્રકારની ખાતરી મેળવવા જેવું છે. પરંતુ તે કોઈ એવી ગેરંટી નથી કે એસએ મુજબ કરવામાં આવેલ ઓડિટ કોઈ પ્રત્યક્ષ ખોટું નિવેદન કરવામાં આવ્યું હશે તો તેને શોધી જ કાઢશે. છેતરપીંડી અથવા ભૂલને કારણે ખોટું નિવેદન ઊભું થઈ શકે છે અને આ નાણાકીય પત્રકોના આધારે તેનો ઉપયોગ કરનારા દ્વારા લેવામાં આવેલા આર્થિક નિર્ણયોને તે નોંધપાત્ર પ્રમાણમાં વ્યક્તિગત કે એકંદરે પ્રભાવિત કરે તેવી સંભાવના રહેલી હોય તો તેને પ્રત્યક્ષ ભૂલ કે છેતરપીંડી ગણવામાં આવે છે.

એસએ મુજબ કરવામાં આવેલા ઓડિટના ભાગરૂપે અમે વ્યાવસાયિક નિર્ણયો લઈએ છીએ અને સમગ્ર ઓડિટ દરમિયાન વ્યવસાયિક શંકા જાળવી રાખીએ છીએ. આ ઉપરાંત અમે-

- છેતરપીંડી અથવા ભૂલને કારણે નાણાકીય પત્રકોમાં કોઈ ખોટું નિવેદન થયું હોય તો તેને પારખીને તેનાથી ઊભા થનારા ખતરાનો કયાસ પણ કાઢીએ છીએ અને તે ખતરાના ઉકેલરૂપ ઓડિટ કાર્યપદ્ધતિઓ ઘડીને તેને લાગુ પણ પાડીએ છીએ તથા અમારા અભિપ્રાયના સમર્થનમાં યોગ્ય અને પૂરતા પુરાવા પણ મેળવીએ છીએ. કોઈ ભૂલની તુલનામાં છેતરપીંડીને પરિણામે થયેલા ખોટા નિવેદન ન શોધી શકવાનું જોખમ વધુ રહે છે કારણ કે છેતરપીંડીમાં મેળાપીપણું, બનાવટ, ઇરાદાપૂર્વકની ક્ષતિ, ઉચાપત અથવા આંતરિક નિયંત્રણની અવહેલના થાય છે.
- ઓડિટને સુસંગત આંતરિક નિયંત્રણની સમજ મેળવીએ છીએ, જેથી જે તે સંજોગોને અનુરૂપ ઓડિટ કાર્યપદ્ધતિઓ ઘડી શકાય.
- ઉપયોગમાં લેવામાં આવેલી હિસાબી નીતિઓની યોગ્યતા તથા વ્યવસ્થાપકમંડળ દ્વારા કાઢવામાં આવેલા હિસાબી અંદાજો અને કરવામાં આવેલી સંબંધિત જાહેરાતોની મૂલવણી પણ કરીએ છીએ.
- વ્યવસ્થાપકમંડળ દ્વારા હિસાબના ચાલુ ઉપક્રમના ઉપયોગના ઔચિત્ય તથા પ્રાપ્ત કરવામાં આવેલા ઓડિટ પુરાવાના આધારે કંપની ચાલુ ઉપક્રમ તરીકે ચાલુ રહેવાની ક્ષમતા પર નોંધપાત્ર શંકા ઊભી કરે તેવી ઘટનાઓ અથવા પરિસ્થિતિઓ સંબંધી કોઈ પ્રત્યક્ષ અનિશ્ચિતતા અસ્તિત્વ ધરાવે છે કે કેમ તે પણ નક્કી કરીએ છીએ. કોઈ પ્રત્યક્ષ અનિશ્ચિતતા અસ્તિત્વ ધરાવતી હોવાનું અમને જણાય તો અમે અમારા ઓડિટરના અહેવાલમાં નાણાકીય પત્રકોમાં સંબંધિત જાહેરાતો તરફ ધ્યાન દોરીએ છીએ અને જો આવી જાહેરાતો અપર્યાપ્ત હોય તો અમે અમારા અભિપ્રાયમાં ફેરફાર કરીએ છીએ. અમારાં તારણો અમારા ઓડિટરના અહેવાલની તારીખ સુધી મેળવવામાં આવેલા ઓડિટના પુરાવા પર આધારિત હોય છે. આમ છતાં, ભાવિ ઘટનાઓ અથવા પરિસ્થિતિઓને કારણે કંપની તેની ચાલુ કામગીરી કરવાનું બંધ કરે એવું બની શકે છે.
- જાહેરાતો સહિત નાણાકીય પત્રકોની એકંદર રજૂઆત, માળખું અને વિષયવસ્તુનું મૂલ્યાંકન કરીએ છીએ અને નાણાકીય પત્રકોમાં લેવડ-દેવડો અને ઘટનાઓની યોગ્ય રજૂઆત થઈ છે કે નહીં તે પણ તપાસીએ છીએ.

અમે સંચાલનની કામગીરી કરતા લોકોને અન્ય બાબતોની સાથેસાથે ઓડિટના આયોજિત કાર્યક્ષેત્ર તથા સમય તેમ જ મહત્વનાં ઓડિટ તારણોની પણ જાણ કરીએ છીએ જેમાં અમારા ઓડિટ દરમિયાન અમને જોવા મળેલી આંતરિક નિયંત્રણ અંગેની ખામીઓનો સમાવેશ થાય છે.

સંચાલનની કામગીરી સંભાળતા લોકોને અમે લિખિત નિવેદન પણ આપીએ છીએ કે અમે સ્વતંત્રતા અંગેની સંબંધિત નૈતિક જરૂરિયાતોનું અનુપાલન કર્યું છે અને અમારી સ્વતંત્રતાને પ્રભાવિત કરે તેવા તમામ સંબંધો તથા અન્ય બાબતોની તેમજ લાગુ પડતું હોય ત્યાં સંબંધિત સુરક્ષાસંબંધી બાબતોની પણ જાણ કરીએ છીએ.

અન્ય કાનૂની અને નિયમનકારી જરૂરિયાતો અંગેનો અહેવાલ

૧. કંપની અધિનિયમની કલમ-૧૪૩ની પેટા-કલમ (૧૧)ના સંદર્ભમાં ભારતની કેન્દ્ર સરકાર દ્વારા બહાર પડવામાં આવેલા, કંપનીઝ (ઓડિટર્સ રિપોર્ટ) ઓર્ડર, ૨૦૧૬ (ઘ ઓર્ડર)ની જરૂરિયાત મુજબ, અમે જોડાણ-કમાં, “ઘ ઓર્ડર”ના ફકરા ૩ અને ૪માં નિર્દિષ્ટ કરવામાં આવેલી બાબતો અંગેનું એક પત્રક આપ્યું છે.

૨. અમે, ભારતના કોમ્પ્રોલર અને ઓડિટર જનરલ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા નિર્દેશો અને પેટાનિર્દેશોના આધારે, અધિનિયમની કલમ ૧૪૩(૫)ના સંદર્ભમાં જોડાણ-૨(૧) અને ૨(૨)માં અમારું નિવેદન રજૂ કરીએ છીએ.

૩. કંપની અધિનિયમનીની કલમ ૧૪૩(૩)ની જરૂરિયાત મુજબ અમે જણાવીએ છીએ કે-

- (ક) આ ઓડિટ માટે અમારી જાણકારી અને માન્યતા મુજબ જરૂરી હોય તેવી તમામ માહિતી અને ખુલાસા અમે મેળવ્યાં છે.
- (ખ) અમારા મતે, કાયદા અન્વયે જાળવવાના થતા હિસાબના યોગ્ય ચોપડા કંપનીએ જાળવ્યા હોવાનું અમને હિસાબોના ચોપડાની અમે કરેલી તપાસ દરમિયાન જણાયું છે.
- (ગ) આ અહેવાલમાં, રજૂ કરવામાં આવેલાં પાકા સરવૈયા, નફા અને નુકસાન પત્રક હિસાબના ચોપડા સાથે સુસંગત છે.
- (ઘ) અમારા મતે, ઉક્ત નાણાકીય પત્રકો અધિનિયમની કલમ-૧૩૩ને કંપનીઝ (ઇન્ડિયન એકાઉન્ટીંગ સ્ટાન્ડર્ડઝ) રુલ્સ, ૨૦૧૫ના નિયમ ૭ સાથે વાંચતાં, તેમાં નિર્દિષ્ટ કરવામાં આવેલાં હિસાબી ધોરણોનું પાલન કરે છે.
- (ચ) આ એક સરકારી કંપની હોવાથી. અધિનિયમની કલમ ૧૬૪(૨) અન્વયે કંપનીના કોઈ નિયામકને ગેરલાયક ઠેરવાવાની બાબત કંપનીને લાગુ પડતી નથી.
- (છ) કંપનીનાં નાણાકીય પત્રકો તૈયાર કરવાની પ્રક્રિયા પર આંતરિક નાણાકીય નિયંત્રણોની પર્યાપ્તતા અને આવાં નિયંત્રણોની કાર્યલક્ષી અસરકારકતા અંગે જુઓ આ જોડાણ-ખમાં જોડેલ અમારો અલગ અહેવાલ.
- (જ) કંપનીઝ (ઓડિટ એન્ડ ઓડિટર્સ) રુલ્સ, ૨૦૧૪ના નિયમ-૧૧ મુજબ, ઓડિટરોના અહેવાલમાં સમાવવાની અન્ય બાબતોના સંદર્ભે, અમારા મતે અને અમારી શ્રેષ્ઠ જાણકારી મુજબ તથા અમને કરવામાં આવેલા ખુલાસા મુજબ-
- (૧) કંપનીએ તેના નાણાકીય પત્રકોમાં, તેના પડતર કોર્ટ કેસોની નાણાકીય સ્થિતિ પર પડનારી અસર જાહેર કરી છે. (જુઓ નોંધ નં.૩૨, ૩૨.૧, અને ૩૨.૩.
- (૨) નજીકના ભવિષ્યમાં નુકસાન થાય તેવા, ડેરીવેટીવ કોન્ટ્રાક્ટ સહિતના કોઈ લાંબા ગાળાના કોન્ટ્રાક્ટ કંપની ધરાવતી ન હતી.
- (૩) કંપનીએ ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોડેકશન ફંડમાં તબદીલ કરવી જરૂરી હોય તેવી કોઈ રકમ ન હતી.

ઇનાની એન્ડ ઇનાની
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ
(પેઠી નોંધણી નં. ૧૨૦૫૦૭૬બલ્યુ)
સહી/-
(અંકિત શાહ)

સ્થળ : ગાંધીનગર
તારીખ : ૩૦મી નવેમ્બર, ૨૦૨૧
યુડીઆઇએન: ૨૧૧૪૫૫૬૯એએએસીડી૫૫૦૦

ભાગીદાર
સભ્ય પદ નં. ૧૪૫૫૬૯

જોડાણ- ક

“અન્ય કાનૂની અને નિયમનકારી જરૂરિયાતો” અંગેના અમારા અહેવાલના ફકરા ૧માં ઉલ્લેખિત જોડાણ

અમે જણાવીએ છીએ કે -

૧. મિલકતો, પ્લાન્ટ અને સાધનસામગ્રી

(ક) કંપનીએ જથ્થાત્મક વિગતો અને સ્થાયી મિલકતોની સ્થિતિ સહિત સંપૂર્ણ વિગતો દર્શાવતું, સ્થાયી મિલકતોનું રેકર્ડ જાળવ્યું છે.

(ખ) વ્યવસ્થાપક મંડળ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ યોગ્ય સમયાંતરે વર્ષ દરમિયાન તમામ સ્થાયી મિલકતોની પ્રત્યક્ષ ખરાઈ કરવામાં આવી છે. આવી ખરાઈ દરમિયાન વ્યવસ્થાપક મંડળ દ્વારા કોઈ ભૌતિક વિસંગતતા જોવા મળી નથી.

(ગ) કંપની તેની સ્થાયી મિલકતોમાં કોઈ ફી હોલ્ડ મિલકતો કે લીઝ હોલ્ડ મિલકતો ધરાવતી નથી.

૨. માલસામાન

કંપની કોઈ માલસામગ્રી ધરાવતી નથી અને તેથી કંપનીઝ (ઓડિટર્સ રીપોર્ટ) ઓર્ડર, ૨૦૧૬ના ફકરા-૩ના ખંડ-૨ની જોગવાઈઓ ઓડિટ હેઠળના વર્ષ માટે લાગુ પડતી નથી.

૩. લોન, રોકાણ અને બાંધધરીઓ

કંપનીએ, કંપની અધિનિયમ ૨૦૧૩ની કલમ-૧૮૯ હેઠળ જાળવવાના રજીસ્ટરમાં આવરી લેવાયેલ કંપનીઓ, પેઢીઓ અથવા અન્ય પાર્ટીઓને કોઈ તારણવાળી કે તારણવિનાની લોન આપી નથી. તદનુસાર “ધ ઓર્ડર”ના ફકરા-૩ના ખંડ-૩ (ક), ૩(ખ) અને ૩(ગ)ની જોગવાઈ કંપનીને લાગુ પડતી નથી.

૪. લોન, રોકાણ અને ગેરંટી

અમને આપવામાં આવેલી માહિતી અને કરવામાં આવેલા ખુલાસા મુજબ કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ-૧૮૫ હેઠળ નિર્દિષ્ટ કરવામાં આવેલ કોઈ વ્યક્તિને કંપનીએ કોઈ લોન અથવા ગેરંટી પૂરાં પાડ્યાં નથી.

વધુમાં, ગુજરાત સરકારના ઠરાવ ક્રમાંક : જેએનવી-૧૦-૨૦૧૧-૧૮૨૯૧૦-ક, તા. ૨૯-૧૦-૨૦૧૬ મુજબ અનુદાનમાંથી ઉપલબ્ધ વધારાનું ભંડોળ જીએસએફએસ પાસે જમા કરાવ્યું છે, જે માટે કંપનીએ કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ-૧૮૬ની જોગવાઈઓનું પાલન કર્યું છે. ૩૧મી માર્ચ, ૨૦૨૧ના રોજ જીએસએફએસ પાસેની કુલ થાપણો રૂ.૨૭૮,૪૩,૧૭,૮૫૭/- છે. જીએસએફએસ સિવાય કંપનીએ, કંપની અધિનિયમની કલમ-૧૮૬ હેઠળ નિર્દિષ્ટ થયા મુજબની કોઈપણ કોર્પોરેટ સંસ્થાને કોઈ લોન આપી નથી કે તેમાં રોકાણ કર્યું નથી અથવા કોઈ બાંધધરી આપી નથી. કંપનીએ માર્ગ અને મકાન વિભાગ, ગુજરાત સરકારના નિર્દેશથી રાષ્ટ્રીય ધોરી માર્ગ અમદાવાદ-રાજકોટ હાઇ વેના છમાર્ગીકરણ માટે જીએસએફએસ પાસેથી રૂ.૧૮૪૭ કરોડની સહાય મેળવી છે. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન રૂ.૧૭૨,૪૨,૯૭,૫૫૬/- આપવામાં આવ્યા છે. કંપનીએ કાર્યપાલક ઇજનેર, રાષ્ટ્રીય

ધોરી માર્ગ અમદાવાદ પ્રભાગને રૂ.૮૮,૦૭,૩૭,૮૦૦/-ની પેશગી અને કાર્યપાલક ઇજનેર, રાષ્ટ્રીય ધોરી માર્ગ રાજકોટ પ્રભાગને રૂ.૮૪,૩૫,૫૯,૬૫૯/-ની પેશગી આપી છે. વધુમાં, કંપનીએ ૩૧ માર્ચ, ૨૦૨૧ સુધી મે. વાલેયા કચ્છ ટોલ રોડ પ્રા.લિ.ને રૂ.૪૮,૭૭,૮૦,૫૫૭/-ની પેશગી પણ આપી છે..

૫. બાંધેલી થાપણો (ફિક્સ્ટ ડિપોઝીટ)

અમને આપવામાં આવેલી માહિતી અને કરવામાં આવેલા ખુલાસા મુજબ, કંપનીએ કોઇ થાપણો સ્વીકારી નથી, તેથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બહાર પાડેલા નિર્દેશો અને કંપની અધિનિયમ ૨૦૧૩ની કલમ ૭૩ થી ૭૬ની જોગવાઈઓ અથવા અધિનિયમની અન્ય કોઇ પણ સંબંધિત જોગવાઈઓ અને તે હેઠળ ધડવામાં આવેલા નિયમો, “ધ ઓર્ડર”ના ફકરા-૩ના ખંડ (૫)ની જોગવાઈઓ કંપનીને લાગુ પડતી નથી.

૬. કોસ્ટ ઓડિટ રેકર્ડ

કેન્દ્ર સરકારે, કંપની અધિનિયમ-૨૦૧૩ની કલમ-૧૪૮(૧) હેઠળ કોસ્ટ રેકર્ડ જાળવવાનું નિર્દેષ્ટ કર્યું નથી અને તેથી “ધ ઓર્ડર”ના ફકરા-૩નો ખંડ(૫) કંપનીને લાગુ પડતો નથી.

૭. વૈધાનિક લેણાં

(ક) અમને આપવામાં આવેલી માહિતી અને કરવામાં આવેલા ખુલાસા મુજબ અને અમે તપાસેલા કંપનીના રેકર્ડના આધારે અમારું માનવું છે કે કંપની સામાન્ય રીતે ભવિષ્ય નિધિ, કર્મચારી રાજ્ય વીમો, આવક વેરો, વેચાણ વેરો, સર્વિસ ટેક્સ, કસ્ટમ્સ ડ્યુટી, એકસાઇઝ ડ્યુટી, મૂલ્ય વર્ધિત કર, જીએસટી, ઉપકર અને લાગુ પડતા અન્ય વૈધાનિક લેણાં યોગ્ય સત્તા મંડળ પાસે નિયમિત રીતે જમા કરાવે છે, આમ છતાં, ચુકવવાપાત્ર બની હોય તે તારીખથી છ માસ કરતા વધુ સમયથી બાકી હોય એવાં બાકી હોય તેવાં કોઇ લેણાં ૩૧મી માર્ચ, ૨૦૨૧ના રોજ બાકી ન હતાં.

(ખ) અમને આપવામાં આવેલી માહિતી અને કરવામાં આવેલા ખુલાસા મુજબ, નીચે દર્શાવ્યા સિવાયની, આવકવેરા, વેચાણ વેરા, સર્વિસ ટેક્સ, કસ્ટમ્સ ડ્યુટી, એકસાઇઝ ડ્યુટી, મૂલ્ય વર્ધિત કર, ઉપકરની કોઇ રકમ ચૂકવવાપાત્ર નથી.

કાયદો	વૈધાનિક લેણાંનો પ્રકાર	જમાન કરાવેલી વિવાદી રકમ (રૂ. લાખમાં)	સંબંધિત સમયગાળો	વિવાદ ક્યાં પડતર છે.
૧	૨	૩	૪	૫
આવકવેરા અધિનિયમ, ૧૯૬૧	લાગુ પડતા વ્યાજ અને પેનલ્ટી સાથે આવક વેરો	૩૭,૯૭,૦૭,૬૫૦	૨૦૧૦-૨૦૧૧	આઇ.ટી.એ.ટી.
આવકવેરા અધિનિયમ ૧૯૬૧	લાગુ પડતા વ્યાજ અને પેનલ્ટી સાથે આવક વેરો	૩૩,૯૭,૮૫,૨૮૦	૨૦૧૧-૧૨	આઇ.ટી.એ.ટી.

આવકવેરા અધિનિયમ, ૧૯૬૧	લાગુ પડતા વ્યાજ અને પેનલ્ટી સાથે આવક વેરો	૪,૯૭,૯૬,૨૫૦	૨૦૧૧-૧૨	આઇ.ટી.એ.ટી.
આવકવેરા અધિનિયમ ૧૯૬૧	લાગુ પડતા વ્યાજ અને પેનલ્ટી સાથે આવક વેરો	૨,૦૭,૨૪,૦૧૦	૨૦૧૨-૧૩	આઇ.ટી.એ.ટી.

૮. લેણાં ચૂકવવામાં ચૂક

કંપનીના અમે તપાસેલા અને અમને આપવામાં આવેલી માહિતી અને કરવામાં આવેલા ખુલાસા મુજબ, સરવૈયાની તારીખે કંપનીએ કોઇ નાણાકીય સંસ્થા અથવા બેંક અથવા ડિબેનચર ધારકને કોઇ લેણાં ચૂકવવાના બાકી નથી.

આમ છતાં, માર્ગ અને મકાન વિભાગ, ગુજરાત સરકારની રૂ. ૧,૦૦,૦૦,૦૦૦/-ની લોન ચૂકવવાની બાકી છે. લોન અને તે અંગેના વ્યાજની પરત ચૂકવણી અંગે ગુજરાત સરકારના કોઇ નિર્દેશો નથી અને તેથી તેની ચૂકવણીમાં થયેલી ચૂક અંગે અમે કોઇ ટિકા-ટિપ્પણ કરી શકીએ તેમ નથી.

૯. પબ્લિક ઈસ્યુ / ફોલોઓન ઓફર/ મુદતી લોન દ્વારા ઊભું કરવામાં આવેલું ભંડોળ

અમારા મતે અમને આપવામાં આવેલી માહિતી અને કરવામાં આવેલા ખુલાસા મુજબ, મુદતી લોનની અરજી જે હેતુથી કરવામાં આવી હતી તે જ હેતુસર તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કંપનીએ પ્રારંભિક પબ્લિક ઓફર અથવા વધુ પબ્લિક ઓફર (દેવાં ખતો સહિત)થી કોઇ નાણાં ઊભાં કર્યાં નથી.

૧૦. છેતરપીંડી

કંપનીના ચોપડા અને રેકર્ડની અમે ભારતમાં સામાન્ય રીતે સ્વીકૃત ઓડિટ પદ્ધતિ મુજબ કરેલી તપાસ દરમિયાન અને અમને આપવામાં આવેલી માહિતી અને કરવામાં આવેલા ખુલાસા મુજબ, વર્ષ દરમિયાન કંપની દ્વારા અથવા કંપનીના કોઇ અધિકારી/ કર્મચારીએ કંપની વિરુદ્ધ કોઇ છેતરપીંડી આચરી હોવાનું જણાયું કે જાણવા મળ્યું નથી.

૧૧. વ્યવસ્થાપકોનું મહેનતાણુ

વ્યવસ્થાપકીય મહેનતાણું ચૂકવવાની બાબતમાં અધિનિયમ- ૨૦૧૩ની કલમ-૧૯૭ હેઠળ નિર્દિષ્ટ મર્યાદાનું પાલન કરવામાં આવ્યું છે...

૧૨. નિધિ કંપની

આ કંપની, કંપની અધિનિયમ-૨૦૧૩ની કલમ-૪૦૬ હેઠળ વ્યાખ્યાયિત થયેલી નિધિ કંપની નથી. તેથી “ધ ઓર્ડર”ના ફકરા-૩નો ખંડ (૧૨) કંપનીને લાગુ પડતો નથી.

૧૩. સંબંધિત પક્ષકાર સાથે લેવડદેવડ

અમને આપવામાં આવેલી માહિતી અને કરવામાં આવેલા ખુલાસા મુજબ, સંબંધિત પક્ષકારો સાથે કરવામાં આવેલી તમામ લેવડદેવડ કંપની અધિનિયમ-૨૦૧૩ની કલમ-૧૭૭ અને ૧૮૮ની જોગવાઈઓના પાલન સાથે કરવામાં આવી છે. હિસાબી ધોરણ-૧૮ ‘સંબંધિત પક્ષકારો’ની જરૂરિયાત મુજબની જાહેરાત નણાકીય પત્રકોમાં નોંધ-૨૮થી કરવામાં આવી છે.

૧૪. શેર/ ડિબેન્ચરની પસંદગી મુજબની ફાળવણી/ ખાનગી ફાળવણી

વર્ષ દરમિયાન કંપનીએ શેર/ ડિબેન્ચરની પસંદગી મુજબની / ખાનગી ફાળવણી કરી નથી. તેથી “ધ ઓર્ડર”ના ફકરા-૩નો ખંડ (૧૪) કંપનીને લાગુ પડતો નથી.

૧૫. નિયામકો સાથે રોકડ વિહિત (નોન કેશ) લેવડદેવડો

અમને આપવામાં આવેલી માહિતી અને ખુલાસા મુજબ, કંપનીએ નિયામકો અથવા તેમની સાથે સંકળાયેલી વ્યક્તિઓ સાથે કોઈ નોનકેશ લેવડદેવડો કરી નથી.

૧૬. એન.બી.એફ.સી. રજિસ્ટ્રેશન

કંપનીએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ-૧૯૩૪ની કલમ-૪૫- આઈએ હેઠળ એન.બી.એફ.સી. તરીકે નોંધણી કરાવવી જરૂરી નથી. તેથી “ધ ઓર્ડર”ના ફકરા-૩નો ખંડ-(૧૬) લાગુ પડતો નથી.

ઇનાની એન્ડ ઇનાની
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ
(પેઢી નોંધણી નં. ૧૨૦૫૦૭૬બલ્યુ)
સહી/-
(અંકિત શાહ)

સ્થળ : ગાંધીનગર

તારીખ : ૩૦મી નવેમ્બર, ૨૦૨૧

યુડીઆઇએન: ૨૧૧૪૫૫૬૯એએએસીડી૫૫૦૦

ભાગીદાર

સભ્ય પદ નં. ૧૪૫૫૬૯

ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ લિમિટેડનાં નાણાકીય પત્રકો અંગેના સમાન તારીખના સ્વતંત્ર ઓડિટરોના અહેવાલનું જોડાણ-ખ

કંપની અધિનિયમ, ૨૦૧૩ (અધિનિયમ)ની કલમ-૧૪૩ની પેટા કલમ-૩ના ખંડ (આઇ) હેઠળ આંતરિક નાણાકીય અંકુશ અંગેનો અહેવાલ

અમે ૩૧મી માર્ચ, ૨૦૨૧ના રોજ મુજબ ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ લિમિટેડનાં નાણાકીય અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા પરનાં આંતરિક નાણાકીય અંકુશોનું ઓડિટ, તે તારીખે પૂરા થતા વર્ષ માટેના આ કંપનીના સ્ટેન્ડ અલોન નાણાકીય પત્રકોના ઓડિટ સાથે કર્યું છે.

આંતરિક નાણાકીય અંકુશો માટેની વ્યવસ્થાપક મંડળની જવાબદારી :

કંપનીનું વ્યવસ્થાપક મંડળ, ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલી, નાણાકીય અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા પરનાં આંતરિક નાણાકીય અંકુશોના ઓડિટ અંગેની માર્ગદર્શક નોંધ (ગાયડન્સ નોટ)માં જણાવવામાં આવેલા આંતરિક અંકુશના આવશ્યક ઘટકોને ધ્યાનમાં રાખીને, કંપની દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા નાણાકીય અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા પરના આંતરિક અંકુશો પર આધારિત આંતરિક નાણાકીય અંકુશો સ્થાપિત કરવાની અને તેમને જાળવવાની છે. આ જવાબદારીમાં, અધિનિયમ હેઠળ જરૂરી છે તે મુજબ કંપનીની નીતિઓના અનુપાલન, તેની મિલકતોની રક્ષા, છેતરપિંડી અને ભૂલોના કિસ્સા નિવારવા અને તેમને શોધવા, હિસાબી રેકર્ડ સંપૂર્ણ અને સાચું હોય તે સુનિશ્ચિત કરવું અને વિશ્વાસપાત્ર નાણાકીય માહિતી સમયસર તૈયાર કરવા સહિત, કામકાજ વ્યવસ્થિત અને કાર્યક્ષમ રીતે થાય તે સુનિશ્ચિત કરવા માટે અસરકારક રીતે કામ કરતા પર્યાપ્ત આંતરિક નાણાકીય અંકુશો તૈયાર કરવાની, તેમનો અમલ કરવાની અને તેમને જાળવવાની છે.

ઓડિટરની જવાબદારી

અમારી જવાબદારી, અમારા ઓડિટના આધારે કંપનીના આંતરિક નાણાકીય અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા વિશે અમારો અભિપ્રાય આપવાની છે. અમે અમારું ઓડિટ, નાણાકીય અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા પરના આંતરિક નાણાકીય અંકુશો અંગેની માર્ગદર્શક નોંધ (ગાયડન્સ નોટ ઓન ઓડિટ ઓફ ઇન્ટર્નલ કંટ્રોલ્સ ઓવર ફાઇનાન્સિયલ રિપોર્ટિંગ) તેમ જ અધિનિયમની કલમ-૧૪૩ (૧૦) હેઠળ નિર્દિષ્ટ કરવામાં આવેલા અને આઇ.સી.એ.આઇ. દ્વારા બહાર પાડવામાં આવેલાં ઓડિટ અંગેનાં ધોરણો મુજબ, તે બંને આંતરિક નાણાકીય અંકુશોને જેટલા પ્રમાણમાં લાગુ પડે છે તે મુજબ કર્યું છે. ઓડિટ અંગેનાં એ ધોરણો અને ગાયડન્સ નોટની જરૂરિયાત મુજબ અમે નૈતિક આવશ્યકતાઓનું પાલન કર્યું છે અને નાણાકીય અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા ઉપર પર્યાપ્ત આંતરિક નાણાકીય અંકુશો સ્થાપિત કરવામાં અને જાળવવામાં આવ્યા હતા કે નહીં અને તમામ ભૌતિક બાબતોમાં તે અંકુશો અસરકારક રીતે કામ કરતા હતા કે નહીં તે વિશે ખાતરી થઇ શકે એ રીતે અમારું ઓડિટ કર્યું છે.

અમારા ઓડિટમાં, નાણાકીય અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા ઉપરના આંતરિક નાણાકીય અંકુશો પર્યાપ્ત છે કે નહીં તે અંગેના તેમ જ તેની અસરકારકતા અંગેના પુરાવા મેળવવા માટેની કાર્યપદ્ધતિનો

સમાવેશ થાય છે. નાણાકીય અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા ઉપરના આંતરિક નાણાકીય અંકુશો અંગેના અમારા ઓડિટમાં નાણાકીય બાબતો ઉપરના આંતરિક નાણાકીય અંકુશોની સમજ પ્રાપ્ત કરવાનો, કોઈ ભૌતિક ઊણપ અસ્તિત્વ ધરાવતી હોય તો તે અંગેનું જોખમ નક્કી કરવાનો તેમ જ આવા જોખમના આધારે આંતરિક અંકુશની રૂપરેખા તથા અસરકારકતા તપાસવાનો અને તેનું વિશ્લેષણ કરવાનો સમાવેશ થાય છે. પસંદ કરવામાં આવેલી કાર્યપદ્ધતિઓ ઓડિટરના નિર્ણય (જજમેન્ટ) પર આધાર રાખે છે. જેમાં છેતરપીંડી અથવા ભૂલને કારણે રજૂ કરવામાં આવેલાં પ્રત્યક્ષ ખોટાં નિવેદનો અને નાણાકીય પત્રકોનાં જોખમો નક્કી કરવાનો સમાવેશ થાય છે.

અમારું માનવું છે કે અમે મેળવેલા ઓડિટ પુરાવા, પૂરતા અને યોગ્ય છે તથા નાણાકીય અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા પરના કંપનીના આંતરિક નાણાકીય અંકુશો અંગેના અમારા ઓડિટ અભિપ્રાયને ઉચિત આધાર પૂરો પાડે છે.

નાણાકીય અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા ઉપરના આંતરિક નાણાકીય અંકુશોનો અર્થ

નાણાકીય અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા પર કંપનીનો આંતરિક નાણાકીય અંકુશ એ, સામાન્ય રીતે સ્વીકૃત હિસાબી સિદ્ધાંતો મુજબ, બાહ્ય હેતુઓ માટે નાણાકીય પત્રકો તૈયાર કરવાની અને તેને રજૂ કરવાની વિશ્વસનીયતા વિશે યોગ્ય ખાતરી આપવા માટે ઘડવામાં આવેલી પ્રક્રિયા છે. કોઈપણ કંપનીના નાણાકીય અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા ઉપરના આંતરિક નાણાકીય અંકુશમાં એ નીતિઓ અને કાર્યપદ્ધતિઓનો સમાવેશ થાય છે જે

(૧) તે કંપનીની મિલકતોની લેવડદેવડોને યોગ્ય અને સાચી રીતે દર્શાવતા વિગતવાર રેકર્ડની જાળવણી સાથે સંબંધ ધરાવતી હોય.

(૨) એ બાબતની યોગ્ય ખાતરી પૂરી પાડતી હોય કે લેવડદેવડો, સામાન્ય રીતે સ્વીકૃત હિસાબી સિદ્ધાંતો મુજબ નાણાકીય પત્રકો જે રીતે તૈયાર કરવા જરૂરી છે તે મુજબ નોંધવામાં આવી છે અને કંપનીની પ્રાપ્તિઓ અને ખર્ચાઓ, કંપનીના વ્યવસ્થાપક મંડળ તથા નિયામકોની અધિકૃતિ મુજબ જ થાય છે; અને

(૩) કંપનીનાં નાણાકીય પત્રકો પર જેની અસર પડી શકે તેમ હોય તેવી, કંપનીની મિલકતોના અનધિકૃત સંપાદન, ઉપયોગ અથવા 'ડિપોઝીશન' નિવારવા અથવા તેને સમયસર શોધી કાઢવાની યોગ્ય ખાતરી પૂરી પાડતી હોય.

નાણાકીય અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા ઉપરના આંતરિક નાણાકીય અંકુશોની આંતરિક મર્યાદાઓ.

નાણાકીય અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા ઉપરના આંતરિક નાણાકીય અંકુશોની આંતરિક મર્યાદાઓને કારણે, ભૂલ અથવા છેતરપીંડીને પરિણામે ખોટાં નિવેદનો કરવામાં આવે અથવા તે શોધી ન શકાય એવું પણ બને. આ મર્યાદાઓમાં અયોગ્ય વ્યવસ્થાપન અથવા વ્યવસ્થાપન અંગેનાં નિયંત્રણોનું આંતરિક નાણાકીય અંકુશો સાથેના ઘર્ષણની સંભાવનાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પરિસ્થિતિઓ બદલાવાને કારણે અથવા નીતિઓ કે પદ્ધતિઓનું પાલન નબળું હોવાના કારણે પણ નાણાકીય અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા ઉપરના આંતરિક નાણાકીય અંકુશ અંગેના વિશ્લેષણનું પ્રક્ષેપણ ક્યારેક અપૂરતું સાબિત થાય છે.

અભિપ્રાય :

અમારા મતે કંપની, નાણાકીય અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા ઉપર તમામ ભૌતિક બાબતોમાં પૂરતા આંતરિક નાણાકીય અંકુશો ધરાવે છે અને આ અંકુશો, ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલી નાણાકીય અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા ઉપરના આંતરિક નાણાકીય અંકુશોના ઓડિટ અંગેની માર્ગદર્શક નોંધમાં જણાવવામાં આવેલા આંતરિક અંકુશના આવશ્યક ઘટકોને ધ્યાનમાં રાખીને કંપની દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા, નાણાકીય અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા ઉપરના આંતરિક અંકુશો પર આધારિત ૩૧મી માર્ચ, ૨૦૨૧ના રોજ મુજબ અસરકારકરીતે ચાલતા હતા.

ઇનાની એન્ડ ઇનાની
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ
(પેઢી નોંધણી નં. ૧૨૦૫૦૭૬બલ્યુ)
સહી/-
(અંકિત શાહ)

સ્થળ : ગાંધીનગર
તારીખ : ૩૦મી નવેમ્બર, ૨૦૨૧
યુડીઆઇએન: ૨૧૧૪૫૫૬૯એએએસીડીપ૫૦૦

ભાગીદાર
સભ્ય પદ નં. ૧૪૫૫૬૯

ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ લિમિટેડનાં નાણાકીય પત્રકો અંગેના સમાન તારીખના સ્વતંત્ર ઓડિટરોના અહેવાલનું જોડાણ

પ્રતિ

સભાસદો

ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ લિમિટેડ

ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ લિમિટેડનાં સ્ટેન્ડઅલોન નાણાકીય પત્રકો અંગેના અમારા સ્વતંત્ર ઓડિટ અહેવાલમાં અમે ના.વ. ૨૦૨૦-૨૧ માટે લાગુ પડતા કંપની અધિનિયમ ૨૦૧૩ની કલમ ૧૪૩(પ) હેઠળના નિર્દેશો અને પેટા-નિર્દેશો વેશે નીચે મુજબ જણાવીએ છીએ.

જોડાણ-૨(૧)

ના.વ. ૨૦૨૦-૨૧ માટે કંપની અધિનિયમ ૨૦૧૩ની કલમ ૧૪૩(પ) હેઠળના નિર્દેશો અને પેટા-નિર્દેશો

ક્રમ નં.	કલમ ૧૪૩(પ) હેઠળ નિર્દેશો/પ્રશ્નો	લેવામાં આવેલ પગલાં	હિસાબો અને નાણાવ્યવસ્થા પર અસર
આધારમાળખાકીય ક્ષેત્ર			
૧	કંપની તેની તમામ હિસાબી લેવડદેવડો આઇટી સીસ્ટમ મરફત પ્રોસેસ કરે છે? જો હા, તો આઇટી સીસ્ટમ બહારની હિસાબી લેવડદેવડોની પ્રક્રિયાની હિસાબોની પ્રમાણિકતા પર પડતી અસર અને તેનાં નાણાકીય સૂચિતાર્થો જણાવો.	હા, કંપની હિસાબી લેવડદેવડોની પ્રક્રિયા માટે આઇટી સીસ્ટમ એટલે કે TALLY ધરાવે છે. આમ છતાં, હિસાબી લેવડદેવડો જેમાંથી કરવામાં આવે છે તે સોર્સ ડોક્યુમેન્ટ્સ હાર્ડ કોપીમાં રજિસ્ટર, એમએસ વર્ડ ડોક્યુમેન્ટ, એમએસ એક્સેલ ડોક્યુમેન્ટ્સમાં જાળવવામાં આવે છે..	કોઇ અસર પડતી નથી.
૨	કંપની લોન ભરપાઇ કરી ન શકી હોવાના કારણે કોઇ નાણાં ધીરનારે હાલની કોઇ લોનનું રીસ્ટ્રક્ચરીંગ કર્યું હોય અથવા દેવું/લોન/વ્યાજ વગેરે માંડવાળ કર્યું હોવાનો કોઇ કિસ્સો છે? જો હા, તો તેની નાણાકીય અસર જણાવો, આવા કેસો યોગ્યરીતે હિસાબે લેવામાં આવે છે? (નાણાં શીરનાર સરકારી કંપની હોય તો, આ નિર્દેશ નાણાં ધીરનાર કંપનીના વૈધાનિક ઓડિટરને પણ લાગુ પડે છે.	આવો કોઇ લોન રીસ્ટ્રક્ચરીંગ કરવાનો અથવા દેવું/લોન/વ્યાજ વગેરે માંડવાળ કરવાનો કિસ્સો નથી	કોઇ અસર પડતી નથી
૩	કેન્દ્ર/ રાજ્યની એજન્સીઓમાંથી ખાસ યોજના માટે મળેલું કે મળવાપાત્ર ભંડોળ	અમને આપવામાં આવેલી માહિતી અને કરવામાં આવેલા ખુલાસા મુજબ,	કોઇ અસર પડતી નથી

	<p>યોગ્ય રીતે હિસાબે લેવામાં/વાપરવામાં આવ્યું હતું? તેમાં કોઈ ફેરફાર હોય તો જણાવો.</p>	<p>ના.વ. ૨૦૨૦-૨૧ દરમિયાન ખાસ યોજના માટે કંપનીએ માર્ગ અને મકાન વિભાગ પાસેથી ભંડોળ મેળવ્યું છે/મળવાપાત્ર છે. તેને શરતો મુજબ યોગ્યરીતે હિસાબે લેવામાં આવ્યું/વપરવામાં આવ્યું છે.</p>	
--	--	---	--

ઇનાની એન્ડ ઇનાની
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ
(પેઠી નોંધણી નં. ૧૨૦૫૦૭૬બલ્યુ)
સહી/-
(અંકિત શાહ)

સ્થળ : ગાંધીનગર
તારીખ : ૩૦મી નવેમ્બર, ૨૦૨૧
યુડીઆઇએન: ૨૧૧૪૫૫૬૯એએએસીડીપ૫૦૦

ભાગીદાર
સભ્ય પદ નં. ૧૪૫૫૬૯

જોડાણ-૨(૨)

ના.વ. ૨૦૨૦-૨૧ માટે કંપની અધિનિયમ ૨૦૧૩ની કલમ ૧૪૩(૫) હેઠળના સેક્ટર વિશેષ પેટા-નિર્દેશો

ક્રમ નં.	કલમ ૧૪૩(૫) હેઠળ પેટાનિર્દેશો/પ્રશ્નો	લેવામાં આવેલ પગલાં	હિસાબો અને નાણાવ્યવસ્થા પર અસર
આધારમાળખાકીય ક્ષેત્ર			
૧	કંપનીએ તેની માલિકીની ફાજલ જમીન પર દબાણ થતું રોકવા માટે પૂરતાં પગલાં લીધાં છે? વપરાશમાં ન લેવાયેલી અથવા ફાજલ જાહેર કરવામાં આવેલી કંપનીની કોઈ જમીન પર થયેલા દબાણ અંગેનો કોર્ટમાં કેસ ચાલે છે?	અમને આપવામાં આવેલી માહિતી મુજબ, કંપની કોઈ જમીનની માલિકી ધરાવતી નથી. તેથી આ બાબત લાગુ પડતી નથી.	કોઈ અસર પડતી નથી.
૨	. જાહેર-ખાનગી ભાગીદારી હેઠળ હાથ ધરવાના પ્રોજેક્ટની પરખ કરવા માટેની પદ્ધતિ સરકારની નીતિઓ સાથે સુસંગત છે?	હા, કંપનીએ અત્યાર સુધી ૯ પ્રોજેક્ટ્સ જાહેર-ખાનગી ભાગીદારી હેઠળ હાથ ધર્યાં છે અને જાહેર-ખાનગી ભાગીદારી હેઠળ હાથ ધરવાના પ્રોજેક્ટ્સને પારખવાની સીસ્ટમ સરકારની માર્ગદર્શક સૂચનાઓ/નીતિઓ સાથે સુસંગત છે.	કોઈ અસર પડતી નથી
૩	એગ્રીમેન્ટમાં નિર્દીષ્ટ કરવામાં આવેલી મુખ્ય બાબતો (માઇલસ્ટોન્સ)ના સંદર્ભમાં કામના અમલનું દેખરેખ નિયંત્રણ થાય છે? અને ખર્ચમાં થયેલો વધારો, કરારમાંથી થતી આવક/ ખોટ વગેરે હિસાબના ચોપડે યોગ્ય રીતે હિસાબે લેવામાં આવે છે?	હા, એગ્રીમેન્ટમાં નિર્દીષ્ટ કરવામાં આવેલી મુખ્ય બાબતો (માઇલસ્ટોન્સ)ના સંદર્ભમાં કામના અમલનું દેખરેખ નિયંત્રણ રાખવાની સીસ્ટમ અમલમાં છે. અને ખર્ચમાં થયેલો વધારો, કરારમાંથી થતી આવક/ ખોટ વગેરે હિસાબના ચોપડે યોગ્ય રીતે હિસાબે લેવામાં આવે છે	કોઈ અસર પડતી નથી
૪	કેન્દ્ર/ રાજ્યની એજન્સીઓમાંથી ખાસ યોજના માટે મળેલું કે મળવાપાત્ર ભંડોળ યોગ્ય રીતે હિસાબે લેવામાં/વાપરવામાં આવ્યું હતું? તેમાં કોઈ ફેરફાર હોય તો જણાવો.	અમને આપવામાં આવેલી માહિતી અને કરવામાં આવેલા ખુલાસા મુજબ, ના.વ. ૨૦૨૦-૨૧ દરમિયાન ખાસ યોજના માટે કંપનીએ માર્ગ અને મકાન વિભાગ પાસેથી ભંડોળ મેળવ્યું છે/મળવાપાત્ર છે. તેને શરતો મુજબ યોગ્યરીતે હિસાબે લેવામાં આવ્યું/વપરવામાં આવ્યું છે.	કોઈ અસર પડતી નથી

		આમછતાં, ૩૧ માર્ચ ૨૦૨૧ના રોજ મુજબ અનુદાન સિલક હિસાબમેળ કર્યા બાદ કોઇ સમાયોજન કરવું જરૂરી હોય તો તેને અધીન છે.	
૫	બેંક ગેરંટી સમયસર 'રીવેલીડેટ' કરવામાં આવી છે?	હા, જ્યારે પણ તે જરૂરી હોય ત્યારે.	કોઇ અસર પડતી નથી
૬	મળવાપાત્ર ધંધા, ચુકવવાપાત્ર ધંધા, મુદતી થાપણ, બેંક ખાતા અને પ્રાપ્ત થયેલ રોકડની સિલકોના સમર્થન અંગે ટિકા-ટિપ્પણ કરો.	સરભર કરવામાં આવેલા તમામ હિસાબો સહિત, પ્રકીર્ણ લેણદારો, પ્રકીર્ણ દેવાદારો, લોન અને પેશગીઓ તથા બાકી સિલકો સમર્થનને અધીન છે. મુદતી થાપણો, બેંક ખાતાં અને રોકડ માટે સિલકો અંગેનું સમર્થન મેળવવામાં આવ્યું છે.	કોઇ અસર પડતી નથી
૭	પડતા મૂકવામાં આવેલા પ્રોજેક્ટ પર કરવામાં આવેલા ખર્ચનું પ્રમાણ નક્કી કરવું અને ખરેખર રાઇટ-ઓફ કરવામાં આવેલી રકમ દર્શાવવી.	ના.વ. ૨૦૨૦-૨૧ દરમિયાન પડતો મૂકવામાં આવ્યો હોય તેવો કોઇ પ્રોજેક્ટ નથી.	કોઇ અસર પડતી નથી

ઇનાની એન્ડ ઇનાની
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ
(પેઢી નોંધણી નં. ૧૨૦૫૦૭૬બલ્યુ)
સહી/-
(અંકિત શાહ)

સ્થળ : ગાંધીનગર
તારીખ : ૩૦મી નવેમ્બર, ૨૦૨૧
યુડીઆઇએન: ૨૧૧૪૫૫૬૯એએએસીડી૫૫૦૦

ભાગીદાર
સભ્ય પદ નં. ૧૪૫૫૬૯

ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ લિમિટેડ

૩૧મી માર્ચ, ૨૦૧૭ના રોજ મુજબનું સરવૈયું

(રકમ રૂપિયામાં)

	નોંધ	૧૩મી માર્ચ ૨૦૨૧ના રોજ મુજબ	૧૩મી માર્ચ ૨૦૨૦ના રોજ મુજબ
ઈકિવીટી અને જવાબદારીઓ			
શેરધારકોનું ભંડોળ			
શેરમૂડી	૨	૫,૦૦,૦૦,૦૦૦	૫,૦૦,૦૦,૦૦૦
અનામત અને પૂરાંત	૩	૨૯૬,૨૩૬,૧૦૭	૧૭૬,૩૧૫,૪૧૩
પેટા- સરવાળો...		૩૪૬,૨૩૬,૧૦૭	૨૨૬,૩૧૫,૪૧૩
બિન ચાલુ જવાબદારીઓ			
લાંબી મુદતનું કરજ	૪	૫,૪૧૩,૮૦૦,૬૧૪	૩,૮૮૩,૦૭૫,૩૫૦
વિલંબિત કર જવાબદારીઓ(ચોખ્ખી)	૧૨	૧૮,૮૯૮,૩૨૪	૧૬,૭૧૫,૪૭૫
લાંબી મુદતની અન્ય જવાબદારીઓ	૫	૧૪૩,૪૦૫,૧૪૬	૧૬૦,૦૯૧,૧૨૦
લાંબી મુદતની જોગવાઈઓ	૬	-	-
પેટા- સરવાળો...		૫,૫૭૬,૧૦૪,૦૮૪	૪,૦૫૯,૮૮૧,૯૪૫
ચાલુ જવાબદારીઓ			
ટ્રેકા ગાળાનું કરજ	૭	૬૦૦,૪૨૨,૨૯૧	-
ઘંઘા સંબંધિત ચૂકવવાપાત્ર	૮	-	-
(ક) એમએસએમઇનાં બાકી લેણાં		-	-
(ક) એમએસએમઇ સિવાયનાં કુલ બાકી લેણાં		૩,૯૦૭,૫૩૯	૪,૦૮૩,૬૨૩
અન્ય ચાલુ જવાબદારીઓ	૯	૪,૬૧૯,૦૪૫,૩૯૪	૪,૫૦૭,૨૨૮,૪૯૯
ટ્રેકાગાળાની જોગવાઈઓ	૧૦	૩૪,૬૭૨,૩૦૫	-
પેટા- સરવાળો...		૫,૨૫૮,૦૪૭,૫૨૯	૪,૫૧૧,૩૧૨,૧૨૨
સરવાળો -		૧૧,૧૮૦,૩૮૭,૭૨૦	૮,૭૯૭,૫૦૯,૪૮૦
મિલકતો			
બિન ચાલુ મિલકતો			
સંપત્તિ, પ્લાન્ટ અને સાધનસામગ્રી અને અમૂર્ત મિકલતો			
(૧) પ્લાન્ટ અને સાધનસામગ્રી	૧૧	૨,૨૯૮,૬૩૧	૧,૬૧૨,૨૭૪
(૨) અમૂર્ત મિકલતો	૧૧	૨૦૫,૨૦૫,૯૬૪	૨૪૭,૦૮૨,૭૪૬
લાંબાગાળાની લોન અને પેશગીઓ	૧૩	૬,૫૨૮,૯૩૬,૩૭૩	૪,૨૨૦,૫૮૭,૪૪૪
અન્ય બિન ચાલુ મિલકતો	૧૪	૫૪,૨૬૦	૫૪,૨૬૦
પેટા- સરવાળો...		૬,૭૩૬,૪૯૫,૨૨૮	૪,૪૬૯,૩૩૬,૭૨૪

ચાલુ મિકલતો			
ઘંઘાસંબંધી મળવાપાત્ર	૧૫	૧,૩૪૪,૦૫૪,૯૮૪	૪૦૦,૬૨૮,૭૯૮
રોકડ અને રોકડ સમાન	૧૬	૨,૯૮૪,૮૮૭,૦૦૮	૩,૫૯૭,૭૨૩,૪૦૨
ટૂંકાગાળાની લોન અને પેશગીઓ	૧૭	૯૧,૯૮૨,૭૭૨	૧૬૫,૫૯૬,૮૩૪
અન્ય ચાલુ મિકલતો	૧૮	૨૨,૯૬૭,૭૨૭	૧૬૪,૨૨૩,૭૨૨
પેટા- સરવાળો...		૪,૪૪૩,૮૯૨,૪૯૨	૪,૩૨૮,૧૭૨,૭૫૬
સરવાળો		૧૧,૧૮૦,૩૮૭,૭૨૦	૮,૭૯૭,૫૦૯,૪૮૦
નાણાકીય પત્રકો અંગેની મહત્વની હિસબી નીતિઓ અને નોંધો			

અમારા સમાન તારીખના અહેવાલ મુજબ

ઇનાની એન્ડ ઇનાની

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ

પેઢી નોંધણી નં. -૧૨૦૫૦૭૬બલ્યુ વતી

(અંકિત શાહ)

ભાગીદાર

સભ્ય પદ નં. ૧૪૫૫૬૯

નિયામક મંડળના નામે અને તેમના વતી

(અશોક કે. પટેલ)

(વહીવટી સંચાલક)

ડીઆઇએન-૦૦૦૯૪૦૩૬૯૪

(ડી.બી.નિમાવત)

નિયામક

ડીઆઇએન- ૦૮૯૩૭૦૧૦

સ્થળ : ગાંધીનગર

તા. ૩૦/૧૧/૨૦૨૧

ચુડીઆઇએન નં:૨૧૧૪૫૫૬૯એએએસીડી૫૫૦૦

(શીતલ શાહ)

ઇ.ચા. કંપની સેક્રેટરી

ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ લિમિટેડ
૩૧મી માર્ચ, ૨૦૨૧ના રોજ મુજબનું નફા અને નુકસાન અંગેનું પત્રક

(રકમ રૂપિયામાં)

	નોંધ	રકમ રૂ. ૨૦૨૦-૨૧	રકમ રૂ. ૨૦૧૯-૨૦
૧. આવક			
(૧) કામગીરીઓમાંથી આવક	૧૯	૮૦૮,૭૭૭,૩૬૬	૭૨૨,૬૭૯,૭૮૯
(૨) અન્ય આવક	૨૦	૪૨,૬૨૮,૯૨૧	૫૮,૯૪૧,૭૭૩
સરવાળો - આવક:-		૮૫૧,૪૦૬,૨૮૭	૭૮૧,૬૨૧,૫૬૨
૨. ખર્ચ			
(૧) પ્રત્યક્ષ ખર્ચ	૨૧	૫૮૮,૦૯૮,૧૬૩	૬૭૧,૭૧૯,૨૮૪
(૨) કર્મચારીઓના લાભો અંગેનું ખર્ચ	૨૨	૧૪,૯૬૩,૭૦૯	૧૩,૨૧૪,૧૯૧
(૩) નાણા વ્યવસ્થા અંગેનું ખર્ચ	૨૩	૩૭,૦૪૭	૧,૧૦૨,૨૪૯
(૪) ઘસારો અને ઋણમુક્તિ અંગેનું ખર્ચ	૧૧	૪૨,૬૫૪,૫૦૫	૪૨,૩૦,૨૭૭
(૫) અન્ય ખર્ચ	૨૪	૩૫,૬૯૩,૧૦૯	૩૮,૬૫૮,૯૦૦
સરવાળો- ખર્ચ :-		૬૮૧,૪૪૬,૫૩૩	૭૬૭,૦૨૪,૯૦૧
૩. અપવાદરૂપ બાબતો તથા કરવેરા પહેલાંનો નફો		૧૬૯,૯૫૯,૭૫૪	૧૪,૫૯૬,૬૬૧
૪. અપવાદરૂપ બાબતો			
(૧). અગાઉના સમયગાળાની બાબતો	૨૫	-	૯,૨૯૫,૦૪૧
૫. અસાધારણ બાબતો અને કરવેરા પહેલાંનો નફો		૧૬૯,૯૫૯,૭૫૪	૨૩,૮૯૧,૭૦૨
૬. અસાધારણ બાબતો		-	-
૭. કરવેરા પહેલાંનો ચોખ્ખો નફો		૧૬૯,૯૫૯,૭૫૪	૨૩,૮૯૧,૭૦૨
૮. કરવેરા સંબંધિત ખર્ચ			
(૧) ચાલુ કરવેરા		૪૮,૨૨૧,૨૪૬	૩,૯૮૮,૦૦૩
(૨) મેટ ક્રેડિટ એન્ટાઇટલમેન્ટ		(૩૬૫,૦૩૫)	(૨,૮૧૬,૧૯૫)
(૩) વિલંબિત કર		૨,૧૮૨,૮૪૯	૫,૭૩૮,૭૫૩
(૪) અગાઉના વર્ષના કરવેરા		-	(૪૪૮,૭૬૩)
૯. કરવેરા પછીનો ચોખ્ખો નફો		૧૧૯,૯૨૦,૬૬૪	૧૭,૪૨૯,૯૦૪
૧૦. શેર દીઠ આવક			
મૂળભૂત (રૂ.)		૨૩.૯૮	૩.૪૯
ઘટેલી (રૂ.)		૨૩.૯૮	૩.૪૯
નાણાકીય પત્રકો અંગેની મહત્ત્વની હિસાબી નીતિઓ અને નોંધો			

અમારા સમાન તારીખના અહેવાલ મુજબ

ઇનાની એન્ડ ઇનાની

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ

પેઢી નોંધણી નં. -૧૨૦૫૦૭૬બલ્યુ વતી

નિયામક મંડળના નામે અને તેમના વતી

(અંકિત શાહ)

ભાગીદાર

સભ્ય પદ નં. ૧૪૫૫૬૯

(અશોક કે. પટેલ)

(વહીવટી સંચાલક)

ડીઆઇએન-૦૦૦૯૪૦૩૬૯૪

(ડી.બી.નિમાવત)

નિયામક

ડીઆઇએન- ૦૮૯૩૭૦૧૦

સ્થળ : ગાંધીનગર

તા. ૩૦/૧૧/૨૦૨૧

યુડીઆઇએન નં:૨૧૧૪૫૫૬૯એએએસીડીપ૫૦૦

(શીતલ શાહ)

ઇ.ચા. કંપની સેક્રેટરી

ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ લિમિટેડ
૩૧મી માર્ચ, ૨૦૨૧ના રોજ મુજબનું કેશફ્લો સ્ટેટમેન્ટ

(રકમ રૂપિયામાં)

	વિગતો	૨૦૨૦-૨૧	૨૦૧૯-૨૦
ક.	સંચાલન કામગીરીઓમાંથી કેશફ્લો		
	નફા અને નુકસાન ખાતા મુજબ કરવેરા પછીનો ચોખ્ખો નફો	૧૬૯,૯૫૯,૭૫૪	૨૩,૮૯૧,૭૦૨
	ના સામે સમાયોજિત : બિન રોકડ અને બિન સંચાલનલક્ષી બાબતો		
	ઘસારો	૪૨,૬૫૪,૫૦૫	૪૨,૩૩૦,૨૭૭
	વ્યાજની આવક	(૪૧,૮૦૦,૮૦૧)	(૫૫,૭૯૨,૨૧૮)
	વ્યાજસંબંધી અન્ય ખર્ચ	૩૭,૦૪૭	૧,૧૦૨,૨૪૯
	સ્થાયી મિલકતોનાં વેચાણમાંથી નફો	(૧,૯૮૩)	(૧૧,૭૩૫)
	કાર્યકારી મૂડીમાં ફેરફાર પહેલાંનો કાર્યકારી નફો	૧૭૦,૮૪૮,૫૨૨	૧૧,૫૨૦,૨૭૫
	કાર્યકારી મૂડીમાં ફેરફાર સામે સમાયોજન		
	ધંધાસંબંધી ચૂકવવાપાત્ર	(૧૭૬,૦૮૪)	(૧૩૨,૧૨૮,૭૧૦)
	અન્ય જવાબદારીઓ	૯૫,૧૩૦,૯૨૦	૫૯૨,૯૮૭,૫૧૨
	ટ્રેકાગાળાની જોગવાઈઓ	(૯૪૩,૪૨૬,૧૮૭)	(૧૦૪,૫૯૫,૩૯૧)
	ધંધાસંબંધી મળવાપાત્ર	૮૪,૦૬૩,૪૧૮	(૪૮,૬૭૨,૯૪૮)
	અન્ય ચાલુ મિલકતો	(૫૯૩,૫૫૯,૪૧૦)	૩૧૯,૧૧૦,૭૩૮
	બાદ : ચુકવવામાં આવેલા કરવેરા	૧૩,૧૮૩,૯૦૬.૦૦	૧૮,૭૧૮,૬૪૪
	સંચાલન કામગીરીઓમાંથી ચોખ્ખો કેશફ્લો (ક)	(૬૦૬,૭૪,૩૧૬)	૩૦૦,૩૯૨,૦૯૪
બ.	રોકાણસંબંધી પ્રવૃત્તિઓમાંથી કેશફ્લો		
	સ્થાયી મિલકતોની ખરીદી	(૧,૪૭૮,૦૯૭)	(૧,૧૨૪,૯૫૬)
	સ્થાયી મિલકતોનું વેચાણ	૧૬,૦૦૦	૩૮,૬૪૩
	પ્રાપ્ત થયેલ વ્યાજ	૪૯૧,૮૦૭,૬૭૭	૪૯,૬૮૨,૨૪૬
	રોકાણસંબંધી કામગીરીઓ ચોખ્ખો કેશફ્લો (ખ)	૪૯૦,૩૪૫,૫૮૦	૪૮,૫૯૫,૯૩૩
ગ.	નાણાકીય પ્રવૃત્તિઓમાંથી ચોખ્ખો કેશફ્લો		
	જી.એસ.એફ.એસ.ની લોન પર ચુકવવામાં આવેલું વ્યાજ	(૩૧૯,૨૦૦,૨૩૭)	(૧૪૪,૩૧૬,૬૬૫)
	વ્યાજસંબંધી અન્ય ખર્ચ	(૩૭,૦૪૭)	(૧,૧૦૨,૨૪૯)
	લાંબાગાળાની પેશગીઓ	(૨,૩૦૮,૩૪૮,૯૨૯)	(૩,૪૨,૭૩,૯૦,૨૩૯)
	લાંબા ગાળાનાં કરજમાં વધારો	૧,૫૩૦,૭૨૫,૨૬૪	૩,૩૫૯,૫૦૮,૩૫૦
	ટૂંકા ગાળાનાં કરજમાં વધારો	૬૦૦,૪૨૨,૨૯૧	-
	નાણાકીય પ્રવૃત્તિઓમાંથી ચોખ્ખો કેશફ્લો (ગ)	(૪૯૬,૪૩૮,૬૫૮)	(૨૧૩,૩૦૦,૮૦૩)

રોકડ અથવા રોકડ સમાનમાં ચોખ્ખી વધઘટ/(ઘટાડો) (ઘ) = (ક+ખ+ગ)	(૬૧૨,૮૩૬,૩૯૪)	૧૩૫,૬૮૭,૨૨૪
વર્ષની શરૂઆતમાં રોકડ અને રોકડ સમાન	૩,૫૯૭,૭૨૩,૪૦૨	૩,૪૬૨,૦૩૬,૧૭૮
વર્ષના અંતે રોકડ અને રોકડ સમાન	૨,૯૮૪,૮૮૭,૦૦૮	૩,૫૯૭,૭૨૩,૪૦૨

નોંધ : (૧) 'કેશ-ફ્લો' પત્રક, કં(પનીઝ (એકાઉન્ટ્સ) ડુલ્સ, ૨૦૧૪ના નિયમ-૭ સાથે કંપની અધિનિયમ-૨૦૧૩ની કલમ-૧૩૩ને વાંચતાં, તે હેઠળ ઇસ્યુ કરવામાં આવેલા હિસાબી ધોરણ-૩ "કેશ-ફ્લો સ્ટેટમેન્ટ"માં નિર્દિષ્ટ કરવામાં આવેલી પરોક્ષ પદ્ધતિને અનુસરીને તૈયાર કરવામાં આવ્યું છે.

(૨) રોકડ અને રોકડ સમાન બાબતોની વિગત નોંધ નં.૧૪ મુજબ ઉપલબ્ધ છે.

મહત્વની હિસાબી નીતિઓ અને નોંધો નાણાકીય પત્રકોનો અભિન્ન ભાગ છે.

અમારા સમાન તારીખના અહેવાલ મુજબ

ઇનાની એન્ડ ઇનાની

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ

પેઢી નોંધણી નં. -૧૨૦૫૦૭૬બલ્યુ વતી

નિયામક મંડળના નામે અને તેમના વતી

(અંકિત શાહ)

ભાગીદાર

સભ્ય પદ નં. ૧૪૫૫૬૯

(અશોક કે. પટેલ)

(વહીવટી સંચાલક)

ડીઆઇએન-૦૦૦૯૪૦૩૬૯૪

(ડી.બી.નિમાવત)

નિયામક

ડીઆઇએન- ૦૮૯૩૭૦૧૦

સ્થળ : ગાંધીનગર

તા. ૩૦/૧૧/૨૦૨૧

યુડીઆઇએન નં:૨૧૧૪૫૫૬૯એએએસીડી૫૫૦૦

(શીતલ શાહ)

ઇ.યા. કંપની સેક્રેટરી

ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ લિમિટેડ

(સી.આઇ.એન. : યુઝપર૦૦ જીજે ૧૯૯૯ એસ.જી.સી. ૦૩૫૯૯૫)

૩૧મી માર્ચ, ૨૦૨૧ના રોજ પૂરા થતા વર્ષ માટેના નાણાકીય પત્રકો અંગેની નોંધો

૧. મહત્વની હિસાબી નીતિઓ

(ક) હિસાબો તૈયાર કરવાનો આધાર

આ નાણાકીય પત્રકો ચાલુ ધંધાના હિસાબી સિધ્ધાંતોના આધારે તૈયાર કરવામાં આવ્યા છે. કંપની ઉપાર્જન આધારિત હિસાબી પદ્ધતિને અનુસરે છે અને નાણાકીય પત્રકો અન્યથા જણાવવામાં આવ્યું હોય તે સિવાય, ઉપાર્જનના આધારે, ઐતિહાસિક ખર્ચ પરંપરા હેઠળ, ભારતમાં સામાન્યરીતે સ્વીકૃત હિસાબી સિધ્ધાંતો અને કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ ૧૩૩ને કંપનીઝ (એકાઉન્ટ્સ) રૂલ્સ, ૨૦૧૪ના નિયમ-૭ સાથે વાંચતાં તેમાં કરવામાં આવેલી જોગવાઈ અને ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સના અન્ય નિર્દેશો, કંપની અધિનિયમ, ૨૦૧૩ની લાગુ પડતી સંબંધિત જોગવાઈઓ મુજબ તૈયાર કરવામાં આવ્યું છે. નાણાકીય પત્રકો તૈયાર કરવામાં અપનાવવામાં આવેલી હિસાબી નીતિઓ સાતત્યપૂર્ણ અને અગાઉના વર્ષની સાથે સુસંગત છે.

આ કંપની રાજ્ય સરકાર વતી માર્ગ વિકાસ પરિયોજનાઓ હાથ ધરે છે. આ માટે કરવામાં આવેલું ખર્ચ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી વહીવટી મંજૂરી ગ્રાન્ટ સામે સમાયોજિત કરવામાં આવે છે. આ રીતે બાંધવામાં આવેલા માર્ગો સરકારની મિલકત છે અને માર્ગો પરિવહન ખર્ચને સમાયોજિત કરવા અંગે સરકારના કોઈ નિર્દેશ ન હોવાથી કંપનીએ ભોગવેલું ખર્ચ નફા અને નુકસાન ખાતે ઉધારવામાં આવે છે.

(ખ) અંદાજોનો ઉપયોગ

ભારતમાં સામાન્યરીતે સ્વીકૃત હિસાબી સિધ્ધાંતો સાથે સુસંગત રહીને નાણાકીય પત્રકો તૈયાર કરવા માટે વ્યવસ્થાપક મંડળને, અંદાજો અને ધારણાઓ બાંધવા પડે છે. જે સંબંધિત વર્ષની મિલકતો અને જવાબદારીઓમાં જણાવવામાં આવેલી રકમો તેમજ નાણાકીય પત્રકોની તારીખે આકસ્મિક જવાબદારીઓની કરવામાં આવેલી જાહેરાતો તથા તે વર્ષ માટે આવક અને ખર્ચની જણાવવામાં આવેલી રકમોને અસર કરે છે.

આ અંદાજો, તાજેતરની ઘટનાઓ અને કામગીરીઓ અંગેની વ્યવસ્થાપક મંડળની શ્રેષ્ઠ જાણકારી પર આધારિત હોય છે. આમ છતાં, હિસાબને લગતા અંદાજો સમયે સમયે બદલાઈ શકે છે. વાસ્તવિક પરિણામો આ અંદાજો કરતાં જુદાં હોઈ શકે છે. અંદાજોને લગતી સ્થિતિમાં ફેરફાર થયો હોવાનું વ્યવસ્થાપક મંડળને લાગે ત્યારે અંદાજોમાં યોગ્ય ફેરફારો કરવામાં આવે છે. આવા ફેરફારો જે સમયગાળામાં કરવામાં આવે તે સમયગાળા માટેનાં નાણાકીય પત્રકોમાં આવા ફેરફારો પ્રતિબિંબિત થાય છે અને જો આવા ફેરફારો પ્રત્યક્ષરૂપે કરવામાં આવ્યા હોય તો, નાણાકીય પત્રકોને લગતી હિસાબી નોંધોમાં તેની અસરો જાહેર કરવામાં આવે છે.

(ગ) 'કેશ-ફ્લો' પત્રક :

'કેશ-ફ્લો' પત્રકના હેતુ માટે રોકડ અને રોકડ સમાન બાબતોમાં બેંકમાં રહેલી રોકડ, હાથ પરની રોકડ તેમજ ત્રણ માસ કેતેથી ઓછા સમયગાળામાં પાકતી ટૂંકા ગાળાના રોકાણોની રકમનો સમાવેશ થાય છે. રોકડ પ્રવાહ (કેશ-ફ્લો)ની માહિતી પરોક્ષ પદ્ધતિનો ઉપયોગ કરીને આપવામાં આવે છે. જેમાં કરવેરા પહેલાંનો

ચોખ્ખો નફો, બિન-રોકડ પ્રકારની લેવ દેવડો અથવા રોકાણ કે નાણા વ્યવસ્થા સાથે સંકળાયેલી આવક અથવા ખર્ચની ભૂતકાળની અથવા ભવિષ્યની પ્રાપ્તિઓ અથવા ચુકવણીઓના વિલંબ કે ઉપાર્જનની અસર આવ્યા વિના સમાયોજિત કરવામાં આવે છે. કંપનીની સંચાલન લક્ષી, રોકાણ લક્ષી અને ધિરાણલક્ષી પ્રવૃત્તિઓમાંથી થતા રોકડ-પ્રવાહને અલગ અલગ દર્શાવવામાં આવ્યા છે.

(ઘ) અગાઉના સમયની અસાધારણ બાબતો

અગાઉના સમયની બાબતો અને અસાધારણ બાબતો જેની કંપનીના નાણાકીય પત્રકો પર ભૌતિક અસર પડે તેમ હોય તેને અલગથી જાહેર કરવામાં આવી છે.

(ચ) સરવૈયાની તારીખ પહેલા બનેલી ઘટના :

સરવૈયાની તારીખ બાદ બનેલી ભૌતિક સમાયોજનાની ઘટના (જે સરવૈયાની તારીખે અસ્તિત્વ ધરાવતી સ્થિતિનો પુરાવો પૂરોપાડે છે), નાણાકીય પત્રકોમાં ધ્યાનમાં લેવામાં આવે છે. સરવૈયાની તારીખ બાદ બનેલી એવી ઘટનાઓ જેમાં ભૌતિક સમાયોજન કરવામાં આવ્યું ન હોય (જે સરવૈયાની તારીખ પછી ઊભી થયેલી સ્થિતિ સૂચવે છે), જે ભૌતિક ફેરફાર અને પ્રતિબદ્ધતા દર્શાવતી હોય અને જેની અસરો નાણાકીય સ્થિતિ પર પડતી હોય તેને નિયામકના અહેવાલમાં જાહેર કરવામાં આવે છે.

(છ) સંપત્તિ, પ્લાંટ અને સાધનસામગ્રી

(૧) મૂર્ત મિલકતો

સ્થાયી મિલકતોની કિંમત, તેમની મૂળ સંપાદન કિંમતમાંથી એકત્રિત ઘસારો તથા તેની કાર્યક્ષમતામાં થયેલો ઘટાડો બાદ કરીને દર્શાવવામાં આવે છે. કિંમતોમાં, મિલકતોને તેમના અપેક્ષિત સ્થાને ચાલુ સ્થિતિમાં લાવવા માટે કરવામાં આવેલા તમામ ખર્ચનો સમાવેશ થાય છે અને તેમાં તે મિલકતોના વાણિજ્યિક ઉપયોગની તારીખે કરવામાં આવેલા તમામ ખર્ચનો સમાવેશ થાય છે.

કોઈ સ્થાયી મિલકત અંગે પાછળથી કરવામાં આવેલું ખર્ચ, છે જો આવું ખર્ચ કરવાથી તે મિલકતની અગાઉ આકારવામાં આવેલી ધોરણસરની કામગીરી કરતાં પણ વધુ સારી કામગીરી થવાથી ભવિષ્યમાં તેના વધુ સારા લાભો મળવાના હોય તો જ આવું ખર્ચ તે મિલકતની ચોપડે દર્શાવેલી કિંમતમાં ઉમેરવામાં આવે છે. રોજબરોજની મરામત ખર્ચ સહિતનું ખર્ચ અને છૂટક ભાગો બદલવાના ખર્ચ સહિતનું અન્ય તમામ ખર્ચ, તે ખર્ચ જે સમયગાળામાં કરવામાં આવ્યું હોય તે સમયગાળાના નફા અને નુકસાનના પત્રકમાં ઉધારવામાં આવે છે.

સ્થાયી મિલકતને ધ્યાનમાં લેવાનું બંધ કરવામાં આવે ત્યારે તેમાંથી થયેલ નફા અને નુકસાનને, તેનો નિકાલ કરવાથી થયેલી ચોખ્ખી આવક અને તેની ચાલુ કિંમત વચ્ચેના તફાવત તરીકે ગણતરીમાં લેવામાં આવે છે અને જ્યારે તે મિલકતનો નિકાલ કરવામાં આવે ત્યારે નફા અને નુકસાનના પત્રકમાં તે હિસાબે લેવામાં આવે છે.

(૨) અમૂર્ત મિલકતો

અમૂર્ત મિલકતો વસૂલાતપાત્ર કરવેરા પછી ચોખ્ખી સંપાદન કિંમતમાંથી કોઈ ઋણમુક્તિ / ઘટાડો અથવા નુકસાન હોય તો તે બાદ કરીને દર્શાવવામાં આવે છે. તેની કિંમતમાં ખરીદ કિંમત, કરજની કિંમત, તથા

મિલકતને કાર્યરત સ્થિતિમાં લાવવા માટે કરવામાં આવેલા પ્રત્યક્ષ ખર્ચ તેમજ અમૂર્ત મિલકતોને લગતા વિનિમય દરના તફાવતમાંથી ઊભા થતા, વિદેશી હુંડીયામણ સંબંધી કરારો અને સમાયોજનો અંગેના ચોખ્ખા ચાર્જિઝનો સમાવેશ થાય છે.

(જ) ઘસારો / ઋણમૂક્તિ

તમામ સ્થાયી મિલકતો અંગેનો ઘસારો, કંપની અધિનિયમ - ૨૦૧૩ની અનુસૂચિ-૨ માં નિર્દિષ્ટ કરવામાં આવ્યા મુજબ મિલકતોની ઉપયોગી આવરદાના આધારે પૂરી પાડવામાં આવી છે અને તે રીટન ડાઉન પદ્ધતિથી ગણવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન મિલકતમાં થયેલો વધારાનો ઘસારો પ્રમાણસર પૂરો પાડવામાં આવ્યો છે.

રૂ.૫૦૦૦થી ઓછી કિંમત ધરાવતી મિલકતો અંગેનો ઘસારો ૧૦૦ ટકાના દરે પૂરો પાડવામાં આવ્યો છે.

મિલકતનો ઉપયોગ કરવાનો અધિકાર (હિસાબી ધોરણ-૨૬ “અમૂર્ત મિલકતો” હેઠળ ધ્યાનમાં લેવામાં આવેલ), સંબંધિત અધિકાર શરૂ થવાની તારીખથી, સીધી લીટીની પદ્ધતિનો ઉપયોગ કરીને, તેના બાકીના સમયગાળા સુધી ઋણમૂક્ત કરવામાં આવે છે.

અન્ય અમૂર્ત મિલકતોના કેસમાં, સોફ્ટવેર, વેબ સાઇટ ડેવલપમેન્ટ “રીટન ડાઉન વેલ્યુ મેથડથી ૨૫%ના દરે ઋણમૂક્ત કરવામાં આવે છે.

(ઝ) બાંધકામ કરારો

માર્ગોના બાંધકામ સાથે સંકળાયેલી કરાર સંબંધી આવક, સરવૈયાની તારીખે પ્રોજેક્ટની પૂર્ણતાના તબક્કાના સંદર્ભમાં આવક તરીકે ધ્યાને લેવામાં આવે છે. કુલ અંદાજી કરારની તુલનામાં, સરવૈયાની તારીખે થયેલા કામના આધારે કરવામાં આવેલા કરાર સંબંધી ખર્ચના પ્રમાણ મુજબ પ્રોજેક્ટની પૂર્ણતાનો તબક્કો નક્કી કરવામાં આવે છે.

(ટ) આવક ધ્યાને લેવા બાબત

જુદા જુદા કરારોમાંથી નીપજતી આવકને ઉપાર્જનના આધારે ધ્યાનમાં લેવામાં આવે છે અને ખાસ કરીને વધારાની કન્સેશન ફી, પ્રોજેક્ટ ડેવલપમેન્ટ ફી, બીડ સીક્યુરીટીની આવક, એક્સેસ રેવન્યુ શેરીંગની બાબતમાં કોઈ હકદાવો ઊભો થવાના સમયે (કોન્ટ્રાક્ટર દ્વારા વિવાદ ઊભો કરવામાં આવ્યો હોવાના કારણે) યોગ્ય નિશ્ચિતતા સાથે આખરી ઉધરાણીની આકારણી કરી શકવાની ક્ષમતાનો અભાવ હોય તેવા કિસ્સામાં થતી આવક જ્યારે પ્રાપ્ત થાય ત્યારે ધ્યાનમાં લેવામાં આવે છે.

આ નિગમ નીચે મુજબની આવક ધરાવે છે

સેવાઓમાંથી પ્રાપ્ત થતી આવક

૧. પ્રોજેક્ટ ડેવલપમેન્ટ ફી
૨. ટોલ કલેક્શન /પ્રિમિયમ
૩. વધારાની કન્સેશન ફી
૪. મટીરીયલ ટેસ્ટીંગ ચાર્જિઝ

અન્ય આવક

૫. ટેન્ડર ડોક્યુમેન્ટ ફી

૬. વ્યાજ

(૧) પ્રોજેક્ટ ડેવલપમેન્ટ ફીમાંથી આવક

પ્રોજેક્ટ ડેવલપમેન્ટ ફીમાંથી થતી આવક સંબંધિત કન્સેશન એગ્રીમેન્ટની શરતો મુજબ ધ્યાને લેવામાં આવે છે અને પ્રોજેક્ટ પૂરો થવાની મુદતના આધારે પ્રમાણસર ધોરણે આવક તરીકે હિસાબે લેવામાં આવે છે.

(૨) ટોલની ઉઘરાણીમાંથી થતી આવક

ટોલની ઉઘરાણીમાંથી થતી આવકને સંબંધિત કરારની શરતો મુજબ ધ્યાને લેવામાં આવે છે અને તેને ઉપાર્જનના આધારે આવક તરીકે હિસાબે લેવામાં આવે છે, સિવાય કે કોઈ હકદાવો ઊભો કરતી વખતે યોગ્ય નિશ્ચિતતા સાથે આખરી ઉઘરાણીની આકારણી કરી શકવાની ક્ષમતાનો અભાવ હોય તેવા કિસ્સામાં ટોલની ઉઘરાણીમાંથી થતી આવક જ્યારે પ્રાપ્ત થાય ત્યારે ધ્યાનમાં લેવામાં આવે છે.

(૩) વધારાની કન્સેશન ફીમાંથી થતી આવક

વધારાની કન્સેશન ફીમાંથી થતી આવક સંબંધિત કન્સેશન એગ્રીમેન્ટની શરતો મુજબ ધ્યાને લેવામાં આવે છે અને તેને, કોઈ હકદાવો ઊભો થવાના સમયે ઉપાર્જનના આધારે આવક તરીકે હિસાબે લેવામાં આવે છે, સિવાય કે કોઈ હકદાવો ઊભો કરતી વખતે યોગ્ય નિશ્ચિતતા સાથે આખરી ઉઘરાણીની આકારણી કરી શકવાની ક્ષમતાનો અભાવ હોય તેવા કિસ્સામાં વધારાની કન્સેશન ફીમાંથી થતી આવક જ્યારે પ્રાપ્ત થાય ત્યારે ધ્યાનમાં લેવામાં આવે છે.

(૪) મટીરીયલ ટેસ્ટીંગ ચાર્જીઝ, સુપરવિઝન(દેખરેખ) ચાર્જીઝ, ટેન્ડર ડોક્યુમેન્ટ ફી, બીડ સીક્યુરીટી ઈન્કમ, પ્રકીર્ણ આવક, અન્ય વસૂલાતો, માર્ગને નુકસાન પહોંચાડવાના કારણે લાદવામાં આવતા દંડની પ્રાપ્ત થયેલી રકમ વગેરેની આખરી વસૂલાતની નિશ્ચિતતા ન હોવાના કારણે તે જેમ અને જ્યારે પ્રાપ્ત થાય તેમ અને ત્યારે ધ્યાનમાં લેવામાં આવે છે.

(૪) વ્યાજની આવક

વ્યાજની આવક સમય-પ્રમાણના આધારે ધ્યાનમાં લેવામાં આવે છે, સિવાય કે કોઈ હકદાવો ઊભો કરતી વખતે યોગ્ય નિશ્ચિતતા સાથે આખરી ઉઘરાણીની આકારણી કરી શકવાની ક્ષમતાનો અભાવ હોય તેવા કિસ્સામાં થતી આવક જ્યારે પ્રાપ્ત થાય ત્યારે ધ્યાનમાં લેવામાં આવે છે.

ગુજરાત સ્ટેટ ફાઈનાન્સીઅલ સર્વિસીઝ લિમિટેડ (ગુજરાત સરકારનું ઉપક્રમ) પાસે મૂકેલી થાપણોમાંથી થયેલી વ્યાજની આવકમાં વણવપરાયેલી ગ્રાન્ટમાંથી મૂકવામાં આવેલી થાપણો અને નિગમના પોતાના ભંડોળનો સમાવેશ થાય છે. જે થાપણોના સહિયારા ખાતા હેઠળ જાળવવામાં આવે છે. વર્ષ દરમિયાન પ્રાપ્ત થયેલા વ્યાજની રકમને તેની ઉઘડતી અને બંધ થતી સિલકની સરેરાશના આધારે ગ્રાન્ટ ફંડ અને નિગમના પોતાના ફંડ વચ્ચે પ્રમાણસર વહેંચવામાં આવે છે. ગ્રાન્ટના વણવપરાયેલા ભંડોળની થાપણ પર જેટલું વ્યાજ પ્રાપ્ત થાય તેને "ગ્રાન્ટ ફંડઝ" ના સદર હેઠળ ચાલુ જવાબદારી તરીકે ગણવામાં આવે છે અને ગુજરાત સરકારના નિર્દેશ મુજબ તેને પરત કરવું જરૂરી છે અને નિગમના પોતાના ભંડોળની થાપણ પર

પ્રાપ્ત થતા વ્યાજને વર્ષની આવક ગણવામાં આવે છે અને તદનુસાર તે નફા અને નુકસાન ખાતે જમા લેવામાં આવે છે.

વાયેબીલીટી ગેપ ફીડીંગની યોજનાઓ માટે મળેલી ગ્રાન્ટના સંદર્ભમાં કરવામાં આવેલી ચુકવણીઓ અને થયેલી પ્રાપ્તિઓ ઉકત ગ્રાન્ટ ફંડ સામે ઉધારવામાં અને જમા લેવામાં આવે છે.

(૫) ડિવિડન્ડની આવક : ડિવિડન્ડની આવક તે પ્રાપ્ત કરવાનો અધિકાર મળે ત્યારે ધ્યાનમાં લેવામાં આવે છે.

(૬) પ્રત્યક્ષ ખર્ચને ધ્યાને લેવા બાબત :

પ્રત્યક્ષ ખર્ચમાં માર્ગો અને પુલોનાં બાંધકામ અને વિકાસ માર્ગોને સુંદર બનાવવા અંગેના કામો અને થતા ખર્ચનો ઉપાર્જનના આધારે સમાવેશ કરવામાં આવે છે. આ માટે કોઈ ગ્રાન્ટ મળતી નથી અને કંપની આ ખર્ચ તેના પોતાના ભંડોળમાંથી કરે છે, સરકારી ગ્રાન્ટમાંથી નહીં.

(૬) અન્ય ખર્ચ ધ્યાને લેવા બાબત.

અન્ય ખર્ચને ઉપાર્જનના આધારે ધ્યાનમાં લેવામાં આવે છે.

(૬) સરકારી ગ્રાન્ટનો હિસાબ

સરકારી અનુદાનો સાથે જોડાયેલી શરતોનું કંપની પાલન કરશે અને અનુદાન પ્રાપ્ત થશે એવી પૂરતી ખાતરી હોય ત્યારે અનુદાનો ધ્યાને લેવામાં આવે છે.

કંપની, ગુજરાત સરકાર પાસેથી જુદા જુદા હેતુઓ માટે ગ્રાન્ટ મેળવે છે અને તેનો ઉપયોગ ગુજરાત સરકારના નિર્દેશો મુજબ કરવામાં આવે છે. કંપની આવાં અનુદાન ભંડોળોને તેની જવાબદારી ગણે છે અને ચોક્કસ હેતુઓ માટે આવા ભંડોળમાંથી ખર્ચ કરે છે અને તે ખર્ચ આવી ગ્રાન્ટ / ભંડોળ ખાતે ઉધારે છે. ગ્રાન્ટમાંથી વધેલી / વણવપરાયેલી રકમ જીએસએફએસ (ગુજરાત સરકારનું સાહસ) પાસે થાપણરૂપે મૂકવામાં આવે છે. ગ્રાન્ટની આવી વણવપરાયેલી રકમ પર પ્રાપ્ત થયેલું વ્યાજ પણ ગ્રાન્ટ તરીકે જ ગણવામાં આવે છે કોઈ ચોક્કસ હેતુ માટે પ્રાપ્ત થયેલી ગ્રાન્ટ અને આવા ચોક્કસ હેતુ માટે કરવામાં આવેલું ખર્ચ ગ્રાન્ટની રકમ જેટલું જ હોય અને ગ્રાન્ટની રકમ કરતાં વધુ હોય તો તેને તે વર્ષના ખર્ચ તરીકે ગણવામાં આવે છે અને તેટલા પ્રમાણમાં તેને કંપનીના નફા અને નુકસાન ખાતે ઉધારવામાં આવે છે.

ગ્રાન્ટનો ઉપયોગ, તે જે પ્રોજેક્ટ માટે મંજૂર કરવામાં આવી હોય તે પ્રોજેક્ટ માટે થાય છે. જો કોઈ અન્ય હેતુ માટે તે વાપરવી હોય તો તે માટે મંજૂર કરનાર સત્તામંડળની પરવાનગી લેવાની રહે છે.

(૭) રોકાણ

રોકાણો કે જે ઝડપથી પાકવાના હોય અને જે, રોકાણની તારીખથી એક વર્ષ કરતા વધુ સમય સુધી ધારણ કરી રાખવાનો ઇરાદો ન હોય તેને ચાલુ રોકાણો તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. ચાલુ રોકાણો ઓછા ખર્ચે અથવા વ્યક્તિગત રોકાણના આધારે નક્કી કરવામાં આવે વાજબી કિંમતે કરવામાં આવે છે. લાંબા રોકાણો પડતર કિંમતે કરવામાં આવે છે. આમ છતાં કિંમતમાં ઘટાડા અંગેની જોગવાઈ કામચલાઉ ન હોય એવા પ્રકારના ઘટાડા માટે કરવામાં આવે છે.

(થ) કર્મચારીઓના લાભો

કર્મચારીઓના ટૂંકાગાળાના લાભોને, તે અંગેની ચૂકવણી જે વર્ષમાં કરવામાં આવી હોય તે વર્ષે કંપનીના નફા અને નુકસાન ખાતે ખર્ચ તરીકે હિસાબે લેવામાં આવે છે.

નોકરી પૂરી થયા બાદ કર્મચારીને ચૂકવવાના લાભો તેમજ લાંબાગાળાના લાભો તે અંગેની ખરેખર ચૂકવણી જે વર્ષમાં કરવામાં આવે તે વર્ષે કંપનીના નફા અને નુકસાન ખાતે હિસાબે લેવામાં આવે છે અને નિવૃત્તિ લાભ માટે અન્ય કોઈ જોગવાઈ કરવામાં આવી નથી.

(દ) કરજ સંબંધી ખર્ચ :

કાર્યકારી મૂડી પર કરજ સંબંધી ખર્ચ, કરજ લેવામાં આવ્યું હોય તે વર્ષના નફા અને નુકસાન પત્રકમાં ઉધારવામાં આવે છે. મૂર્ત સ્થાયી મિલકતોના સંપાદન અંગેનું કરજ સંબંધી ખર્ચ, તે મિલકતના નિર્ધારિત ઉપયોગ કરીશકાય તે માટે કરવામાં આવેલી જરૂરી પ્રવૃત્તિઓ પૂરીથાય તે તારીખ સધી મૂડીકૃત કરવામાં આવે છે. પાત્ર અમૂર્ત મિલકતોના સંપાદન અથવા વિકાસ અંગેનું કરજ સંબંધી ખર્ચ, તે મિલકત ઉપયોગમાં લેવામાં આવે તે તારીખ સુધી મૂડીકૃત કરવામાં આવે છે.

(ધ) ભાડાપટા અંગેનો હિસાબ

(૧) ચાલુ પટા

કંપનીએ કેટલીક મૂર્ત મિલકતો પટે આપેલી છે અને આવા ભાડાપટા જ્યાં કંપનીએ માલિકીના લાભોને લગતાં તમામ જોખમો જાળવી રાખ્યાં છે તેને ચાલુ પટા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. આવા ચાલુ પટામાંથી પ્રાપ્ત થતી આવકને પટાની મુદત સુધી સીધી રેખાના આધારે નફા અને નુકસાન ખાતે ધ્યાનમાં લેવામાં આવે છે. પટાની આ મુદત સમયનો એ ભાગ પણ દર્શાવે છે જેમાં ભાડાપટાની મિલકતના ઉપયોગમાંથી થયેલો નફો ઘટ્યો હોય. પ્રારંભિક પ્રત્યક્ષ ખર્ચ, તે જે સમયમાં કરવામાં આવ્યું હોય તે દરમિયાન નફા અને નુકસાન ખાતે ખર્ચ તરીકે ધ્યાને લેવામાં આવે છે.

(૨) નાણાં પટા (Finance Lease)

નાણાં પટા હેઠળ આપવામાં આવેલી મિલકતો પટામાં કરવામાં આવેલાં ચોખ્ખાં રોકાણો જેટલી રકમે, સરવૈયાની તારીખે ધ્યાનમાં લેવામાં આવે છે. નાણાંધિરાણ સંબંધી આવક, નાણાપટા અંગેના બાકી ચોખ્ખા રોકાણ પરના મળતરનો સમયાંતરે અચળ દર દર્શાવતી પેટર્ન પર આધારિત છે.

(ન) શેર દીઠ આવક

કંપની, "શેર દીઠ આવક" અંગેના હિસાબી ધોરણ-૨૦ મુજબ, શેરદીઠ મૂળભૂત અને ઘટાડેલી આવક જણાવે છે. શેરદીઠ મૂળભૂત આવકની ગણતરી, સંબંધિત સમયગાળા માટેના ચોખ્ખા નફા અને નુકસાનની રકમનો, તે સમયગાળા દરમિયાન બાકી ઈકિવટી શેર્સની 'વેઈટેડ' સરેરાશ સંખ્યા વડે ભાગાકાર કરીને કરવામાં આવે છે. શેરદીઠ ઘટેલી આવકની ગણતરી, તે સમયગાળા માટેના નફા અથવા નુકસાનનો ભાગાકાર, પરિણામો, ઘટાડા વિરોધી (એન્ટી ડાઈલ્યુટીવ) હોય તે સિવાય, તમામ ઘટાડેલા સંભવિત ઈકિવટી શેર્સની અસર માટે સમાયોજન કરવામાં આવ્યા મુજબના તે સમયગાળા દરમિયાન બાકીના ઈકિવટી શેર્સની 'વેઈટેડ' સરેરાશ સંખ્યા વડે કરીને કરવામાં આવે છે.

(પ) આવક પરના કરવેરા

ચાલુ કરવેરા, આ સમયગાળા માટેની કરપાત્ર આવકના સંદર્ભમાં ચૂકવવાપાત્ર કરની રકમ મુજબ નક્કી કરવામાં આવે છે.

વિલંબિત કરવેરા મિલકતો અથવા વિલંબિત કર જવાબદારીઓ, કરપાત્ર આવક અને હિસાબી આવકના તફાવત મુજબ ધ્યાનમાં લેવામાં આવે છે. વિલંબિત કર-મિલકતો અથવા વિલંબિત કર જવાબદારીઓ, સરવૈયાની તારીખના રોજ મુજબના કરવેરાના દરો અથવા કરવેરાસંબંધી કાયદાને આધારે ગણી કાઢવામાં આવે છે. સમયના તફાવતને કારણે ઊભી થતી વિલંબિત કરવેરા-મિલકતોના સંદર્ભમાં ભવિષ્યમાં તે મિલકતની કિંમત ઉપજવાની પૂરતી નિશ્ચિતતા હોય તેટલા પ્રમાણમાં તે ધ્યાને લેવામાં આવે છે.

જમા લેવામાં આવેલ ન્યૂનતમ વૈકલ્પિક કર (MAT) ત્યારે જ અને તેટલા પ્રમાણમાં જ ધ્યાને લેવામાં આવે છે જ્યારે સબળ પુરાવા હોય કે નિર્દિષ્ટ સમયગાળામાં કંપની સામાન્ય આવક વેરો ચૂકવશે. ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઇન ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલ ગાયડન્સ નોટમાં સમાવિષ્ટ ભલામણો મુજબ એક મિલકત તરીકે ધ્યાનમાં લેવા માટે જ્યારે MAT પાત્ર બને તે વર્ષમાં તે મિલકત નફા અને નુકસાન ખાતામાં 'ક્રેડિટ' થકી ઊભી કરવામાં આવે છે અને "MAT ક્રેડિટ એન્ટાઇટલમેન્ટ" તરીકે દર્શાવવામાં આવે છે. દરેક સરવૈયાની તારીખે કંપની આવી ક્રેડિટની સમીક્ષા કરે છે અને જરૂર જણાય તો MAT ક્રેડિટ એન્ટાઇટલમેન્ટની રકમને રાઇટ ડાઉન કરે છે.

(ફ) મિલકતોને થયેલું નુકસાન

હિસાબી ધોરણ-૨૮ મુજબ, સરવૈયાની તારીખે મિલકતને નુકસાન થવાના સંકેતો મળે અને મિલકતની અથવા યથા પ્રસંગ એ મિલકત જેનો ભાગ હોય તે રોકડ ઊભી કરતા એકમને ચાલુ રાખવાની કિંમત, તેને વેચવાથી વસૂલ થઈ શકે તે રકમ કરતાં વધી જાય ત્યારે તે મિલકતને નુકસાન થયેલું ગણાય છે. ઉપયોગમાં લેવાતી મિલકતની કિંમત નક્કી કરવામાં, મૂડીની ભારિત સરેરાશ કિંમતનો ઉપયોગ કરીને, તે મિલકતના ચાલુ ઉપયોગમાંથી અપેક્ષિત ભાવિ કરવેરા પહેલાંનો રોકડ પ્રવાહ અને તેના આખરી નિકલમાંથી મળનારી રોકડને તેની વર્તમાન કિંમતમાંથી બાદ કરવામાં આવે છે. તેને ચાલુ રાખવા માટે ખર્ચાતી રકમને તેમાંથી વસૂલ થઈ શકે તેટલી રકમ સુધી ઘટાડવામાં આવે છે અને આ ઘટાડેલી રકમ નફા અને નુકસાન પત્રકમાં નુકસાની-ખોટ (Impairment Loss) તરીકે ધ્યાને લેવામાં આવે છે.

(બ) જોગવાઈઓ અને આકસ્મિક જવાબદારીઓ અને આકસ્મિક મિલકતો

ભૂતકાળની કોઈ ઘટનાના પરિણામે કંપની વિશ્વસનીયરીતે જેનો અંદાજ બાંધી શકે તેવી કોઈ વર્તમાન કાનૂની જવાબદારી ધરાવતી હોય અને તે જવાબદારી નિપટાવવા માટે આર્થિક લાભોની જરૂરિયાત ઊભી થવાની સંભાવના હોય ત્યારે કોઈ જોગવાઈને ધ્યાને લેવામાં આવે છે. આકસ્મિક જવાબદારીની જાહેરાત ત્યારે કરવામાં આવે છે જ્યારે કોઈ સંભવિત અથવા વર્તમાન જવાબદારી હોય, જેના માટે સાધનો ખર્ચવાની જરૂર પડે પરંતુ તેની સંભાવના અગાઉથી જણાઈ ન હોય. જ્યારે સંભવિત કે વર્તમાન જવાબદારી હોય અને સાધનોનું ખર્ચ કરવાની સંભાવના ભાગ્યે જ જણાતી હોય ત્યારે કોઈ જોગવાઈ કે જાહેરાત કરવામાં આવતી નથી.

ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ લિમિટેડ
(સીઆઇએન : યુઝપ૨૦૦ જીજે ૧૯૯૯ એસજીસી ૦૩૫૯૯૫)
૩૧મી માર્ચ, ૨૦૧૮ના રોજ મુજબ નાણાકીય પત્રકો અંગેની નોંધો

૨.૦ શેરમૂડી

(રકમ રૂપિયામાં)

	૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ મુજબ	૩૧મી માર્ચ, ૨૦૨૦ના રોજ મુજબ
અધિકૃત શેરમૂડી રૂ.૧૦નો એક એવા ૫૦૦૦૦૦૦ શેર્સ અગાઉના વર્ષે રૂ. ૧૦નો એક એવા ૫૦૦૦૦૦૦ શેર્સ	૫,૦૦,૦૦,૦૦૦	૫,૦૦,૦૦,૦૦૦
ઇશ્યુ કરેલા, સબસ્ક્રાઇબ થયેલા અને ભરપાઇ થયેલા રૂ.૧૦નો એક એવા ૫૦૦૦૦૦૦ શેર્સ અગાઉના વર્ષે રૂ. ૧૦નો એક એવા ૫૦૦૦૦૦૦ શેર્સ	૫,૦૦,૦૦,૦૦૦	૫,૦૦,૦૦,૦૦૦
સરવાળો...	૫,૦૦,૦૦,૦૦૦	૫,૦૦,૦૦,૦૦૦

૨.૧ ૫ ટકાથી વધુ શેર્સ ધરાવતા હોય એવા શેરધારકો અંગેની વિગતો :

શેરધારકોનું નામ	૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ મુજબ		૩૧મી માર્ચ ૨૦૨૦ના રોજ મુજબ	
	ટકાવારી	શેર્સની સંખ્યા	ટકાવારી	શેર્સની સંખ્યા
ગુજરાતના માનનીય રાજપાલશ્રી	૧૦૦	૪૯,૯૯,૯૯૩	૧૦૦	૪૯,૯૯,૯૯૩

૨.૨ અહેવાલના સમયગાળાની શરૂઆતમાં અને અંતે બાકી શેર્સનો હિસાબ મેળ નીચે દર્શાવવામાં આવ્યો છે.

વિગતો	૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ મુજબ		૩૧મી માર્ચ ૨૦૨૦ના રોજ મુજબ	
	શેર્સની સંખ્યા	(રકમ રૂપિયા)	શેર્સની સંખ્યા	(રકમ રૂપિયા)
વર્ષની શરૂઆતમાં ઇક્વિટી શેર્સ	૫૦,૦૦,૦૦૦	૫,૦૦,૦૦,૦૦૦	૫૦,૦૦,૦૦૦	૫,૦૦,૦૦,૦૦૦

+ : વર્ષ દરમિયાન ઇશ્યુ કરેલા શેર્સ	૦	૦	૦	૦
- : વર્ષ દરમિયાન બાયબેક થવાને કારણે રદ થયેલા શેર્સ	૦	૦	૦	૦
વર્ષના અંતે ઇક્વિટી શેર્સ	૫૦,૦૦,૦૦૦	૫,૦૦,૦૦,૦૦૦	૫૦,૦૦,૦૦૦	૫,૦૦,૦૦,૦૦૦

૨.૩ ઇક્વિટી શેર્સ સાથે જોડાયેલી શરતો/ અધિકારો

કંપની રૂ.૧૦નો એક એવી કિંમતના ઇશિવટી શેર્સનો એક માત્ર વર્ગ ધરાવે છે. દરેક ઇક્વિટી શેરધારક શેરદીઠ એક મત આપવાનો હક ધરાવે છે. કંપની ફંડામાં જાય એવા પ્રસંગે ઇક્વિટી શેરના ધારકો, તમામ પ્રફેરેન્શીયલ રકમોનું વિતરણ થયા બાદ કંપનીની બાકી બચેલી મિકલતો પ્રાપ્ત કરવા માટે હકદાર બનશે.

૨.૪ હોલ્ડીંગ/ અલ્ટિમેટ કંપની અને/અથવા તેની ગૌણ કંપનીઓ/ સહાયકોએ ધારણ કરેલા શેર્સ : શૂન્ય

૩. અનામત અને પૂરાંત

(રકમ રૂપિયામાં)

	૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ મુજબ	૩૧મી માર્ચ, ૨૦૨૦ના રોજ મુજબ
નફા અને નુકસાન ખાતુ		
છેલ્લા સરવૈયા મુજબ	૧૭૬,૩૧૫,૪૧૩	૧૫૮,૮૮૫,૫૦૯
+ વર્ષ માટેનો નફો (નુકસાન)	૧૧૯,૯૨૦,૬૯૪	૧૭,૪૨૯,૯૦૪
- વર્ષ દરમિયાન વિનિયોગો	-	-
સરવાળો>	૨૯૬,૨૩૬,૧૦૭	૧૭૬,૩૧૫,૪૧૩

૪.૦ લાભાંગાળાનું કરજ

(રકમ રૂપિયામાં)

□ વિગતો	૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ મુજબ		૩૧મી માર્ચ ૨૦૨૦ના રોજ મુજબ	
	બિન ચાલુ	ચાલુ	બિન ચાલુ	ચાલુ
તારણવાળુ	-	-	-	-
તારણ વિનાનું	-	-	-	-
(ક) બેંકો પાસેથી	-	-	-	-
(ખ) અન્ય પાસેથી				
માર્ગ અને મકાન વિભાગ પાસેથી લોન	૧૦,૦૦૦,૦૦૦	-	૧૦,૦૦૦,૦૦૦	-
ગુજરાત સ્ટેટ ફાઇનાન્સિયલ કોર્પો. પાસેથી લોન	૫,૪૧૩,૮૦૦,૬૧૪	-	૩,૮૮૩,૦૭૫,૩૫૦	-
સરવાળો...	૫,૪૧૩,૮૦૦,૬૧૪	-	૩,૮૮૩,૦૭૫,૩૫૦	-

૪.૧ માર્ગ અને મકાન વિભાગ પાસેથી લોન :

(૧) કંપનીએ, કંપનીની સ્થાપનાના સમયે માર્ગ અને મકાન વિભાગ પાસેથી મહેકમ અંગેના ખર્ચ અને પ્રારંભિક ખર્ચ કરવા માટે અનુક્રમે રૂ.૧,૦૦,૦૦૦ની રકમ મેળવી હતી. આ રકમ ચૂકવવા અંગે કંપનીને હજુ સુધી સમર્થન / પરત ચૂકવણી કરવા અંગેના નિર્દેશો પ્રાપ્ત થયા નથી. આમ છતાં વ્યવસ્થાપક મંડળનું માનવું છે કે આ રકમ લાંબા સમયથી બાકી હોવાથી અને આગામી ૧૨ મહિનામાં, લોન આપનાર તરફથી આ અંગેની માગણી થવાની સંભાવના ન હોવાથી આ બંને રકમોને “તારણ વિનાની લાંબાગાળાની લોન” તરીકે હિસાબોમાં દર્શાવવામાં આવી છે. આ બંને રકમો તારણ વિનાની છે અને તેમના પર કોઈ વ્યાજ ચૂકવવાપાત્ર નથી.

૪.૨ ગુજરાત રાજ્ય ફાઇનાન્સિયલ સર્વિસિસની લોન

માર્ગ અને મકાન વિભાગ, ગુજરાત સરકાર, ગાંધીનગર તરફના અમદાવાદ-રજકોટ રા.ધો.નં. ૮એ (ન્યુ રા.ધો.નં ૪૭) અને રા.ધો.નં ૮બી ((ન્યુ રા.ધો.નં ૨૭)ને પહોળો બનાવી તેના ઉપગ્રેડેશન માટે જીએસઆરડીસીના પત્ર નં. જીએસએફએસ/ક્રેડિટ/જીએસઆરડીસી/૧૮-૧૯/૩૫૦ તા. ૧૪/૧૧/૨૦૧૮થી

રૂ.૧૮૪૭.૦૦ કરોડની લાંબા ગાળાની લોન મંજૂર કરેલ છે. ૩૧/૦૩/૨૦૨૧ સુધી જીએસએફએસએલ દ્વારા રૂ.૫૫૯.૭૪ કરોડ (૨૦૧૮-૧૯-૫૧.૩૬ કરોડ; ૨૦૧૯-૨૦-૩૩૫.૯૫ કરોડ; ૨૦૨૦-૨૧-૧૭૨.૪૩ કરોડ) આપવામાં આવ્યા છે અને આટલી જ રકમ રાષ્ટ્રીય ધોરી માર્ગને ઉક્ત પરિયોજના માટે એ જ શરતોથી પેશગીરૂપે આપવામાં આવી છે જે શરતોથી જીએસએફએસએલ પાસેથી આ લોન મેળવવામાં આવી છે. આ લાંબા ગાળાની લોન ૨ વર્ષના મોરેટોરિયમના સમયગાળા પછી ૪૦ ત્રિમાસિક હપતામાં ૭.૭૫ ટકા વ્યાજ દર સાથે (વખતોવખત થનારા ફેરફારને અધીન) ચુકવવાની રહેશે. સદર લોન માર્ગ અને મકાન વિભાગ, ગાંધીનગરના પત્ર ક્રમાંક એન.એચ.આર.-૧૦-૨૦૦૯-૮૨૫૦૩૬-પાર્ટ-૬-એમ તા.૨૯/૧૨/૨૦૧૮થી મંજૂર થયેલ છે. વધુમાં, જીએસએફએસના પત્ર મુજબ, રૂ.૪૦,૬૮,૫૦,૦૨૦/-નું વ્યાજ ૧૧/૦૩/૨૦૨૧ સુધી મૂડીકૃત કરવામાં આવ્યું છે (સમયપત્ર મુજબ રૂ.૪૦,૬૮,૫૦,૦૨૦/-નું વ્યાજ). ઉપરના પૈકી ૨૦૨૧-૨૨માં ચુકવવાપાત્ર રૂ.૬૦.૦૪ કરોડનો હપતો ટૂંકાગાળાના કરજમાં વર્ગીકૃત કરવામાં આવ્યો છે.

૫. લાંબાગાળાની અન્ય જવાબદારીઓ :

(રકમ રૂપિયામાં)

	૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ મુજબ	૩૧મી માર્ચ, ૨૦૨૦ના રોજ મુજબ
સીક્યુરીટી ડિપોઝીટ, સમયમર્યાદાવાળી થાપણો અને સ્થગિત નાણાં - તારણ વિનાનાં	૧૪૨,૦૧૨,૬૩૬	૧૫૮,૨૧૫,૨૭૦
અર્નેસ્ટ મની ડિપોઝીટ - તારણ વિનાની	૧,૩૯૨,૫૧૦	૧,૮૭૫,૮૫૦
સરવાળો..	૧૪૩,૪૦૫,૧૪૬	૧૬૦,૦૯૧,૧૨૦

સીક્યુરીટી ડિપોઝીટ અને અર્નેસ્ટ મની ડિપોઝીટ લાંબા ગાળાની પરિયોજનાઓ માટે છે અને વ્યવસ્થાપકમંડળની સમજ મુજબ તે આગામી ૧૨ માસમાં પરત ચુકવવું પડે તેવી સંભાવના નથી.

૬. લાંબા ગાળાની જોગવાઈઓ :

(રકમ રૂપિયામાં)

વિગતો	૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ મુજબ	૩૧મી માર્ચ ૨૦૨૦ના રોજ મુજબ
પેન્શન અને રજા પગાર માટેની જોગવાઈ (જુઓ નોંધ-૮)	-	-
સરવાળો...	-	-

૬.૧ નિગમના તમામ કર્મચારીઓ આઉટસોર્સિંગથી, કરારથી અથવા ગુજરાત સરકારમાંથી પ્રતિનિયુક્તિ પર રાખવામાં આવ્યા છે, તેથી કંપનીએ હિસાબી ધોરણ ૧૫ “કર્મચારી લાભો” મુજબ જોગવાઈ અને કબૂલાત કરવાની જરૂર નથી.

૭. ટૂંકા ગાળાનાં કરજ

વિગતો	૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ મુજબ	૩૧મી માર્ચ ૨૦૨૦ના રોજ મુજબ
હાલમાં પાકતા લાંબા ગાળાનાં કરજો	૬૦૦,૪૨૨,૨૯૧	-
સરવાળો...	૬૦૦,૪૨૨,૨૯૧	-

માર્ગ અને મકાન વિભાગ, ગુજરાત સરકાર, ગાંધીનગર તરફના અમદાવાદ-રજકોટ રા.ધો.નં. ૮એ (ન્યુ રા.ધો.નં ૪૭) અને રા.ધો.નં ૮બી ((ન્યુ રા.ધો.નં ૨૭)ને પહોળો બનાવી તેના ઉપગ્રેડેશન માટે જીએસઆરડીસીના પત્ર નં. જીએસએફએસ/કેડિટ/જીએસઆરડીસી/૧૮-૧૯/૩૫૦ તા. ૧૪/૧૧/૨૦૧૮થી રૂ.૧૮૪૭.૦૦ કરોડની લાંબા ગાળાની લોન મંજૂર કરેલ છે. ૩૧/૦૩/૨૦૨૧ સુધી જીએફએસએલ દ્વારા રૂ.૫૫૯.૭ ૪ કરોડ (૨૦૧૮-૧૯-૫૧.૩૬ કરોડ; ૨૦૧૯-૨૦-૩૩૫.૯૫ કરોડ; ૨૦૨૦-૨૧-૧૭૨.૪૩ કરોડ) આપવામાં આવ્યા છે અને આટલી જ રકમ રાષ્ટ્રીય ધોરી માર્ગને ઉક્ત પરિયોજના માટે એ જ શરતોથી પેશગીરૂપે આપવામાં આવી છે જે શરતોથી જીએસએફએસએલ પાસેથી આ લોન મેળવવામાં આવી છે. આ લાંબા ગાળાની લોન ૨ વર્ષના મોરેટોરિયમના સમયગાળા પછી ૪૦ ત્રિમાસિક હપતામાં ૭.૭૫ ટકા વ્યાજ દર સાથે (વખતોવખત થનારા ફેરફારને અધીન) ચુકવવાની રહેશે. સદર લોન માર્ગ અને મકાન વિભાગ, ગાંધીનગરના પત્ર ક્રમાંક એન.એચ.આર.-૧૦-૨૦૦૯-૮૨૫૦૩૬-પાર્ટ-૬-એમ તા.૨૯/૧૨/૨૦૧૮થી મંજૂર થયેલ છે. વધુમાં, જીએસએફએસના પત્ર મુજબ, રૂ.૪૦,૬૮,૫૦,૦૨૦/-નું વ્યાજ ૧૧/૦૩/૨૦૨૧ સુધી મૂડીકૃત કરવામાં આવ્યું છે (સમયપત્ર મુજબ રૂ.૪૦,૬૮,૫૦,૦૨૦/-નું વ્યાજ). ઉપરના પૈકી ૨૦૨૧-૨૨માં ચુકવવાપાત્ર રૂ.૬૦.૦૪ કરોડનો હપતો ટૂંકાગાળાના કરજમાં વર્ગીકૃત કરવામાં આવ્યો છે.

૮. ધંધાસંબંધી ચુકવવાપાત્ર

(રકમ રૂપિયામાં)

વિગતો	૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ મુજબ	૩૧મી માર્ચ, ૨૦૨૦ના રોજ મુજબ
ધંધા સંબંધી ચુકવવાપાત્ર	-	-

માઇક્રો એન્ટરપ્રાઇઝના અને સ્મોલ એન્ટરપ્રાઇઝીઝનાં બાકી લેણાં	-	-
માઇક્રો એન્ટરપ્રાઇઝીઝ અને સ્મોલ એન્ટરપ્રાઇઝીઝ સિવાયના	૩,૯૦૭,૫૩૯	૪,૦૮૩,૬૨૩
સરવાળો...	૩,૯૦૭,૫૩૯	૪,૦૮૩,૬૨૩

* તેમાં ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બોર્ડને ચુકવવાપાત્ર રકમનો સમાવેશ થાય છે.

૮.૧ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બોર્ડને ચુકવવાપાત્ર રકમ જુદા જુદા સંભાવના અભ્યાસોને લગતી છે અને તે લાંબા સમયથી ચુકવવાની બાકી છે.

૯. અન્ય ચાલુ જવાબદારીઓ

(રકમ રૂપિયામાં)

વિગત	૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ મુજબ	૩૧મી માર્ચ, ૨૦૨૦ના રોજ મુજબ
આગોતરી મળેલી આવક	૧૦	૧૪
અનુદાન ભંડોળની સિલક (જુઓ નોંધ નં. ૩૧)	૪,૪૧૪,૬૧૩,૭૭૮	૪,૦૯૭,૦૯૯,૩૮૯
અન્ય ચાલુ જવાબદારીઓ*	૨૦૪,૪૩૧,૬૦૬	૪૧૦,૧૨૯,૦૯૬
સરવાળો..	૪,૬૧૯,૦૪૫,૩૯૪	૪,૫૦૭,૨૨૮,૪૯૯

“અન્ય ચાલુ જવાબદારીઓ”માં વૈધાનિક લેણાંનો સમાવેશ થાય છે.

૧૦. ટ્રેકાગાળાની જોગવાઈઓ

(રકમ રૂપિયામાં)

વિગત	૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ મુજબ	૩૧મી માર્ચ, ૨૦૨૦ના રોજ મુજબ
કરવેરા માટે જોગવાઈ	૩૪,૬૭૨,૩૦૫.૦૦	-
સરવાળો...	૩૪,૬૭૨,૩૦૫.૦૦	-

૧૨. વિલંબિત કર- મિલકત (ચોખ્ખી)

હિસાબી ધોરણ-૨૨ને ધ્યાનમાં લેતાં સમયના તફાવતને કારણે વિલંબિત કર-મિલકતના મહત્વના ઘટક અને વર્ગીકરણમાં નીચેનાનો સમાવેશ થાય છે.

(રકમ રૂપિયામાં)

	૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ મુજબ	૩૧મી માર્ચ, ૨૦૨૦ના રોજ મુજબ
સંપત્તિ, પ્લાંટ અને સાધનસામગ્રીને લગતી વિલંબિત કર-મિલકત/જવાબદારી		
ઉઘડતી સિલક વિલંબિત કર- મિલકત (જવાબદારી)	(૧૬,૭૧૫,૪૭૫)	(૧૦,૯૭૬,૭૨૨)
વત્તા : વર્ષ દરમિયાન ઉમેરો/ (બાદબાકી)	(૨,૧૮૨,૮૪૯)	(૫,૭૩૮,૭૫૩)
સરવાળો..	(૧૮,૮૯૮,૩૨૪.૦૦)	(૧૬,૭૧૫,૪૭૫.૦૦)

વિગતો	૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ મુજબ	૩૧મી માર્ચ, ૨૦૨૦ના રોજ મુજબ
ચોપડા મુજબ ડબલ્યુડીવી	૨૦૭,૫૦૪,૫૯૫	૨૪૮,૬૯૫,૦૨૦
આવકવેરા મુજબ ડબલ્યુડીવી	૧૪૨,૬૦૬,૫૦૬	૧૮૮,૬૧૦,૬૩૮
સ્થાયી મિલકતો અંગેના ઘસારાને કારણે સમયનો તફાવત	(૬૪,૮૯૮,૦૮૯)	(૬૦,૦૮૪,૩૮૨)
પેન્શન અને રજા પગાર માટેની જોગવાઈ (ખ)	-	-
સરવાળો (ક) + (ખ)	(૬૪,૮૯૮,૦૮૯)	(૬૦,૦૮૪,૩૮૨)
કરવેરા @ ૨૯.૧૨%	(૧૮,૮૯૮,૩૨૪)	(૧૬,૭૧૫,૪૭૫)
ચોખ્ખી વિલંબિત કર મિલકત.	(૧૮,૮૯૮,૩૨૪)	(૧૬,૭૧૫,૪૭૫)

ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ લિમિટેડ

૩૧મી માર્ચ, ૨૦૨૧ના રોજ મુજબ નાણાકીય પત્રકો અંગેની નોંધો

નોંધ : ૧૦ સ્થાયી મિલકતો

(રકમ રૂપિયામાં)

મિલકતનું નામ	ગ્રોસ બ્લોક				ધસારો				નેટ બ્લોક	
	૧-૪-૨૦ના રોજ	ઉમેરો	ઘટાડો/ સમાયોજન	૩૧-૩-૨૦૨૧ના રોજ	૩૧-૦૩-૨૦૨૦ સુધી	વર્ષ માટે	કપાત/ સમાયોજન	૩૧-૩-૨૦૨૧સુધી	૩૧-૩-૨૦૨૧ના રોજ	૩૧-૩-૨૦૨૦ના રોજ
૧.મૂર્ત મિલકતો :										
કમ્પ્યુટર સિસ્ટમ	૩,૦૩૯,૮૩૯	૧,૩૮૧,૬૦૨	૨૮૦,૩૫૦	૪,૧૪૧,૦૯૧	૨,૭૭૭,૭૩૦	૩૯૨,૫૦૪	૨૬૬,૩૩૩	૨,૯૦૩,૯૦૧	૨૬૨,૧૦૯	૧,૨૩૭,૧૮૦
ઇલેક્ટ્રીકલ ઇન્સ્ટોલેશનન્સ	૨૦૬,૫૨૩	-	-	૨૦૬,૫૨૩	૧૯૬,૧૯૬	-	-	૧૯૬,૧૯૬	૧૦,૩૨૭	૧૦,૩૨૭
ફર્નિચર અને જડાણો	૨,૪૩૫,૫૦૬	-	-	૨,૪૩૫,૫૦૬	૧,૭૯૭,૨૯૫	૧૪૬,૯૩૯	-	૧,૯૪૪,૨૩૪	૬૩૮,૨૧૧	૪૯૧,૨૭૨
વાહનો-મોટરકાર	૩,૬૬૫,૫૬૫	-	-	૩,૬૬૫,૫૬૫	૩,૪૬૭,૫૦૬	૧૪,૭૮૧	-	૩,૪૮૨,૨૮૭	૧,૯૮,૦૫૯	૧૮૩,૨૭૮
કચેરી સાધન સામગ્રી	૨,૭૦૪,૦૨૦	૯૬,૪૯૫	-	૨,૮૦૦,૫૧૫	૨,૨૦૦,૪૫૨	૨૨૩,૪૯૯	-	૨,૪૨૩,૯૫૧	૫૦૩,૫૬૮	૩૭૬,૫૬૪
સાયકલ	૨,૯૫૦	-	-	૨,૯૫૦	૨,૯૫૦	-	-	૨,૯૫૦	-	-
પેટા સરવાળો	૧૨,૦૫૪,૪૦૩	૧,૪૭૮,૦૯૭	૨૮૦,૩૫૦	૧૩,૨૫૨,૧૫૦	૧૦,૪૪૨,૧૨૯	૭૭૭,૭૨૩	૨૬૬,૩૩૩	૧૦,૯૫૩,૫૧૯	૧,૬૧૨,૨૭૪	૨,૨૯૮૬૩૧
૨.અમૂર્ત મિલકતો :										
કોમ્પ્યુટર સોફ્ટવેર	૮૭૭,૧૪૮	-	-	૮૭૭,૧૪૮	૮૨૮,૧૦૮	૧૨,૩૧૯	-	૮૪૦,૪૨૭	૪૯,૦૪૦	૩૬,૭૨૧
વેબ ડેવલપમેન્ટ ચાર્જિઝ	૩૯૦,૧૫૪	-	-	૩૯૦,૧૫૪	૩૪૦,૪૬૫	૧૨,૪૮૨,	-	૩૫૨,૯૪૭	૪૯,૬૮૯	૩૭,૨૦૭
કિમ-માંડવી પ્રોજેક્ટ બીટીએ	૩૩૦,૦૦૦,૦૦૦	-	-	૩૩૦,૦૦૦,૦૦૦	૮૩,૦૧૫,૯૮૪	૪૧,૮૫૧,૯૮૧	-	૧૨૪,૮૬૭,૯૬૫	૨૪૬,૯૮૪,૦૧૬	૨૦૫,૧૩૨,૦૩૫
પેટા સરવાળો..	૩૩૧,૨૬૭,૩૦૨	-	-	૩૩૧,૨૬૭,૩૦૨	૮૪,૧૮૪,૫૫૬	૪૧,૮૭૬,૭૮૨	-	૧૨૬,૦૬૧,૩૩૮	૨૪૭,૦૮૨,૭૪૬	૨૦૫,૨૦૫,૯૬૪
સરવાળો...	૩૪૩,૩૨૧,૭૦૫	૧,૪૭૮,૦૯૭	૨૮૦,૩૫૦	૩૪૪,૫૧૯,૪૫૨	૯૪,૬૨૬,૬૮૫	૪૨,૬૫૪,૫૦૫	૨૬૬,૩૩૩	૧૩૭,૦૧૪,૮૫૭	૨૪૮,૬૯૫,૦૨૦	૨૦૭,૫૦૪,૫૯૫
અગાઉના વર્ષે	૩૪૨,૭૩૪,૯૧૯	૧,૧૨૪,૯૫૬	૫૩૮,૧૭૦	૩૪૩,૩૨૧,૭૦૫	૫૨,૮૦૭,૬૭૦	૪૨,૩૩૦,૨૭૭	૫૧૧,૨૬૨	૯૪,૬૨૬,૬૮૫	૨૮૯,૯૨૭,૨૪૯	૨૪૮,૬૯૫,૦૨૦

૧૩.૦ લાંબાગાળાની લોન અને પેશગીઓ

(રકમ રૂપિયામાં)

વિગત	૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ મુજબ	૩૧મી માર્ચ, ૨૦૨૦ના રોજ મુજબ
રાષ્ટ્રીય ધોરી માર્ગને લોન		
ક. કાર્યપાલક ઇજનેર, રાષ્ટ્રીય ધોરી માર્ગ, અમદાવાદને લોન	૨,૩૯૧,૦૨૩,૭૫૫	૧,૩૪૫,૯૮૪,૮૯૫
ખ. કાર્યપાલક ઇજનેર, રાષ્ટ્રીય ધોરી માર્ગ, રાજકોટને લોન	૩,૬૫૦,૧૩૨,૦૬૧	૨,૫૨૭,૦૯૦,૪૩૪
વાલેણા કચ્છ ટોલ રોડ પ્રા. લિ.ને પેશગી	૪,૮૭,૭૮૦,૫૫૭	૩૪૭,૫૧૨,૧૧૫
સરવાળો	૬,૫૨૮,૯૩૬,૩૭૩	૪,૨૨૦,૫૮૭,૪૪૪

૧૪.૦ અન્ય બિન ચાલુ મિલકતો

(રકમ રૂપિયામાં)

વિગત	૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ મુજબ	૩૧મી માર્ચ, ૨૦૨૦ના રોજ મુજબ
(તારણ વિનાની અને સફર)	૫૪,૨૬૦	૫૪,૨૬૦
સીક્યુરીટી ડિપોઝીટ		
સરવાળો...	૫૪,૨૬૦	૫૪,૨૬૦

૧૫.૦ ધંધાસંબંધી મળવાપાત્ર

(રકમ રૂપિયામાં)

વિગત	૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ મુજબ	૩૧મી માર્ચ, ૨૦૨૦ના રોજ મુજબ
(તારણ વિનાની અને સફર)		
છ માસથી વધુ સમયગાળા માટે		
૬ મહિનાથી ઓછા સમય માટે	૯૯૪,૫૫૪,૨૬૮	૭૧,૨૯૧,૭૧૪
અન્ય.	૩૪૯,૫૦૦,૭૧૬	૩૨૯,૩૩૭,૦૮૪
સરવાળો.	૧,૩૪૪,૦૫૪,૯૮૪	૪૦૦,૬૨૮,૭૯૮

૧૬.૦ રોકડ અને બેંક બેલેન્સ

(રકમ રૂપિયામાં)

વિગત	૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ મુજબ	૩૧મી માર્ચ, ૨૦૨૦ના રોજ મુજબ
રોકડ અને રોકડ સમાન		
બેંકમાં લેબેન્સ :		
ચાલુ ખાતામાં	૨૦૦,૫૬૭,૦૬૭	૮,૪૫૮,૭૪૨
અન્ય બેંકોમાં (આઇસીડી ૩ થી ૧૨ માસમાં પાકે છે)	૨,૬૮૩,૪૫૫,૫૭૪	૩,૪૪૮,૩૮૯,૭૧૦
હાથ પરની સિલક	૨,૦૮૪	૨,૭૭૦
તરલ થાપણ	૧૦૦,૮૬૨,૨૮૩	૧૪૦,૮૭૨,૧૮૦
સરવાળો...	૨,૯૮૪,૮૮૭,૦૦૮	૩,૫૯૭,૭૨૩,૪૦૨

૧૭.૦ ટ્રેકાગાળાની લોન અને પેશગીઓ

(રકમ રૂપિયામાં)

વિગત	૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ મુજબ	૩૧મી માર્ચ, ૨૦૨૦ના રોજ મુજબ
(તારણ વિનાની અને સફર)		૪૬,૯૩૭,૭૦૫
વૈધાનિક/ સરકારી સત્તામંડળો પાસેની સિલક	૪૧,૦૭૯,૩૧૯	
ટીડીએસ	૧૪,૬૭૪,૫૧૧	૧૪,૬૭૯,૨૫૨
અગાઉથી ચુકવવામાં આવેલ ખર્ચ	૧૨,૪૪૬	૧૪,૦૬૩
લોન અને પેશગીઓ		
એલ એન્ડ ટી પાસેથી મળવાપાત્ર સેફ્ટી ફંડ	૧૦,૨૨૨,૪૧૫	૧૦,૨૨૨,૪૧૫
એમએસકે પ્રોજેક્ટ (હિંમતનગર) પ્રા. લિ.	-	૨૩૫,૧૨૨
રેલવે અને આરઓબી ખર્ચમાંથી મળવાપાત્ર	૨૫,૯૨૨,૫૮૧	૨૫,૯૨૨,૫૮૧

પીજીવીસીએલ ભુજ ભયાઉ	૭૧,૫૦૦	૭૧,૫૦૦
ફીડ બેક માટે મોબીલાઇઝેશન એડવાન્સ		
ઇન્ફા પ્રા. લિ.	-	૩,૨૪૪,૯૯૯
કલાથીયા બગોદરા તારાપુર હાઇ વે પ્રા. લિ.ને લોન	-	૫૯,૭૬૯,૧૯૭
લવાદોને પેશગી	-	૪,૫૦૦,૦૦૦
સરવાળો...	૯૧,૯૮૨,૭૭૨	૧૬૫,૫૯૬,૮૩૪

૧૮.૦ અન્ય ચાલુ મિલકતો

(રકમ રૂપિયામાં)

વિગત	૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ મુજબ	૩૧મી માર્ચ, ૨૦૨૦ના રોજ મુજબ
મળવાપાત્ર વ્યાજ	૨૨,૯૬૭,૭૨૭	૧૫૩,૭૭૪,૩૬૬
એલ એન્ડ ટી ડ્યુ ડિલીજન્સ ડ્યુ	-	૨૬૦,૫૫૦
મળવાપાત્ર મેટ ક્રેડિટ	-	૯,૧૮૪,૬૬૩,
મળવાપાત્ર ટીસીએસ	-	૪,૦૬૩
કલાથીયા બગોદરા તારાપુર હાઇ વે પ્રા. લિ. પાસેથી “એન્જ ઓફ સ્કોપ રિકવરી”	-	૧,૦૦૦,૦૮૦
સરવાળો...	૨૨,૯૬૭,૭૨૭	૧૬૪,૨૨૩,૭૨૨

૧૯.૦

કામગીરીઓમાંથી આવક

(રકમ રૂપિયામાં)

વિગત	૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ મુજબ	૩૧મી માર્ચ, ૨૦૨૦ના રોજ મુજબ
સેવાઓનું વેચાણ		
ટોલ કલેક્શનની આવક	૩૯,૫૦૨,૦૫૨	૫૨,૧૨૩,૦૦૯
ટોલ કોમ્પન્સેશન (પ્રિમિયમ)ની આવક	૭૬૪,૨૬૯,૪૪૨	૫૬૨,૧૦૦,૭૭૨
માલસામગીના પરીક્ષણમાંથી આવક	૨,૬૪૯,૮૫૬	૯,૯૦૫,૨૫૨
કન્સેશન ફી અને લીઝ ફી	૧૬	૧૦
પ્રોજેક્ટ પરમીશન ફી	૨,૩૦૦,૦૦૦	૩,૦૯૪,૭૪૬
ઓડીસી ફી (પરિવહન)	૫૬,૦૦૦	૫૬,૦૦૦
કામના વ્યાપમાં ફેરફાર	-	૯૫,૪૦૦,૦૦૦
સરવાળો...	૮૦૮,૭૭૭,૩૬૬	૭૨૨,૬૭૯,૭૮૯

૨૦.૦

અન્ય આવક

(રકમ રૂપિયામાં)

વિગત	૨૦૨૦-૨૧	૨૦૧૯-૨૦
પ્રકીર્ણ આવક	૩૧૪,૧૨૦	૨,૯૧૦,૮૦૭
આઇ.ઇ. ખર્ચ અંગેનું વ્યાજ	-	૫૫૬,૬૭૮
બાંધકામ સહાય લોન (પેકેજ ૧) અંગેનું વ્યાજ	૧,૨૩૭,૯૬૦	૬,૦૫૬,૭૭૨
એલ. એન્ડ ટી. વધારાની કન્સેશનલ ફી અંગેનું વ્યાજ	૩૮,૮૧૧,૨૬૩	૪૮,૦૭૫,૫૧૮
અન્ય વ્યાજ	૧,૬૨૦,૦૩૫	૧,૧૦૩,૨૫૦
રાષ્ટ્રીય ધોરી માર્ગને લોન અંગેનું વ્યાજ	૧૩૧,૫૪૩	-
ટેન્ડર ડોક્યુમેન્ટ ફી	૫૧૪,૦૦૦	૨૩૮,૭૪૮
સરવાળો...	૪૨,૬૨૮,૯૨૧	૫૮,૯૪૧,૭૭૩

૨૧.૦

પ્રત્યક્ષ ખર્ચ

વિગત	૨૦૨૦-૨૧	૨૦૧૯-૨૦
ભરૂચ-દહેજ ટોલ વસૂલાતનો હિસ્સો	-	૧૬૭,૨૫૪,૮૪૪
બગોદરા-તારાપુર-વાસદ માર્ગ અંગેનું ખર્ચ	૭૮,૪૦૭,૬૮૮	૧૪૦,૩૫૯,૨૫૬
કીમ-માંડવી માર્ગ ખર્ચ	૧૧,૪૯૪,૬૭૪	૫,૭૭૦,૨૬૭
માર્ગને સુંદર બનાવવા અંગેનું ખર્ચ	૧૯,૧૨૯	૪૧૭,૪૯૩
સ્વતંત્ર ઇજનેરનું ખર્ચ	૨,૦૩૮,૦૫૩	૨,૪૬૯,૪૬૭
ભુજ-નખત્રાણા માર્ગ અંગેનું ખર્ચ	૮,૨૮૭,૬૬૪	૧૧૩,૯૪૭,૯૫૭
બીટીવી માર્ગ માટે બાંધકામ સહાય	૪૮૭,૮૫૦,૯૫૫	૨૪૧,૫૦૦,૦૦૦
સરવાળો...	૫૮૮,૦૯૮,૧૬૩	૬૭૧,૭૧૯,૨૮૪

૨૨.૦ કર્મચારીઓના લાભ અંગેનું ખર્ચ

વિગત	૨૦૨૦-૨૧	૨૦૧૯-૨૦
પગારો અને વેતન	૧૪,૯૬૩,૭૦૯	૧૩,૨૧૪,૧૯૧
સરવાળો...	૧૪,૯૬૩,૭૦૯	૧૩,૨૧૪,૧૯૧

૨૩.૦ નાણા વ્યવસ્થા ખર્ચ

વિગત	૨૦૨૦-૨૧	૨૦૧૯-૨૦
અન્ય		
આવકવેરા પરનું વ્યાજ	૩૬૦	૭૫૧,૩૩૪
જીએસટી પરનું વ્યાજ	૩૦	૧૩૨,૬૭૯
ટીડીએસ/ટીસીએસ પરનું વ્યાજ	૩૬,૬૫૭	૨૧૮,૨૩૬
સરવાળો...	૩૭,૦૪૭	૧,૧૦૨,૨૪૯

૨૪.૦ અન્ય ખર્ચ

વિગત	૨૦૨૦-૨૧	૨૦૧૯-૨૦
જાહેરાત અંગેનું ખર્ચ	૨,૭૧૪,૫૭૬	૩,૨૪૫,૦૮૨,
પ્રવાસ ખર્ચ	૨૬૪,૯૮૫	૩૫૦,૪૫૫
વીજળી, પાવર અને બળતણ	૭૩૬,૦૯૫	૮૦૫,૦૩૧
કાનૂની વ્યવસાયિક ફી	૨૫,૩૮૦,૧૪૫	૨૫,૨૭૩,૨૨૧
વહીવટી ખર્ચ	૫,૧૭૮,૩૮૨	૫,૧૭૨,૭૮૧
ટેલિફોન ખર્ચ	૪૬,૪૯૮	૭૬,૧૫૯
મરામત અને નિભાવ ખર્ચ	૨૧૬,૬૫૨	૫૧૯,૮૪૪
ઓડિટરોને ચુકવણી (નોંધ-૨૫)	૩૭૦,૯૦૫	૬૫૮,૬૮૮
માલ સામગ્રી પરીક્ષણ ખર્ચ	૧૨૮,૪૬૨	૧,૨૮૫,૭૦૫
અન્ય ખર્ચ	૪૬૭,૧૩૦	૧,૨૭૧,૯૩૩
વાહન વીમાનું ખર્ચ	૪૦,૫૩૩	-
મ્યુનિસિપલ ટેક્સ	૬૨,૨૨૦	-
વેબ સાઇટ અંગેનું ખર્ચ	૮૬,૫૨૬	-
સરવાળો	૩૫,૬૯૩,૧૦૯	૩૮,૬૫૮,૯૦૦

૨૫.૦ સમયગાળા પહેલાંની બાબતો

ક્રમ નં.	વિગત	૨૦૨૦-૨૧	૨૦૧૯-૨૦
૧.	સમયગાળા પહેલાંનું ખર્ચ		
		-	-
		-	-
૨.	અગાઉના સમયગાળાની આવક		

	કંસેશનર પાસેથી આઇ.ઇ. ફી	-	૯,૨૯૫,૦૪૧
	સરવાળો...	-	૯,૨૯૫,૦૪૧

૨૬.૦ શેર દીઠ આવક

વિગતો નીચે મુજબ છે.

(રકમ રૂપિયામાં)

વિગત	૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ મુજબ	૩૧મી માર્ચ, ૨૦૨૦ના રોજ મુજબ
૧. કરવેરા બાદ નફો	૧૧૯,૯૨૦,૬૯૪	૧૭,૪૨૯,૯૦૪
૨. ઇક્વિટી શેર્સની સંખ્યા	૫,૦૦૦,૦૦૦	૫,૦૦૦,૦૦૦
૩. શેર દીઠ નોમીનલ કિંમત	૧૦.૦૦	૧૦.૦૦
૪. શેર દીઠ મૂળભૂત અને ઘટેલી આવક (રૂ.)	૨૩.૯૮	૩.૪૯

૨૭.૦ ઓડિટરોને નીચેની ચુકવણી

ઓડિટર મુજબ

વિગત	૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ મુજબ	૩૧મી માર્ચ, ૨૦૨૦ના રોજ મુજબ
વૈધાનિક ઓડિટ ફી	૨૦૬,૫૦૦	૪૧૩,૦૦૦
આંતરિક ઓડિટ ફી	૧૪૧,૬૦૦	૨૦૭,૬૮૦
ટેક્સ ઓડિટ ફી	૨૨,૮૦૫	૩૮,૦૦૮
સરવાળો...	૩૭૦,૯૦૫	૬૫૮,૬૮૮

૨૮.૦ સંબંધિત પાર્ટીઓની જાહેરાત

ક્રમ	સંબંધિત પાર્ટીનું નામ	સંબંધ	નિમણૂકની તારીખ	હોદ્દો છોડ્યાની તારીખ
૧.	ગુજરાતના રાજ્યપાલ	૯૯.૯૯ ટકા શેર ધરાવે છે.		લાગુ પડતું નથી
૨.	શ્રી પૂર્ણેશકુમાર ઇશ્વરલાલ મોદી	નિયામક	ગુરુવાર, ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૧	લાગુ પડતું નથી
૩.	શ્રી નીતિનકુમાર રતિલાલ પટેલ	નિયામક	શુક્રવાર, ૨૦ જુન, ૨૦૧૪	શનિવાર, ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૧
૪.	શ્રી હરેશકુમાર મોદી	મેનેજીંગ ડિરેક્ટર	શુક્રવાર, ૬ સપ્ટેમ્બર, ૨૦૧૯	મંગળવાર, ૧૨ ઓક્ટોબર, ૨૦૨૧
૫.	શ્રી અશોક કે. પટેલ	નિયામક	મંગળવાર, ૧૨ ઓક્ટોબર, ૨૦૧૬	લાગુ પડતું નથી
૬.	શ્રી અશ્વીનીકુમાર યાદવ	નિયામક	શુક્રવાર, ૨૧ ઓક્ટોબર, ૨૦૧૬	ગિરુવાર, ૧૧ નવેમ્બર, ૨૦૨૧
૭.	શ્રી સંદિપ ભાનુભાઈ વસાવા	નિયામક	બુધવાર, ૭ સપ્ટેમ્બર, ૨૦૧૬	લાગુ પડતું નથી
૮.	શ્રી પ્રકાશ મકવાણા	નિયામક	૨૨ ઓગસ્ટ, ૨૦૧૯	લાગુ પડતું નથી
૯.	શ્રી સુરેશ ડાહ્યાલાલ પટેલ	નિયામક	ગુરુવાર, ૨૬ જુન, ૨૦૧૪	લાગુ પડતું નથી
૧૦.	શ્રી બી.જી. વાઘેલા	નિયામક	બુધવાર, ૪ ડિસેમ્બર, ૨૦૧૮	શુક્રવાર, ૩૦ એપ્રિલ, ૨૦૨૧
૧૧.	શ્રી ડી.બી. નિમાવત	નિયામક	શનિવાર, ૧ મે, ૨૦૨૧	લાગુ પડતું નથી

હિસાબી ધોરણ-૧૮ મુજબ, સંબંધિત પાર્ટીઓ સાથેની લેવડ-દેવડ નીચે જણાવવામાં આવી છે:

ક્રમ	સંબંધિત પાર્ટીનું નામ	સંબંધ	લેવડ-દેવડ
૧.	હરેશકુમાર મોદી	મેનેજીંગ ડિરેક્ટર	મેનેજીંગ ડિરેક્ટરને ચુકવણી રૂ. ૧૯.૯૯ લાખ

સરવૈયાની તારીખે સંબંધિત પાર્ટીને લગતી કોઈ રકમ બાકી નથી.

૨૯.૦ જરૂર જણાયું છે ત્યાં અગાઉના વર્ષના આંકડા પુનઃવર્ગીકૃત કરીને ગોઠવવામાં આવ્યા છે.

૩૦.૦ કેશફ્લો પત્રક, હિસાબી ધોરણ-૩ હેઠળ નિર્દિષ્ટ કરવામાં આવેલી, કેશફ્લોની પરોક્ષ પદ્ધતિથી તૈયાર કરવામાં આવ્યું છે.

૩૧.૦ અનુદાન અને વર્ષ દરમિયાન તેના ઉપયોગની વિગતો
કંપનીને નીચેની વિગતે અનુદાન મળ્યાં છે.

(રકમ રૂપિયામાં)

ક્રમ નં.	પરિયોજના	૦૧/૦૪/૨૦૨૦ના રોજ ઉઘડતી સિલક	પ્રાપ્ત થયેલી/ (પરત કચેલી) ગ્રાન્ટ	કરવામાં આવેલ કુલ ખર્ચ	ગ્રાન્ટ સામે સમાયોજિત	વર્ષ દરમિયાનઆંતર સદર સમાયોજન	૩૧/૦૩/૨૦૨૧ના રોજ બંધ થતી સિલક
૧.	આર.ઓ.બી. ફંડ	૩૧૮,૭૭૪,૫૭૫	-	-	-	-	૩૧૮,૭૭૪,૫૭૫
૨.	છાયાપુરી આર.ઓ.બી.	૧૧૦,૯૬૦,૧૯૭	-	-	-	-	૧૧૦,૯૬૦,૧૯૭
૩.	નેનો અમદાવાદ વિરમગામ માળિયા ટોલ-વે વી.જી.એફ.	૪૨,૮૪૪,૨૫૭	-	-	-	-	૪૨,૮૪૪,૨૫૭
૪.	ભરૂચ-દહેજ ફંડ (ગુજરાત સરકારનું ફંડ)	૧૨૫,૮૦૪,૦૮૩	-	-	-	-	૧૨૫,૮૦૪,૦૮૩
૫.	અંદાજપત્ર સદર - ૩ (ગુજરાત સરકારનું વહીવટી ખર્ચ માટેનું ફંડ) (જી.એસ.આર.ડી.સી.)	૨,૪૫૦,૦૦૦	-	-	-	-	૨,૪૫૦,૦૦૦
૬.	અનુદાન ભંડોળ પરનું વ્યાજ	૧,૫૯૮,૧૭૧,૦૮૫	૧૮૨,૮૭૧,૦૦૫	-	-	-	૧,૭૮૧,૦૪૨,૦૯૦
૭.	વીજીએફ યુટીલીટી શીફ્ટીંગ ફંડ	૨૫૧,૪૯૩,૩૫૨	-	-	-	-	૨૫૧,૪૯૩,૩૫૨
૮.	વીજીએફ બાંધકામ ભંડોળ	૧૮૫,૮૩૩,૦૦૦	-	-	-	-	૧૮૫,૮૩૩,૦૦૦
૯.	ગુજરાત સરકારનું ખનગીકરણ માટેનું ફંડ	૧,૩૯૬,૭૭૧,૬૪૮	૪૦૧,૭૦૦,૦૦૦,	૨૬૭,૮૯૯,૦૭૫	(૨૬૭,૮૯૯,૦૭૫)	-	૧,૫૩૦,૫૭૨,૫૭૩
૧૦.	કેન્દ્રીય માર્ગ ભંડોળ સુરત બારડિલી દાસ્તાન	૪૯,૮૯૫,૪૬૮	-	-	-	-	૪૯,૮૯૫,૪૬૮
૧૧.	ટોલ મુક્તિ માટે ગુજરાત સરકારની ગ્રાન્ટ	-	૧,૧૩૨,૦૦૦,૦૦૦	૧,૧૧૭,૦૫૫,૮૧૭	(૧,૧૧૭,૦૫૫,૮૧૭)	-	૧૪,૯૪૪,૧૮૩
૧૨.	૧૯-જીએસઆરડીસીને ગુજરાત સરકારની ગ્રાન્ટ	૧૪,૧૦૧,૭૨૪	૬૦૯,૦૦૦,૦૦૦	૬૨૩,૧૦૧,૭૨૪	(૬૨૩,૧૦૧,૭૨૪)	-	-
	સરવાળો	૪,૦૯૭,૦૯૯,૩૮૯	૨,૩૨૫,૫૭૧,૦૦૫	૨,૦૦૮,૦૫૬,૬૧૬	(૨,૦૦૮,૦૫૬,૬૧૬)	-	૪,૪૧૪,૬૧૩,૭૭૮

૩૨.૦ આકસ્મિક જવાબદારીઓ

૩૨.૧ કંપની સામેના એવા દાવાજેને દેવા તરીકે સ્વીકારવામાં નથી આવ્યા

(રકમ રૂપિયામાં)

ક્રમ. નં	વિગત	સ્થિતિનું નામ	લેણાંનો પ્રકાર	કુલ આકસ્મિક જવાબદારી	૩૧ માર્ચ ૨૦૨૧ સુધી વિરોધ હેઠળ જમા કરાવવામાં આવેલી રકમ	વિવાદ જ્યાં પડતર છે તે ફોરમ
૧	આવકવેરા અધિનિયમ, ૧૯૬૧	આવકવેરો, લાગુપડવાપાત્ર વ્યાજ અને દંડ સહિત	૩૯૭૨૯૬૭૭૦ (અગાઉનાં વર્ષે ૩૯૭૨૯૬૭૭૦)	૧૭૫૮૯૧૨૦ (અગાઉનાં વર્ષે ૧૭૫૮૯૧૨૦)	૨૦૧૦-૧૧	આઈટીએટી
૨	આવકવેરા અધિનિયમ, ૧૯૬૧	આવકવેરો, લાગુપડવાપાત્ર વ્યાજ અને દંડ સહિત	૩૩૯૭૮૫૨૮૦ (અગાઉનાં વર્ષે ૩૩૯૭૮૫૨૮૦)	-	૨૦૧૧-૧૨	આઈટીએટી
૩	આવકવેરા અધિનિયમ, ૧૯૬૧	આવકવેરો, લાગુપડવાપાત્ર વ્યાજ અને દંડ સહિત	૬૨૨૪૫૩૨૦ (અગાઉનાં વર્ષે ૬૨૨૪૫૩૨૦)	૧૨૪૪૯૦૭૦ (અગાઉનાં વર્ષે ૧૨૪૪૯૦૭૦)	૨૦૧૧-૧૨	આઈટીએટી
૪	આવકવેરા અધિનિયમ, ૧૯૬૧	આવકવેરો, લાગુપડવાપાત્ર વ્યાજ અને દંડ સહિત	૨૦૭૨૪૦૧૦ (અગાઉનાં વર્ષે ૨૦૭૨૪૦૧૦)	-	૨૦૧૨-૧૩	આઈટીએટી

૩૨.૨ નીચેના લવાદી કેસો નિગમ સમક્ષ પડતર છે. જેમાં નિગમે વિવાદ ઊભો કર્યો છે.

ક્રમ નં.	પક્ષકારનું નામ	વિવાદ ક્યાં અનિર્ણિત છે	૨૦૨૦-૨૧	૨૦૧૯-૨૦
૧	રણજીત ટોલ રોડ પ્રા. લિ. છાયાપુરી આર.ઓ.બી	વિવાદ નિરાકરણ-લવાદી પંચની કાર્યવાહી ચાલુ છે.	રૂ. ૯.૯૦ કરોડ વત્તા વ્યાજ	રૂ. ૯.૯૦ કરોડ વત્તા વ્યાજ
૨	રણજીત ટોલ રોડ પ્રા.લિ. ડીસા પાંચાવાડા ગુંદેરી માર્ગ	એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે જેને જી.એસ.આર.ડી.સી.એ નામદાર કોમર્શિયલ કોર્ટ સમક્ષ પડકાર્યો છે.	રૂ. ૪૫ કરોડ	રૂ. ૪૫ કરોડ
૩.	એમ.એસ. ખુરાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ટોલ રોડ પ્રા.લિ. ભુજ નખત્રાણા માર્ગ	એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે જેને જી.એસ.આર.ડી.સી.એ નામદાર કોમર્શિયલ કોર્ટ સમક્ષ પડકાર્યો છે.	રૂ. ૨૪.૧૭ કરોડ વત્તા વ્યાજ	રૂ. ૨૧.૧૭ કરોડ વત્તા વ્યાજ
૪	એમ.એસ. ખુરાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ રોલ રોડ પ્રા.લિ. ભુજ નખત્રાણા માર્ગ	કન્સેશનેયરે, નિગમ દ્વારા કરવામાં આવેલા જુદા જુદા અર્થઘટનોના આધારે ફીની ગણતરી અંગે વિવાદ ઊભો કર્યો છે. જેને પરિણામે બાબત લવાદને સોંપવાની માંગણી થઇ છે. લવાદી કાર્યવાહી ચાલુ છે.	રૂ. ૨.૮ કરોડ અને રીકરીંગ (આવર્તનો ચાલુ)	રૂ. ૨.૮ કરોડ અને રીકરીંગ (આવર્તનો ચાલુ)
૫	વેલસ્પન પ્રોજેક્ટ લિમિટેડ ભરૂચ-દહેજ રોડ	ગુજરાત પબ્લિક વર્કસ કોન્ટ્રાક્ટ ડિસ્પ્યુટ આર્બિટ્રેશન ટ્રીબ્યુનલ, અમદાવાદ માર્ગ અને મકાન વિભાગના આઈટમ રેટ ટેન્ડર માટેની હકુમત ધરાવતું હોવાથી તેની સમક્ષ આર્બિટ્રેશનનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. કાર્યવાહી ચાલુ છે.	રૂ. ૫૪.૪૬ કરોડ	રૂ. ૫૪.૪૬ કરોડ

૬	જીએમસી ઇન્ફ્રા - બીએન્ડઆર ઇન્ફ્રા ભારત ડીસા ટોલ રોડ પ્રાઇવેટ લિમિટેડ ડીસા પાંથાવાડા ગુંદેરી રોડ	આર્બિટ્રેશન હેઠળ આ ચુકાદો આપવામાં આવ્યો છે અને જીએસઆરડીસી દ્વારા તેને જિલ્લા અદાલતમાં પડકારવામાં આવ્યો છે. ત્યારબાદ તે કેસ વાણિજ્ય કોર્ટમાં તબદીલ કરવામાં આવ્યો છે. કેસની કાર્યવાહી ચાલે છે.	રૂ. ૯.૦૪ કરોડ + વ્યાજ	રૂ. ૯.૦૪ કરોડ + વ્યાજ
૭	વેલસ્પન પ્રોજેક્ટ લિમિટેડ ચીઆરી અંજાર પ્રોજેક્ટ	આર્બિટ્રેશન હેઠળ આ ચુકાદો આપવામાં આવ્યો છે અને જીએસઆરડીસી દ્વારા તેને જિલ્લા અદાલતમાં પડકારવામાં આવ્યો છે. ત્યારબાદ તે કેસ વાણિજ્ય કોર્ટમાં તબદીલ કરવામાં આવ્યો છે. કેસ બોર્ડ પર આવ્યો નથી.	રૂ. ૨.૩૮ કરોડ	રૂ. ૨.૩૮ કરોડ
૮	જીવીકે બગોદરા વાસદ એક્સપ્રેસ વે લિમિટેડ	જીએસઆરડીસીએ કન્સેશનર વિરુદ્ધ રૂ.૧૦૮૪.૧૯ કરોડનો હકદાવો દાખલ કર્યો છે. આર્બિટ્રેશન પેનલ રચવામાં આવી છે. બંને પાર્ટીઓ દ્વારા દસ્તાવેજો દાખલ કરવામાં આવ્યા છે. જીવીકે એ રૂ.૩૪૮૦.૭૯ કરોડનો સામો દાવો દાખલ કર્યો છે.	રૂ. ૩૪૮૦.૭૯ કરોડ	રૂ. ૩૪૮૦.૭૯ કરોડ
૯	એમ.એસ. ખુરાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ટોલ રોડ પ્રાઇવેટ લિમિટેડ ભુજ નખત્રાણા માર્ગ	જીએસઆરડીસી એ કન્સેશનર વિરુદ્ધ રૂપિયા ૫૪.૩૪ કરોડ વત્તા વ્યાજનો હકદાવો દાખલ કર્યો છે. આર્બિટ્રેશન પેનલ રચવામાં આવી છે. બંને પાર્ટીઓ દ્વારા દસ્તાવેજો દાખલ કરવામાં આવ્યા છે. કન્સેશનરે રૂપિયા ૧૬૭.૬૫ કરોડનો સામો દાવો દાખલ કર્યો છે.	રૂ. ૧૬૭.૬૫ કરોડ + વ્યાજ	રૂ. ૧૬૭.૬૫ કરોડ + વ્યાજ
૧૦	એલ એન્ડ ટી રાજકોટ વાડીનાર ટોલ વે લિમિટેડ રાજકોટ જામનગર વાડીનાર માર્ગ	જીએસઆરડીસીના રૂ.૨૭.૫૫ કરોડના દાવા સામે કન્સેશનરે આર્બિટ્રેશન કેસ દાખલ કર્યો છે. જીએસઆરડીસીએ કન્સેશનર વિરુદ્ધ રૂ.૩૭.૧૦ કરોડનો સામો દાવો દાખલ કર્યો છે. આર્બિટ્રેશન પેનલ રચવામાં આવી છે. દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા છે. બાબત સુનાવણીના તબક્કે છે.	રૂ. ૨૭.૫૫ કરોડ અને રિકરીંગ + વ્યાજ	
૧૧	એલ એન્ડ ટી હાલોલ શામળાજી ટોલ વે લિમિટેડ હાલોલ ગોધરા શામળાજી માર્ગ	જીએસઆરડીસીના રૂ.૨૨.૪૪ કરોડના દાવા સામે કન્સેશનરે આર્બિટ્રેશન કેસ દાખલ કર્યો છે. જીએસઆરડીસીએ કન્સેશનર વિરુદ્ધ રૂ.૧૨૫.૮૯ કરોડનો સામો દાવો દાખલ કર્યો છે. આર્બિટ્રેશન પેનલ રચવામાં આવી છે. દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા છે. બાબત સુનાવણીના તબક્કે છે.	રૂ. ૨૨.૪૪ કરોડ અને રિકરીંગ + વ્યાજ	
૧૨	અમદાવાદ માળીયા ટોલ વે લિમિટેડ અમદાવાદ માળીયા માર્ગ	જીએસઆરડીસીના રૂ.૭૧.૧૯ કરોડના દાવા સામે કન્સેશનરે ૫૪.૩૪ કરોડ વત્તા વ્યાજનો આર્બિટ્રેશન કેસ દાખલ કર્યો છે. જીએસઆરડીસીએ કન્સેશનર વિરુદ્ધ રૂ.૨૦૩.૨૩ કરોડનો સામો દાવો દાખલ કર્યો છે. આર્બિટ્રેશન પેનલ રચવામાં આવી છે. દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા છે. બાબત સુનાવણીના તબક્કે છે.	રૂ. ૭૧.૧૯ કરોડ અને રિકરીંગ + વ્યાજ	

ક્રમ. નં.	નિગમે જુદી જુદી પાર્ટીઓ સામે નીચે મુજબના કેસ દાખલ કર્યા છે, જે અંગે પાર્ટીઓએ વિવાદ ઊભો કર્યો છે અને તે ૩૧/૦૩/૨૦૨૧ના રોજ મુજબ પડતર છે.	૨૦૨૦-૨૧	૨૦૧૯-૨૦	
૧	જીવીકે બગોદરા વાસદ એક્સપ્રેસવે લિમિટેડ બગોદરા વાસદ	જીએસઆરડીસીએ કન્શીસનેર વિરુદ્ધ રૂ.૧૦૮૪.૧૯ કરોડનો હકદાવો દાખલ કર્યો છે. આર્બિટ્રેશન પેનલ રચવામાં આવી છે. બંને પાર્ટીઓ દ્વારા દસ્તાવેજો દાખલ કરવામાં આવ્યા છે.	રૂ. ૧૦૮૪.૧૯ કરોડ	રૂ. ૧૦૮૪.૧૯ કરોડ
૨	એમ.એસ ખુરાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ટુલ રોડ પ્રાઇવેટ લિમિટેડ ભુજ નખત્રાણા	જીએસઆરડીસી એ કન્શીસનેર વિરુદ્ધ રૂપિયા ૫૪.૩૪ કરોડ વત્તા વ્યાજનો હકદાવો દાખલ કર્યો છે. આર્બિટ્રેશન પેનલ રચવામાં આવી છે. બંને પાર્ટીઓ દ્વારા દસ્તાવેજો દાખ કરવામાં આવ્યા છે.	રૂ. ૫૪.૩૪ કરોડ	રૂ. ૫૪.૩૪ કરોડ

૩૩. વર્ષ દરમિયાન મૂડીકૃત કરવામાં આવેલ કરજ સંબંધી ખર્ચ – શૂન્ય (અગાઉના વર્ષે – શૂન્ય)

૩૪. સંગમેન્ટ રીપોર્ટીંગ (ઘટક અંગેની જાણ કરવા બાબત)

આ કંપની માત્ર એક ઘટક સાથે જોડાયેલી છે અને તે છે માર્ગો અને પુલોનો વિકાસ અને તેમનાં નિભાવ કામો. હિસાબી ધોરણો-૧૭ના સંદર્ભમાં આ બાબતો એક મુખ્ય ઘટક બને છે. તેથી હિસાબી ધોરણ-૧૭ મુજબ જાહેરાત કરવી જરૂરી નથી.

૩૫. આવરી લેવામાં આવેલા તમામ હિસાબો સહિત માર્ગ અને મકાન વિભાગ, ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ, પ્રકિર્ણ દેવાદારો, પ્રકિર્ણ લેણદારોની તારણ વિનાની લોન, લોન અને પેશગીઓ તેમજ અન્ય બાકી સિલકો સહિતની સિલક સમર્થનને અધીન છે. નિયામક મંડળના મતે ચાલુ મિલકતો, લોન અને પેશગીઓની અંદાજ કિંમત સામાન્યપણે અહીં દર્શાવવામાં આવ્યા મુજબની છે.

૩૬. “માઇક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝ ડવલપમેન્ટ એક્ટ-૨૦૦૬” હેઠળ લેણાંની વિગતો

કંપનીને સપ્લાયર્સ પાસેથી “માઇક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝ ડવલપમેન્ટ એક્ટ-૨૦૦૬” હેઠળ તેમના દરજ્જા અંગે કોઈ માહિતી મળી નથી. તેથી નીચેની બાબતો જાહેર કરવામાં આવી નથી.

(ક) હિસાબી વર્ષના અંતે સપ્લાયર્સને મુકવાની અને બાકી રકમ

(ખ) હિસાબી વર્ષના અંતે ચુકવવાપાત્ર વ્યાજ

(ગ) હિસાબી વર્ષના અંતે ઊપાર્જિત અને વણચુકવાયેલ વ્યાજ

અધિનિયમ હેઠળ સપ્લાયર્સ પાસેથી તેમની સ્થિતિ (સ્ટેટ્સ) અંગે સમર્થન મેળવવાના પ્રયાસો કંપની કરી રહી છે.

૩૭. જીએસએફએસ પાસે રહેલી ફિક્સ ડિપોઝીટ્સ અને લિક્વિડ ડિપોઝીટ્સ પર મળેલું રૂ. ૧૮,૨૮,૭૧,૦૦૫.૦૦નું (ગત વર્ષે રૂ. ૨૪,૮૬,૫૬,૨૨૮.૦૦) વ્યાજ ગ્રાન્ટ ઇંડ ખાતે જમા લેવામાં આવ્યું છે. કારણ કે આ ડિપોઝીટો ગુજરાત સરકાર તરફથી મળેલાં અનુદાનોમાંથી મૂકવામાં આવી છે.

૩૮. મહત્વની હિસાબી નીતિ-૧ "આવકની ઓળખ" મુજબ નીચે પ્રમાણેની આવક ખરેખર પ્રાપ્તિ/વસૂલાતના આધારે ઓળખવામાં આવી છે, કારણકે અગાઉ તે અંગે પૂરતી નિશ્ચિતતા ન હતી.

૧. ચાલુ નાણાકીય વર્ષે એલ એન્ડ ટી એવીએમ પ્રોજેક્ટ રૂ.૪૨,૯૨,૮૯,૧૯૭.૦૦ (નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ સુધી રૂ.૪૨,૨૭,૬૧,૧૫૦.૦૦)
૨. ચાલુ નાણાકીય વર્ષે એલ એન્ડ ટી આરજેવી પ્રોજેક્ટ રૂ. ૧૨,૭૮,૪૯,૬૧૯.૦૦ (નાણાકીય વર્ષ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ સુધી રૂ.૮,૪૪,૪૮,૪૮૪.૦૦)
૩. ચાલુ નાણાકીય વર્ષે એલ એન્ડ ટી એચજીએસ પ્રોજેક્ટ રૂ. ૨૪,૫૯,૪૧,૮૮૯.૦૦ (નાણાકીય વર્ષ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ સુધી રૂ. ૫,૪૬,૬૭,૩૨૭.૦૦)

૩૯. ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ, ગાંધીનગરના તારીખ ૦૯/૦૫/૨૦૧૮ના પત્ર ક્રમાંક એનએચઆર-૧૦-૨૦૦૯-૮૨૫૦૩૬-ભાગ-૬-એમ અને તારીખ ૦૩/૧૧/૨૦૧૮ના પત્ર ક્રમાંક એનએચઆર-૧૦-૨૦૦૯-૮૨૫૦૩૬-ભાગ-૬-એમ અન્વયે, માર્ગ અને મકાન વિભાગ, ગુજરાત સરકાર, ગાંધીનગરને અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં ૮-એ (નવો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૭) અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૮૮ (નવો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૨૭)ને પહોળો/અપગ્રેડ કરી ચાર-માર્ગીયમાંથી છ-માર્ગીય બનાવવા માટે જીએસએફએસએલ પાસેથી રૂ. ૧૮૪૭ કરોડની નાણાકીય સહાય મેળવવાની મંજૂરી આપવામાં આવી હતી. ૨૦૨૦-૨૧ના વર્ષ દરમિયાન જીએસએફએસએલ દ્વારા રૂ.૨૧૩.૧૧ની રકમ (રૂ.૪૦.૬૯ કરોડના મૂડીકૃત કરવામાં આવેલા વ્યાજ સહિત) આપવામાં આવી છે અને જીએફએફએસએલ પાસેથી પ્રાપ્ત થયેલી રકમ, આ લોન જીએસએફએસએલ પાસેથી જે શરતોએ મેળવવામાં આવી છે તે જ શરતોથી રાષ્ટ્રીય ધોરીમાર્ગને ઉક્ત પ્રોજેક્ટ માટે પેશગીરૂપે આપવામાં આવી છે. તેથી, જીએસએફએસએલ પાસેથી મેળવેલી લોન ઉપર વ્યાજ પેટે કરવામાં આવેલ ખર્ચ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પાસેથી વ્યાજ પેટે થયેલ આવકને નાણાકીય ખર્ચમાં સરભર કરવામાં આવ્યા છે.

૪૦. Covid-19ની વૈશ્વિક મહામારીના સંદર્ભમાં અનિશ્ચિતતાઓનો અંદાજ

કંપનીએ covid-19ની મહામારીના પરિણામે મળવાપાત્ર ચાલુ રકમ પર પડનારી સંભવિત અસરો ધ્યાનમાં લીધી છે. મહામારીને કારણે વૈશ્વિક આર્થિક પરિસ્થિતિઓમાં સંભવિત ભાવિ અનિશ્ચિતતાઓને લગતી ધારણાઓ કરતી વખતે, આ નાણાકીય પત્રકોને મંજૂરી આપવાની તારીખે ક્રેડિટ રિપોર્ટ્સ અને સંબંધિત માહિતી, આર્થિક અટકળો સહિત આંતરિક અને બાહ્ય સ્ત્રોતોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કંપનીએ, ઉપયોગમાં લેવામાં આવેલી ધારણાઓ અંગે સંવેદનશીલ પૃથક્કરણ કર્યું છે અને ચાલુ અંદાજોના આધારે તેને આશા છે કે આ મિલકતોની ચાલુ કિંમત વસૂલ કરી શકાશે. Covid 19ની કંપનીના નાણાકીય પત્રકો પરની અસર, આ નાણાકીય પત્રકોની મંજૂરીની તારીખે જુદી જુદી હોઈ શકે છે. કંપનીને આશા છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારે અર્થવ્યવસ્થાને પુનઃ બેઠી કરવા માટે લીધેલાં પગલાંને ધ્યાનમાં લેતા, લોકડાઉનને કારણે લિઝાઈટની માગ પરની અસર માત્ર ટૂંકા ગાળા માટે જ રહેશે. કંપનીનું કામકાજ ચાલુ રાખવાની અને જ્યારે પણ કોઈ ચૂકવવાની જવાબદારી ઊભી થાય ત્યારે તેને પહોંચી વળવાની કંપનીની ક્ષમતા ઉપર આ તબક્કે કોઈ મધ્યમ કે લાંબા ગાળાનું જોખમ હોવાનું વ્યવસ્થાપક મંડળને જણાતું નથી.

અમારા સમાન તારીખના અહેવાલ મુજબ

ઇનાની એન્ડ ઇનાની

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ

પેઢી નોંધણી નં. -૧૨૦૫૦૭૬બલ્યુ વતી

નિયામક મંડળના નામે અને તેમના વતી

(અંકિત શાહ)

ભાગીદાર

સભ્ય પદ નં. ૧૪૫૫૬૯

૦૮૯૩૭૦૧૦

(અશોક કે. પટેલ)

(વહીવટી સંચાલક)

ડીઆઇએન-૦૦૦૯૪૦૩૬૯૪

(ડી.બી.નિમાવત)

નિયામક

ડીઆઇએન-

સ્થળ : ગાંધીનગર

તા. ૩૦/૧૧/૨૦૨૧

યુડીઆઇએન નં:૨૧૧૪૫૫૬૯એએએસીડીપ૫૦૦

(શીતલ શાહ)

ઇ.ચા. કંપની સેક્રેટરી

વહીવટી અહેવાલ

૨૦૨૦-૨૦૨૧

કંપની અધિનિયમ ૨૦૧૩ની કલમ-૩૯૫

ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ લિમિટેડ

વર્ષ ૩૧-૦૩-૨૦૨૧ અંતિત

તૈયાર કરનાર

એસ. બી. વસાવા
સચિવ
માર્ગ અને મકાન વિભાગ

માર્ગ અને મકાન વિભાગ

ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ લિમિટેડ

(ગુજરાત સરકારનું ઉપક્રમ)

વહીવટી અહેવાલ

૧. સ્થાપનાનો ઉદ્દેશ :

રાજ્ય સરકારે ખાનગી ક્ષેત્રની ભાગીદારીથી રાજ્યમાં આધાર માળખાકીય સુવિધાઓ વિકસાવવાનો અભિગમ આપનાવ્યો છે. ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ લિમિટેડની મુખ્ય પ્રવૃત્તિઓ ખાનગી ક્ષેત્રની ભાગીદારીથી માર્ગો અને પૂલો તૈયાર કરવાની છે. આ સંદર્ભમાં માર્ગો અને પૂલોને લગતા પ્રોજેક્ટસના સંભાવના અહેવાલો તૈયાર કરવા, બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર (બીઓટી) આધારિત પ્રોજેક્ટસ માટે બીડીંગ ડોક્યુમેન્ટસ તૈયાર કરવા/ ખાનગી જાહેર ભાગીદારીના મોડલના આધારે ગુજરાત સરકારની વાયાબીલીટી ગેપ ફન્ડીંગ યોજના માટે બીલડીંગ ડોક્યુમેન્ટસ તૈયાર કરવા અને આ માટે જરૂરી મંજૂરીઓ મેળવવા માટે ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ (જીઆઇડીબી) તથા માર્ગ અને મકાન વિભાગ સાથે નિકટનો સહયોગ મેળવીને કામગીરી કરવાનો સમાવેશ થાય છે.

વધુમાં, ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ લિમિટેડે, બી.ઓ.ટી. ધોરણે માર્ગોની સુધારણા અને માર્ગો પહોળા કરવાની કામગીરી હાથ ધરવાની હોય છે અને આ કામગીરી બી.૧ અને બી-૨ ધોરણે પણ હાથ ધરવાની હોય છે. તેમ જ માર્ગ અને મકાન વિભાગ દ્વારા સોંપવામાં આવે તેવી અન્ય તમામ કામગીરી પણ કરવાની હોય છે.

૨. મુખ્ય હેતુઓ

- ખાનગી ક્ષેત્રના રોકાણ સાથે માર્ગો અને પૂલોને લગતા પ્રોજેક્ટ તૈયાર કરવા - પ્રોજેક્ટસ માટે સંભાવના અભ્યાસો તૈયાર કરવા
- અભ્યાસમાં કરવામાં આવેલી ભલામણોના આધારે બીઓટી આધારિત પ્રોજેક્ટ તૈયાર કરવા માટે રાજ્ય સરકાર અને જીઆઇડીબી સાથે પરામર્શ કરવો અને સંબંધિત પ્રવૃત્તિઓ હાથ ધરવી.
- જીઆઇડી એક્ટ ૧૯૮૮ની જોગવાઈઓ મુજબ જાહેર બોલીઓ મંગાવવાની કામગીરી હાથ ધરવી અને પ્રોજેક્ટસ માટેના બીડર નક્કી કરવા.

૩. મૂડીસંબંધી માળખું

- શેર મૂડી : ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ લિમિટેડની અધિકૃત શેરમૂડી રૂ. ૫ કરોડ છે. જે પૂરેપૂરી ભરપાઈ થયેલી છે.
- વર્ષ ૧૯૯૯માં ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ લિમિટેડને ઇક્વિટી ભંડોળ તરીકે રાજ્ય સરકારે રૂ.૧ કરોડનો ફાળો આપ્યો છે.

૪. પ્રવૃત્તિઓની સમીક્ષા

આપની કંપનીની સ્થાપના, ઓછામાં ઓછા જાહેર ભંડોળ સાથે, જાહેર-ખાનગી ભાગીદારીથી તેમ જ અન્ય રીતે માર્ગો તૈયાર કરવાના મુખ્ય ઉદ્દેશ સાથે, સંપૂર્ણપણે ગુજરાત સરકારની માલિકીની કંપની તરીકે કરવામાં આવી હતી. આ કંપની બાંધકામ પૂર્વેની પ્રવૃત્તિઓ સહિત, આવી પરિયોજનાઓને લગતી તમામ પ્રકારની પ્રવૃત્તિઓ હાથ ધરે છે.

વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન કંપનીએ મુખ્યત્વે નીચે મુજબની પરિયોજનાઓ/ પ્રવૃત્તિઓ હાથ ધરી છે.

સંચાલન અને નિભાવ હેઠળ કુલ સાત પરિયોજનાઓ - હિંમતનગર બાઇપાસ, ભુજ-નખત્રાણા, કિમ-માંડવી અને ડીસા-પાથાવાડા-ગુંદરી તથા ૩ વી.જી.એફ. માર્ગ પરિયોજનાઓની કામગીરી ચાલુ છે અને નિભાવ કામગીરી કરવામાં આવી છે.

બગોદરા-તારાપુર-વાસદ માર્ગને છ-માર્ગીય બનાવવા માટેના કન્સેશન એગ્રીમેન્ટ ૧૩/૦૨/૨૦૧૧ના રોજ કન્સેશનેર સાથે કરવામાં આવ્યા હતા. જે જરૂરી પ્રગતિ ન થવાના કારણે સમાપ્ત કરવામાં અને પડતા મૂકવામાં આવ્યા છે. મોડીફાઇડ અન્યુઇટીના આધારે બે પેકેજોના નવા ટેન્ડરો મંજૂર કરવામાં આવ્યા હતા અને બાંધકામ ચાલુ થયું છે.

ભુજ-ભયાઉ માર્ગ પરિવહન માટેના કન્સેશન એગ્રીમેન્ટ તા.૧૩/૦૭/૨૦૧૧ના રોજ કરવામાં આવ્યા હતા. આ કામ ચાલુ હતું અને એના પર દેખરેખ નિયંત્રણ રાખવામાં આવતું હતું અને પરિયોજનાસંબંધી બાબતો પર ધ્યાન આપવામાં આવતું હતું, જેથી તે ઝડપથી પૂરું કરી શકાય.

ભુજ-નખત્રાણા માર્ગ માટે કન્સેશનેર એમ.એસ.કે. ભુજ નખત્રાણા ટોલ રોડ પ્રા. લિ. (એમ.એસ.કે. પ્રોજેક્ટ લિમિટેડ સાથે જોડાણ) સાથે અમલ કરાયેલ કન્સેશન કરાર, કામગીરી અને જાળવણીની જવાબદારી પૂર્ણ ન થવાને કારણે સમાપ્ત કરવામાં આવ્યો છે. જીએસઆરડીસી તરફથી કન્સેશનેર સામે આર્બિટ્રેશનમાં દાવાઓ રજૂ કરેલ છે.

જીએસઆરડીસી દ્વારા ભરૂચ-દહેજ રસ્તાને છ-માર્ગીય કરી તેના પર ટોલ ઉઘરાવવાનું કામ તા.૧૬મી ફેબ્રુઆરી ૨૦૧૭થી ચાલુ કરવામાં આવેલ, જેના પરિણામે નિગમની આવકમાં વધારાનો સ્રોત ઊભો થયેલ છે. તેના નિભાવની કામગીરી જીએસઆરડીસી સંભાળે છે.

જીએસઆરડીસી દ્વારા સુરત-બારડોલી માર્ગને ચાર માર્ગીય બનાવવાનું કામ (લગભગ ૧૫ માઈલ લંબાઈના માર્ગ કામો) ઘણા વખત પહેલા પૂરું થઈ ચૂક્યું છે. દાસ્તાન ફાટક, સુરત-બારડોલી માર્ગ ખાતે ચાર માર્ગીય આર.આર.બી. પ્રવેશોનું કામ ચાલુ રહ્યું હતું.

ચીખલી-સાપુતારા માર્ગ માટે વિગતવાર પ્રગતિ અહેવાલ તૈયાર કરવા માટે કન્સલ્ટન્ટ, હાઈવે એન્જિનિયરિંગની નિમણૂક કરવામાં આવી છે. કન્સલ્ટન્ટ જિઓ ડિઝાઇન્સ એન્ડ રિસર્ચ પ્રાઇવેટ લિમિટેડની નિમણૂક સચાણા આર.આર.બી.નો વિગતવાર પ્રગતિ અહેવાલ તૈયાર કરવા માટે કરવામાં આવી છે. જમીન સંપાદનની કામગીરી તા.૧૯/૦૩/૨૦૨૧ના રોજ પૂરી કરવામાં આવી છે.

પ. નિયામક મંડળ :

સમીક્ષા હેઠળના વર્ષ દરમિયાન નિયામક મંડળમાં નીચે મુજબના ફેરફારો કરવામાં આવ્યા છે.

ક્રમ નં.	નામ, પિતાનું નામ, સરનામું	ડી.આઇ.એન. / પી.એ.એન.	હોદ્દો	નિમણૂકની તારીખ	હોદ્દો છોડ્યાની તારીખ
૧.	શ્રી પૂર્ણેશકુમાર ઇશ્વરલાલ મોદી ઇશ્વરલાલ મોદીના પુત્ર સરનામું: ૪/સંઇધામ રો હાઉસીસ, અડાજણ ફાયર સ્ટેશન પાસે, અડાજણ, સુરત - ૩૯૫૦૦૯	૦૯૪૨૪૯૦૦	નિયામક	૨૩/૦૯/૨૦૨૧	ચાલુ
૨.	શ્રી નીતિનકુમાર રતિલાલ પટેલ, શ્રી રતિલાલ મંગયળલાલ પટેલના પુત્ર સરનામું : નંબર-૮, મણિચંદ્ર, ભાગ-૪, સુરધારા સર્કલ પાસે, થલતેજ, અમદાવાદ, ગુજરાત-૩૮૨૦૦૫૯	૦૬૯૩૬૮૩૮	નિયામક	૨૦-૬-૨૦૧૪	૨૩/૦૯/૨૦૨૧
૩.	શ્રી અશોકભાઈ કે. પટેલ સરનામું: ૨૦૧ ઇ૧ ટાવર, સમર્પણ ફ્લેટ્સ, ગવર્નમેંટ ઓફિસર્સ કોલોની, આઇડીબીઆઇ ક્વાર્ટર્સ સામે, ગુલબાઇ ટેકરા, અમદાવાદ	૦૦૯૪૦૩૬૯૪	વહીવટી સંચાલક	૧૨/૧૦/૨૦૨૧	ચાલુ
૪.	શ્રી હરેશકુમાર સી. મોદી શ્રી ચંદુલાલ મોદીના પુત્ર સરનામું: ૩૧/બી, ટ્યુલિપ બંગલોઝ, પાર્ટ-૨, સુરધારા સર્કલ પાસે, થલતેજ, અમદાવાદ, ગુજરાત-૩૮૦૦૫૪	૦૮૬૨૬૩૧૬	વહીવટી સંચાલક	૦૬/૦૯/૨૦૧૯	૧૨/૧૦/૨૦૨૧
૫.	શ્રી અશ્વિની કુમાર યાદવ, શ્રી રાજેન્દ્રપ્રસાદ યાદવના પુત્ર સરનામું : બંગલા નં. ૨૧૫/એ, 'ખ' ટાઇપ, સેક્ટર-૧૯, ગાંધીનગર, ગુજરાત-૩૮૨૦૧૯	૦૬૫૮૧૭૫૩	નામનિયુક્ત	૨૧-૧૦-૨૦૧૬	૧૧/૧૧/૨૦૧૧
૬.	શ્રી સંદીપ ભાનુભાઈ વસાવા, શ્રી ભાનુભાઈ વસાવાના પુત્ર સરનામું : 'ખ'-૧૮, સેક્ટર-૧૯, ગાંધીનગર, ગુજરાત-૩૮૨૦૧૯	૦૨૦૩૭૯૧૮	નામનિયુક્ત	૦૭-૦૯-૨૦૧૬	ચાલુ
૭.	શ્રી ડી.બી. નિમાવત શ્રી હેમંતરામ ગોડીયાના પુત્ર સરનામું: "સ્પંદન" પ્લોટ નં - ૧૧૬/૧, ઇન્ફ્રાઇરી ઓફિસ પાછળ, સેક્ટર - ૭-સી, ગાંધીનગર,	૦૮૯૩૭૦૧૦	નામનિયુક્ત	૦૧/૦૫/૨૦૨૧	ચાલુ
૮.	શ્રી બાબુજી ગુલાબજી, શ્રી ગુલાબજી વાઘેલાના પુત્રસરનામું: પ્લોટ નં-૧૨૨૮૨ સેક્ટર ૪સી, ગાંધીનગર	-	નામનિયુક્ત	૦૭/૦૯/૨૦૨૦	૩૦/૦૪/૨૦૨૧

૯	શ્રી પ્રકાશ મકવાણા શ્રી નારણભાઈ મકવાણાના પુત્ર સરનામું: ૨, ચંદન, એસબીઆઈ સ્ટાફ સોસાઇટી, એસ.ટી વર્કશોપ પાસે, બહેરામપુરા, અમદાવાદ, ગુજરાત-૩૮૦૦૨૧	૦૮૬૭૨૬૮૨	નિયમક	૨૨/૦૮/૨૦૧૯	ચાલુ
૧૦.	શ્રી સુરેશભાઈ ડાહ્યાભાઈ પટેલ, શ્રી ડાહ્યાભાઈ પુરુષોત્તમદાસ પટેલના પુત્ર સરનામું : ૨૫, શાલિન બંગ્લોઝ, સોમેશ્વર પાર્ક આઇ-૨ની સામે, ગુલાબ ટાવર નજીક, થલતેજ, અમદાવાદ, ગુજરાત-૩૮૦૦૫૪	૧૬૬૬૯૫૯	નિયામક	૨૬-૬-૨૦૧૪	ચાલુ

૬. વહીવટી માળખું

વર્ષ દરમિયાન આ સંગઠનમાં ૨૦ વ્યક્તિઓ કામ કરતી હતી.

૭. સમાપન

વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન કંપનીએ થાપણો પરના વ્યાજ, પ્રોજેક્ટ ડેવલપમેન્ટ ફી, પ્રીમીયમ, બીડ પ્રોસેસીંગ ફી વગેરે જેવા સ્ત્રોતોમાંથી રૂ. ૮૫.૧૪ લાખની આવક કરી છે. વર્ષ દરમિયાન કંપનીએ કુલ રૂ. ૬૮.૧૪ લાખનું ખર્ચ કર્યું છે જેમાં સંભાવના અભ્યાસો તૈયાર કરવાનો ખર્ચ, માર્ગના કામનો ધસારો વગેરેનો સમાવેશ થાય છે.



રજીસ્ટર્ડ ઓફીસ

**ભોય તળીયે, નિર્માણ ભવન, સેક્ટર ૧૦-એ,
ગાંધીનગર-૩૮૨૦૧૦.**

મો: +૯૧ ૭૯-૨૩૨૫૨૯૧૨, ૨૩૨૫૨૯૧૫.

Email : cosec-gsrdc@gujarat.gov.in , info@gsrdc.com

Web : www.gsrdc.com



Roads to the future

22ND ANNUAL REPORT 2020-21

GUJARAT STATE ROAD DEVELOPMENT CORPORATION LIMITED
(Govt. of Gujarat Undertaking)

CIN : U45200GJ1999SGC035995 GST No : 24AAECG8707D1ZU

22nd Annual Report 2020-21

Roads to the Future

GUJARAT STATE ROAD DEVELOPMENT CORPORATION LIMITED (GOVT. OF GUJARAT UNDERTAKING)

Registered Office

Ground Floor, Nirman Bhavan, Sector-10 A, Gandhinagar, Gujarat 382010

Phone: +91-79-23252912, 23252915 Fax: +91-79-23252090

E-mail: info@gsrdc.com Website: www.gsrdc.com

(CIN:U45200GJ1999SGC035995)

BOARD OF DIRECTORS

CHAIRMAN

Shri Purneshkumar I Modi
Hon'ble Minister Roads & Buildings Department, Transport, Aviation,
Tourism Department, GoG.

MANAGING DIRECTOR

Shri Ashok K Patel
Chief Engineer, Roads & Buildings Department, Government of Gujarat

DIRECTORS

Shri S. B. Vasava, Secretary, Roads & Buildings Dept., GOG.
Shri Dinesh Nimavat , FA, Roads & Buildings Dept., GOG.
Shri Prakash Makwana, Dy. Secretary, Revenue Dept.
Shri Suresh Patel, CEO, Surya Group.

AUDITORS

M/s Inani & Inani., Chartered Accountants, Ahmedabad

BANKERS

Union Bank

Regd. Office

Ground Floor, Nirman Bhavan, Sector-10 A, Gandhinagar, Gujarat 382010

GUJARAT STATE ROAD DEVELOPMENT CORPORATION LIMITED

(CIN:U45200GJ1999SGC035995)

Reg. Off. -Ground Floor, Nirman Bhavan, Sector-10 A, Gandhinagar, Gujarat 382010

Board's Report**To,
The Members,**

Your directors have pleasure in presenting the 22nd Annual Report on the business and operations of the Company and the audited financial accounts for the year ended 31st March, 2021.

1. Financial Summary or Highlights/Performance of the Company(Standalone):

The Company's financial performance, for the year ended March 31, 2021, is summarized below:

(Amount in Lacs)

Particulars	2020-21	2019-20
REVENUE		
Revenue from Operation	8087.77	7226.80
Other Income	426.29	589.42
Total Revenue	8514.06	7816.22
EXPENSES		
Other Operative and Administrative Expenses	6387.92	7246.95
Depreciation & Amortization Expenses	426.54	423.30
Total Expenses	6814.46	7670.25
Profit Before Prior Period Items & Tax	1699.59	145.97
Prior Period Adjustments		92.95
Profit Before Tax	1699.59	238.92
Tax Expenses		
(a) Current Tax	482.21	39.88
(a) Mat Credit Entitlement	(3.65)	(28.16)
(b) Deferred Tax Liability (Asset)	21.82	57.39
(c) Previous Year Taxes		(4.49)
Net Profit After Tax	1199.20	174.30
Earning/(Loss) per share	23.98	3.49

2. Brief description of the Company's working during the year:

Your Company was established as a wholly owned Company of Government of Gujarat with a prime objective of developing roads on PPP mode as well as the other feasible modes involving optimally least public fund. The Company undertakes all the activities related to such projects including pre-construction activities.

During the year 2020-2021 under the review; the Company has mainly carried out the following projects/activities:

- Total 7 projects – Himmatnagar Bypass, Bhuj Nakhatrana, Kim Mandvi and Deesa – Panthawad – Gundri & 3 VGF Road Projects under Operation and Maintenance were taken care of. Bhuj Bhachau Road is in partial commercial operation and been taken care of.
- The Concession Agreements for the project of Six laning of Bagodara Vasad Road was executed with Concessionaire on 13-02-2011 was terminated owing to non- achievement of required progress and abandoned. New tenders in two packages on Modified Annuity basis were approved and the construction work has commenced.
- The Concession Agreements for the Bhuj- Bhachau Road Project was signed on 12-07-2011. The work was under progress and it was monitored and issues related to the project were addressed so as to pave the way for their earliest completion.
- The Concession Agreement for Bhuj Nakhatrana road executed with the Concessionaire MSK Bhuj Nakhatrana Toll Road Pvt Ltd. (amalgamated with MSK Projects Ltd.) is terminated owing to non fulfilment of operation and maintenance obligations. The arbitration has been invoked by GSRDC on the Concessionaire.
- User fee collection on Bharuch- Dahej Road which is developed to six lane configuration by GSRDC is ongoing (in force from 16th February, 2017), resulting into an additional source of income to the Corporation. The maintenance is being taken care by GSRDC.
- The work of 4 laning of Surat Bardoli Road (Road Works of approx. 15 m length) was completed way back. The work of Four Lane ROB Approaches at Dastan Fatak – Surat Bardoli Road remained under progress.
- The consultant Highway Engineering has been appointed for preparation of DPR for Chikhli -Saputara Road. Consultant Geo designs & Research Pvt Ltd is appointed, for preparation of DPR for sachana ROB. Land acquisition is completed on dated 19-03-2021.

3. Dividend:

With a view to plough back the profits, your directors do not recommend any dividend for the year ended on 31st March, 2021.

4. Transfer to Reserves:

The Board of Director transfer net profit of the year of Rs. 1199.20 Lacs (Approx) to Reserve & Surplus accounts.

5. Material Changes and Commitment If Any Affecting The Financial Position of The Company occurred between the end of the financial year to which this financial statements relate and the date of the Report:

No material changes and commitments affecting the financial position of the Company occurred between the ends of the financial year to which this financial statement relate on the date of this report.

6. Share Capital:

Authorised Share Capital of the Company is Rs. 5,00,00,000/- (Rupees Five Crores) divided into 50,00,000 Equity Shares of Rs. 10/- each and Issued, Subscribed & Paid up Share Capital of the Company is Rs. 5,00,00,000/- (Rupees Five Crores) as on 31st March, 2021.

7. Directors and Key Managerial Personnel:

During the year under review, the following change of directors has been made. The Details of Board of Directors as on report date is:

Sr. No.	Name, Father Name, Address	DIN/PAN	Designation	Date of Appointment	Date of Cessation
1.	Shri Purneshkumar Ishwarlal Modi S/o Ishwarlal Modi Address: 4, Saidham Raw House, Near Adajan Fire Station, Adaan, Surat-395009	09424900	Director	23/09/2021	Continue
2	Shri Nitinkumar Ratilal Patel S/o Shri Ratilal Maganlal Patel Address: No 8- Manichandra Part-4, Nr. Surdhara Circle, Thaltej, Ahmedabad Gujarat-380059	06936838	Director	20/06/2014	23/09/2021
3.	Shri Ashokbhai K Patel Address: 201 E-1 Tower, Samarpan Flats Govt officers, Colony Opp IDBI Qtrs, Gulbai Tekra Ahmedabad	009403694	Managing Director	12/10/2021	Continue
4.	Shri Hareshkumar C. Modi S/o Shri Chandulal Modi Address: 31/b, Tulip Bungalows Part 2, Near Surdhara Circle, Thaltej, Ahmedabad Gujarat -380054	08626316	Managing Director	06/09/2019	12/10/2021

5.	Shri Ashwini Kumar Yadav S/o Shri Rajendra Prasad Yadav Address: Bungalow No. 215/A KH Type, Sector 19, Gandhinagar Gujarat- 382019	06581753	Nominee Director	21/10/2016	11/11/2021
6.	Shri Sandeep Bhanubhai Vasava S/o Shri Bhanubhai Vasava Address: KH-18, Sector -19, Gandhinagar Gujarat- 382019	02037918	Nominee Director	07/09/2016	Continue
7	Shri D.B.Nimavat S/o Shri Hematram Godia Address: "Spandan", Plot No. 116/1 Behind Enquiry Office, Sector 7/C, Gandhinagar Gujarat- 382019	08937010	Nominee Director	01/05/2021	Continue
8.	Shri Babuji Gulabji S/o Shri Gulabji Vaghela Address Plot No. 1228/2, Sector No. 4C, Gandhinagar	-	Nominee Director	07/09/2020	30/04/2021
9.	Shri Prakash Makwana S/o Shri Naranbhai Makwana Address: 2, Chandan SBI Staff Society, Near ST Workshop, Behrampura, Ahmedabad. Gujarat- 380021	08672682	Director	22/08/2019	Continue
10.	Shri Sureshbhai Dahyabhai Patel S/o Shri Dahyabhai Purushottamdas Patel Address: 25, Shalin Bungalows, Opp. Someshwara Park - III, Nr. Gulab Tower, Thaltej, Ahmedabad, Gujarat – 380054	01666959	Director	26/06/2014	Continue
11	Smt. Drishti Gaurav Vesasi D/o Shri Jitendra Pandya Address: 61, Dwarkesh Tower, Bodakdev, Ahmedabad Gujarat - 380054	BAYPP 7451H	Secretary	29/09/2016	14/06/2021
12.	Smt. Sheetal Amit Shah Address: Plot No12/1, Sector No 4A, Gandhinagar	EFWPS0198A	I/C Secretary	14/06/2021	Continue

8. Particulars of Employees:

As Gujarat State Road Development Corporation Limited is not a Listed Company therefore Section 197 (12) and Companies (Appointment and Remuneration of Managerial Personnel) Rules, 2014, statement of particulars of employees is not applicable to the Company.

9. Meetings:

During the year total Four Board Meetings were convened and held on 29/06/2020, 29/10/2020, 29/12/2020 & 29/03/2021 respectively. The intervening gap between the Meetings was within the period prescribed under the Companies Act, 2013.

10. Board Evaluation:

Pursuant to the provisions of the Companies Act, 2013, Gujarat State Road Development Corporation Limited is a State Government Company. Appointments of Board of Directors are made by the State Government. As per the Ministry notification dated 05.06.2015, Govt. Company are exempted from the provision (p) of section 134(3) of the Act.

11. Auditors:

The Auditors, M/S Inani & Inani., Chartered Accountant, Ahmedabad was appointed as Statutory Auditors of the Corporation for the year 2020-21 by the Comptroller and Auditor General of India, Letter No. CA.V/33-99/689 dated 16/10/2020 for the F.Y. 2020-21.

12. Auditors Report:

The Independent Auditors Report does not contain any qualification. Notes to Accounts and Auditors remarks in their report are self- explanatory and do not call for any further comments.

13. Internal Audit & Controls:

Internal Auditors, M/s J.S.Maheswari & Co., Chartered Accountants, Reports findings are discussed with the process owners and suitable corrective actions taken as per the directions on an ongoing basis to improve efficiency in operations.

14. Extract of Annual Return:

As required Pursuant to section 92(3) of the Companies Act, 2013 and rule 12(1) of the Companies (Management and Administration) Rules , 2014, an extract of annual return in MGT-9 as a part of this Annual Report as **ANNEXURE - I**.

15. Material changes and commitment if any affecting the financial position of the company occurred between the end of the financial year to which this financial statements relate and the date of the report:

No material changes and commitments affecting the financial position of the Company occurred during the financial year to which these financial statements relate on the date of this report.

16. During the year no significant and material orders passed by the regulators or courts or tribunals impacting the going concern status and Company's operations in future.

17. Particulars of loans, guarantees or investments under section 186:

Details of Loans: Rs. 604.12 Crore

Details of Investments:-NIL

Details of Guarantee / Security Provided: NIL

*The required details have been shown in the relevant part of the financial statements.

18. Particulars of Contracts or Arrangements with Related Parties:

The particulars of every contract or arrangements entered into by the Company with related parties referred to in sub-section (1) of section 188 of the Companies Act, 2013 during the F.Y. 2020-21 is NIL.

19. Obligation of company under the Sexual Harassment Of Women At Workplace (Prevention, Prohibition and Redressal) Act, 2013:

In order to prevent sexual harassment of women at work place a new act, The Sexual Harassment of Women at Workplace (Prevention, Prohibition and Redressal) Act, 2013 has been notified on 9th December, 2013. Under the said Act, every company is required to set up an Internal Complaints Committee to look into complaints relating to sexual harassment at work place of any women employee.

Your Company has adopted a policy for prevention of Sexual Harassment of Women at workplace and has set up Committee for implementation of said policy. During the year, the Company has not received any complaint of harassment.

20. Conservation of energy, technology absorption, foreign exchange earnings and outgo

The provisions of Section 134(m) of the Companies Act, 2013 do not apply to our Company. There was no foreign exchange inflow or Outflow during the year under review.

21. Corporate Social Responsibility (CSR)

The disclosures as per Rule 9 of Companies (Corporate Social Responsibility Policy) Rules, 2014 shall be applicable to Gujarat State Road Development Corporation Ltd. Your Company has not spent required amount under the CSR obligations within time limit. However, your Company has decided to spend the amount of CSR Obligation of the F.Y. 2020-21 in the Year 2021-22.

22. Directors' Responsibility Statement

The Directors' Responsibility Statement referred to in clause (c) of sub-section (3) of Section 134 of the Companies Act, 2013, shall state that—

- (a) In the preparation of the Annual Accounts, the applicable accounting standards had been followed along with proper explanation relating to material departures;
- (b) The directors had selected such accounting policies and applied them consistently and made judgments and estimates that are reasonable and prudent so as to give a true and fair view of the state of affairs of the company at the end of the financial year and of the profit and loss of the company for that period;

- (c) The directors had taken proper and sufficient care for the maintenance of adequate accounting records in accordance with the provisions of this Act for safeguarding the assets of the company and for preventing and detecting fraud and other irregularities;
- (d) The directors had prepared the annual accounts on a going concern basis; and
- (e) The directors had devised proper systems to ensure compliance with the provisions of all applicable laws and that such systems were adequate and operating effectively.

23. Audit Committee

The Composition of Audit Committees as on 31.03.2021 was as below:

Sr. No.	Name of the Directors	Designation
1	Shri B. G. Vaghela	Chairman
2	Shri Suresh Patel	Member

All the recommendation made by Audit Committee is accepted by the Board of GSRDC.

24. Nomination and Remunerations Committee

The Composition of Nomination and Remunerations Committees as on 31.03.2021 was as below:

Sr. No.	Name of the Directors	Designation
1	Shri Prakash Makwana	Chairman
2	Shri Suresh Patel	Member

25. Acknowledgement

Your Directors are pleased to place on record their appreciation for the continued patronage received from the Roads & Buildings Dept. Government of Gujarat, Gujarat Infrastructure Development Board, Bankers of the Company, Consultants and other associates for their continued support and their advice which have gone a long way in ensuring a creditable performance of your company.

Your Directors also wish to place on record their sincere appreciation of the excellent contribution made by the employees at all levels for the growth of your company.

**For and on behalf of the Board
Gujarat State Road Development Corporation Limited**

Date: 22/02/2022

Place: Gandhinagar

**Purneshkumar Modi
Chairman**

ANNEXURE INDEX

Annexure	Content
1.	Annual Return Extracts in MGT-9
2.	Auditors Report and Annual Accounts
3.	MGT-11 (Proxy)

Annexure

FORM NO. MGT 9

**EXTRACT OF ANNUAL
RETURN**

As on financial year ended on 31.03.2021

**Pursuant to Section 92 (3) of the Companies Act, 2013 and rule 12(1) of the Company
(Management & Administration) Rules, 2014**

I. REGISTRATION & OTHER DETAILS:

1.	CIN	U45200GJ1999SGC035995
2.	Registration Date	12/05/1999
3.	Name of the Company	GUJARAT STATE ROAD DEVELOPMENT CORPORATION LIMITED
4.	Category/Sub-category of the Company	Company limited by shares State Government Company
5.	Address of the Registered office & contact details	Ground Floor, Nirman Bhavan, Sector-10 A Gandhinagar, Gujarat - 382010. Phone: +91-79-23252912, 23252915 Fax: +91-79-23252090 E-mail: info@gsrdc.com Website: www.gsrdc.com
6.	Whether listed company	NO
7.	Name, Address & contact details of the Registrar & Transfer Agent, if any.	NA

II. PRINCIPAL BUSINESS ACTIVITIES OF THE COMPANY

(All the business activities contributing 10 % or more of the total turnover of the company shall be stated)

S. No.	Name and Description of main products / services	NIC Code of the Product/service	% to total turnover of the company
1	Construction (Road Development)	45	100%

III. SHARE HOLDING PATTERN (Equity Share Capital Breakup as percentage of Total Equity) Category-wise Share Holding:

Category of Shareholders	No. of Shares held at the beginning of the year[As on 31-March-2020]				No. of Shares held at the end of the year[As on 31-March-2021]				% Change during the year
	Demat	Physical	Total	% of Total Shares	Demat	Physical	Total	% of Total Shares	
A. Promoters									
(1) Indian									
a) Individual/ HUF	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil
b) Central Govt	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil
c) State Govt(s)	Nil	50,00,000	50,00,000	100	Nil	50,00,000	50,00,000	100	Nil
d) Bodies Corp.	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil
e) Banks / FI	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil
f) Any other	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil
Total shareholding of Promoter (A)	Nil	50,00,000	50,00,000	100	Nil	50,00,000	50,00,000	100	Nil
B. Public									
1. Institutions									
a) Mutual Funds	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil
b) Banks / FI	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil
c) Central Govt	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil
d) State Govt(s)	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil
e) Venture Capital Funds	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil
f) Insurance Companies	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil
g) FIs	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil
h) Foreign Venture Capital Funds	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil
i) Others (specify)	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil
Sub-total	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil
(B)(1):-									

2. Non-Institutions									
a) Bodies	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil
i) Indian	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil
ii) Overseas	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil
b) Individuals	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil
i) Individual shareholders holding nominal share capital	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil
ii) Individual shareholders holding nominal share capital	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil
c) Others (specify)	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil
Non Resident Indians	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil
Overseas Corporate	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil
Foreign Nationals	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil
Clearing Members	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil
Trusts	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil
Foreign Bodies - DR	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil
Sub-total (B)(2):-	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil
Total Public Shareholding (B)=(B)(1)+ (B)(2)	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil
C. Shares held by Custodian for GDRs & ADRs	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil
Grand Total (A+B+C)	Nil	50,00,000	50,00,000	100	Nil	50,00,000	50,00,000	100	Nil

B) SHAREHOLDING OF PROMOTER

Sr. No.	Particulars	Shareholding at the beginning of the year (As on 01.04.2020)			Shareholding at the end of the year (As on 31.03.2021)			% change in shareholding during the year
		No. of Shares	% of total Shares of the company	% of Shares Pledged / encumbered to total shares	No. of Shares	% of total Shares of the company	% of Shares Pledged / encumbered to total shares	
1.	Honorable Governor of Gujarat	49,99,993	100	NIL	49,99,993	100	NIL	NIL
2.	Shri Ashwani Kumar jointly with Honorable Governor of Gujarat	1	NIL	NIL	1	NIL	NIL	NIL
3.	Shri S. B. Vasava jointly with Honorable Governor of Gujarat	1	NIL	NIL	1	NIL	NIL	NIL
4.	Shri P. R. Pateliya jointly with Honorable Governor of Gujarat	1	NIL	NIL	1	NIL	NIL	NIL
5.	Smt. N. K. Patel jointly with Honorable Governor of Gujarat	1	NIL	NIL	1	NIL	NIL	NIL
6.	Shri A. N. Mistry jointly with Honorable Governor of Gujarat	1	NIL	NIL	1	NIL	NIL	NIL
7.	Shri A. N. Mistry jointly with Honorable Governor of Gujarat	1	NIL	NIL	1	NIL	NIL	NIL
8.	Shri K.M. Patel jointly with Honorable Governor of Gujarat	1	NIL	NIL	1	NIL	NIL	NIL
9	TOTAL	50,00,000	100	NIL	50,00,000	100	NIL	NIL

C) CHANGE IN PROMOTERS' SHAREHOLDING (PLEASE SPECIFY, IF THERE IS NO CHANGE)

Sr. No.	Particulars	Shareholding at the beginning of the year		Cumulative Shareholding during the year	
		No. of shares	% of total shares of the company	No. of shares	% of total shares of the company
	At the beginning of the year	50,00,000	100	50,00,000	100
	Date wise Increase / Decrease in Promoters Shareholding during the year specifying the reasons for increase / decrease (e.g. allotment /transfer / bonus/ sweat equity etc.):	NIL	NIL	NIL	NIL
	At the end of the year	50,00,000	100	50,00,000	100

D) SHAREHOLDING PATTERN OF TOP TEN SHAREHOLDERS:

(Other than Directors, Promoters and Holders of GDRs and ADRs):

Sr. No.	For Each of the Top 10 Shareholders	Shareholding at the beginning of the year		Cumulative Shareholding during the year	
		No. of shares	% of total shares of the company	No. of shares	% of total shares of the company
	At the beginning of the year	NIL	NIL	NIL	NIL
	Date wise Increase / Decrease in Promoters Shareholding during the year specifying the reasons for increase /decrease (e.g. allotment / transfer / bonus/ sweat equity etc.):	NIL	NIL	NIL	NIL
	At the end of the year	NIL	NIL	NIL	NIL

E) SHAREHOLDING OF DIRECTORS AND KEY MANAGERIAL PERSONNEL:

Sr. No.	Shareholding of each Directors and each Key Managerial Personnel	Shareholding at the beginning of the year		Cumulative Shareholding during the year	
		No. of shares	% of total shares of the company	No. of shares	% of total shares of the company
	At the beginning of the year	NIL	NIL	NIL	NIL
	Date wise Increase / Decrease in Promoters Shareholding during the year specifying the reasons for increase /decrease (e.g. allotment / transfer / bonus/ sweat equity etc.):	NIL	NIL	NIL	NIL
	At the end of the year	NIL	NIL	NIL	NIL

F) **INDEBTEDNESS**-Indebtedness of the Company including interest outstanding/accrued but not due for payment:

(Rupees in Lacs)

Particulars	Secured Loans excluding deposits	Unsecured Loans	Deposits	Total Indebtedness
Indebtedness at the beginning of the financial year				
i) Principal Amount	NIL	38830.75	NIL	38830.75
ii) Interest due but not paid	NIL	NIL	NIL	NIL
iii) Interest accrued but not due	NIL	1313.70	NIL	1313.70
Total (i +ii +iii)	NIL	40144.45	NIL	40144.45
Change in Indebtedness during the financial year				
* Addition	NIL	21311.47	NIL	21311.47
* Reduction	NIL	NIL	NIL	NIL

Net Change	NIL	21311.47	NIL	21311.47
Indebtedness at the end of the financial year				
i) Principal Amount	NIL	60142.22	NIL	60142.22
ii) Interest due but not paid	NIL	NIL	NIL	NIL
iii) Interest accrued but not due	NIL	197.81	NIL	197.81
Total (i +ii +iii)	NIL	60340.03	NIL	60340.03

XI. REMUNERATION OF DIRECTORS AND KEY MANAGERIAL PERSONNEL- A.

Remuneration to Managing Director, Whole-time Directors and/or Manager:

Sr. No.	Particulars of Remuneration	Name of MD
		(Hareshkumar C. Modi) (From 01.04.2020 to 31.03.2021)
1	Gross salary	19.99 Lacs
	(a) Salary as per provisions contained in section 17(1) of the Income-tax Act, 1961	NIL
	(b) Value of perquisites u/s 17(2) Income-tax Act, 1961 (Medical Reimbursement)	NIL
	(c) Profits in lieu of salary under section 17(3) Income- tax Act, 1961	NIL
2	Stock Option	NIL
3	Sweat Equity	NIL
4	Commission- as % of profit - others, specify...	NIL
5	Others, please specify	NIL
	Total (A)	19.99 Lacs
	Ceiling as per the Act	NIL

B. REMUNERATION TO OTHER DIRECTORS

Sr. No.	Particulars of Remuneration	Name of Directors				Total Amount
		----	----	----	---	
1.	Independent Directors	NA	NA	NA	NA	NA
	Fee for attending board committee meetings	NA	NA	NA	NA	NA
	Commission	NA	NA	NA	NA	NA
	Others, please specify	NA	NA	NA	NA	NA
	Total (1)	NA	NA	NA	NA	NA
2.	Other Non-Executive Directors	NA	NA	NA	NA	NA
	Fee for attending board committee meetings	NA	NA	NA	NA	NA
	Commission	NA	NA	NA	NA	NA
	Others, please specify	NA	NA	NA	NA	NA
	Total (2)	NA	NA	NA	NA	NA
	Total (B)=(1+2)	NA	NA	NA	NA	NA
	Total Managerial Remuneration	NA	NA	NA	NA	NA
	Overall Ceiling as per the Act	NA	NA	NA	NA	NA

C. REMUNERATION TO KEY MANAGERIAL PERSONNEL OTHER THAN MD/MANAGER/WTD

Sr. No.	Particulars of Remuneration	Key Managerial Personnel			
		CEO	CFO	CS	Total
1.	Gross salary	NIL	NIL	6.68 Lacs	6.68 Lacs
	(a) Salary as per provisions contained in section 17(1) of the Income-tax Act, 1961	NIL	NIL	NIL	NIL
	(b) Value of perquisites u/s 17(2) Income-tax Act, 1961 (Medical Reimbursement)	NIL	NIL	NIL	NIL
	(c) Profits in lieu of salary under section 17(3) Income-tax Act, 1961	NIL	NIL	NIL	NIL
2.	Stock Option	NIL	NIL	NIL	NIL
3.	Sweat Equity	NIL	NIL	NIL	NIL
4.	Commission	NIL	NIL	NIL	NIL
	- as % of profit	NIL	NIL	NIL	NIL
	others, specify...	NIL	NIL	NIL	NIL
5.	Others, please specify	NIL	NIL	NIL	NIL
	Total	NIL	NIL	6.68	6.68

XII. PENALTIES / PUNISHMENT

Type	Section of the Companies Act	Brief Description	Details of Penalty/ Punishment/ Compounding Fees imposed	Authority [RD/ NCLT/ COURT]	Appeal made, if any (give Details)
A. COMPANY					
Penalty	NIL				
Punishment					
Compounding					
B. DIRECTORS					
Penalty	NIL				
Punishment					
Compounding					
C. OTHER OFFICERS IN DEF					
Penalty	NIL				
Punishment					
Compounding					

**Form No.
MGT-11
Proxy form**

**[Pursuant to section 105(6) of the Companies Act, 2013 and rule 19(3) of the Companies
(Management and Administration) Rules, 2014]**

Name of the Member(s)		
Registered Address		
E-mail Id	Folio No /Client ID	DP ID

I/We, being the member(s) of _____ shares of the above named company hereby appoint

Name :	E-mail Id:
Address:	
Signature , or failing him	

Name :	E-mail Id:
Address:	
Signature , or failing him	

Name :	E-mail Id:
Address:	
Signature , or failing him	

as my/ our proxy to attend and vote(on a poll) for me/us and on my/our behalf at the 22nd Adjournd Annual General Meeting / ~~Extra Ordinary General Meeting~~ of the company, to be held on 22nd February, 2022 at 3.00 p.m. at Ground Floor, Nirman Bhavan, Sector-10 A, Gandhinagar, Gujarat 382010 and at any adjournment thereof in respect of such resolutions as are indicated below:

Resolution No.

Sl. No.	Resolution(S)	Vote	
		For	Against
1.	Adoption of statement of Profit & Loss, Balance Sheet, report of Director's and Auditor's for the financial year 31 st March, 2021.		

* Applicable for investors holding shares in Electronic form.

Affix Revenue Stamps

Signed this ____ day of ____ 20__

Signature of Shareholder
Shareholder
Revenue stamp

Signature of Proxy holder

Signature of the
of the across

Note:

- 1) This form of proxy in order to be effective should be duly completed and deposited at the Registered Office of the Company not less than 48 hours before the commencement of the Meeting.
- 2) The proxy need not be a member of the company

LETTER HEAD

ATTENDANCE SLIP

(To be handed over at the entrance of the meeting hall)

Annual General Meeting on 22nd February, 2022.

Full name of the members attending _____ (In block capitals)

Ledger Folio No./Client ID No. _____ No. of shares held: _____

Name of Proxy _____

(To be filled in, if the proxy attends instead of the member)

I hereby record my presence at the ____ Annual General Meeting of the
. , Address, on _____

(Member's /Proxy's Signature)

Note

- 1) Members are requested to bring their copies of the Annual Report to the meeting, since further copies will not be available.
- 2) The Proxy, to be effective should be deposited at the Registered Office of the Company not less than FORTY EIGHTHOURS before the commencement of the meeting.
- 3) A Proxy need not be a member of the Company.
- 4) In the case of joint holders, the vote of the senior who tenders a vote, whether in person or by Proxy, shall be accepted to the exclusion of the vote of the other joint holders. Seniority shall be determined by the order in which the names stand in the Register of Members.
- 5) The submission by a member of this form of proxy will not preclude such member from attending in person and voting at the meeting.

सापनाय / पजाकृत डाक

भारतीय लेखापरीक्षा एवं लेखा विभाग
कार्यालय प्रधान महालेखाकार (लेखापरीक्षा-II) गुजरात
"लेखापरीक्षा भवन", नवरंगपुरा, अहमदाबाद - 380 009.



INDIAN AUDIT & ACCOUNTS DEPARTMENT
Office of the Principal Accountant General (Audit-II), Gujarat
Audit Bhavan, Navrangpura, Ahmedabad - 380 009.

क्रमांक. ए.एम.जी -I/लेखे/GSRDCL/2020-21/04-144

दिनांक: 11/02/2022

सेवा में,
प्रबंध निदेशक,
Gujarat State Road Development Corporation Limited
Nirman Bhavan, Ground Floor,
Sector-10/A, Gandhinagar-382010.

विषय:- कंपनी अधिनियम 2013 की धारा 143 (6)(b) के अंतर्गत 31 मार्च 2021 को समाप्त वर्ष के लिए Gujarat State Road Development Corporation Limited के वित्तीय विवरणों पर भारत के नियंत्रक एवं महालेखापरीक्षक की टिप्पणी।

महोदय,

31 मार्च 2021 को समाप्त वर्ष के लिए Gujarat State Road Development Corporation Limited के वित्तीय विवरणों पर कंपनी अधिनियम, 2013 की धारा 143 (6) (बी) के अनुसार भारत के नियंत्रक-महालेखापरीक्षक की 'शून्य टिप्पणी का प्रमाणपत्र' कंपनी की वार्षिक साधारण बैठक में रखने के लिए संलग्न पाएं।

कंपनी अधिनियम, 2013 की धारा 143 (6) (बी) के अनुसार भारत के नियंत्रक-महालेखापरीक्षक की टिप्पणियों को कंपनी की 'सांविधिक लेखापरीक्षक' की रिपोर्ट के साथ उसी तारीख और उसी समय वार्षिक साधारण बैठक में रखना अनिवार्य है। भारत के नियंत्रक-महालेखापरीक्षक की टिप्पणियों को वार्षिक साधारण बैठक में रखने की तिथि इस कार्यालय को सूचित करें।

कृपया मुद्रित लेखों की छः प्रतियाँ इस कार्यालय के प्रयोग और अभिलेख के लिए भिजवाएं।
अनुलग्नक सहित इस पत्र की प्राप्ति की सूचना दें।

भवदीय

20/11/2022

उप महालेखाकार (ए.एम.जी-I)

अनुलग्नक: यथोपरि

फोन / Phone : 079-26403713, 26561327, 26405874, 26561282, 26560892, 26473888

फैक्स / Fax : 079-26561853 E-mail : pagau2gujarat@cag.gov.in

**COMMENTS OF THE COMPTROLLER AND AUDITOR GENERAL OF INDIA
UNDER SECTION 143(6)(b) OF THE COMPANIES ACT, 2013 ON THE
FINANCIAL STATEMENTS OF GUJARAT STATE ROAD DEVELOPMENT
CORPORATION LIMITED FOR THE YEAR ENDED 31 MARCH 2021**

The preparation of financial statements of Gujarat State Road Development Corporation Limited, Gandhinagar for the year ended 31 March 2021 in accordance with the financial reporting framework prescribed under the Companies Act, 2013(Act) is the responsibility of the management of the company. The statutory auditors appointed by the Comptroller and Auditor General of India under section 139(5) of the Act are responsible for expressing opinion on the financial statements under section 143 of the Act based on independent audit in accordance with the standards on auditing prescribed under section 143(10) of the Act. This is stated to have been done by them vide their Audit Report dated 30 November 2021.

I, on behalf of the Comptroller and Auditor General of India, have conducted a supplementary audit of the financial statements of Gujarat State Road Development Corporation Limited for the year ended 31 March 2021 under section 143(6)(a) of the Act. This supplementary audit has been carried out independently without access to the working papers of the statutory auditors and is limited primarily to inquiries of the statutory auditors and company personnel and a selective examination of some of the accounting records.

On the basis of my supplementary audit nothing significant has come to my knowledge which would give rise to any comment upon or supplement to Statutory Auditors' Report under section 143(6)(b) of the Act.

For and on behalf of the
Comptroller and Auditor General of India


11/2/22
(H. K. Dharmadarshi)

Pr. Accountant General (Audit-II), Gujarat

Place: Ahmedabad

Date:

INDEPENDENT AUDITOR'S REPORT

To

THE MEMBERS,

GUJARAT STATE ROAD DEVELOPMENT CORPORATION LIMITED

GANDHINAGAR (GUJARAT)

Report on the Audit of the Standalone Financial Statements

Opinion

We have audited the financial statements of **GUJARAT STATE ROAD DEVELOPMENT CORPORATION LIMITED** ("the Company"), which comprise the Balance Sheet as at 31st March 2021, and the Statement of Profit and Loss, Statement of the Cash Flows for the year then ended, and Notes to the Financial Statements, including a summary of Significant Accounting Policies and Other Explanatory Information (here in after referred to as "Standalone Financial Statement").

In our opinion and to the best of our information and according to the explanations given to us, the aforesaid Standalone Financial Statement, give the information required by the Companies Act, 2013 ("Act") in the manner so required and give a true and fair view in conformity with the Accounting Standards prescribed under section 133 of the Act and other accounting principles generally accepted in India, of the State of Affairs of the Company as at 31st March,2021 and its Profit and it's Cash Flow for the year ended on that date.

Basis for Opinion

We conducted our audit in accordance with the Standards on Auditing (SAs) specified under section 143(10) of the Companies Act, 2013. Our responsibilities under those Standards are further described in the Auditor's Responsibilities for the Audit of the Financial Statements section of our report. We are independent of the Company in accordance with the Code of Ethics issued by the Institute of Chartered Accountants of India together with the ethical requirements that are relevant to our audit of the financial statements under the provisions of the Companies Act, 2013 and the Rules thereunder, and we have fulfilled our other ethical responsibilities in accordance with these requirements and the Code of Ethics. We believe that the audit evidence we have obtained is sufficient and appropriate to provide a basis for our opinion.

Information other than the financial statements and auditors' report thereon

The Company's board of directors is responsible for the preparation of the other information. The other information comprises the information included in the Board's Report including Annexures to Board's Report but does not include the financial statements and our auditor's report thereon.

Our opinion on the financial statements does not cover the other information and we do not express any form of assurance conclusion thereon.

In connection with our audit of the financial statements, our responsibility is to read the other information and, in doing so, consider whether the other information is materially inconsistent with the financial statements or our knowledge obtained during the course of our audit or otherwise appears to be materially misstated.

If, based on the work we have performed, we conclude that there is a material misstatement of this other information, we are required to report that fact. We have nothing to report in this regard.

Emphasis of Matter

- (1) We draw attention to the Note No. 32, 32.1, 32.2 and 32.3 to the standalone financial statements which describes the uncertainty related to the outcome of litigation against the company.
- (2) We draw attention to Note No. 35 to the standalone financial statements in which outstanding balances of grants, Loans & Advances and other balances have been shown are subject to reconciliation and consequential adjustments, if any.
- (3) We draw attention to Note no. 36 to the standalone financial statement regarding non-disclosure of dues to Micro, Small & Medium Enterprises as required by Micro Small & Medium Enterprise Development Act 2006.
- (4) We draw attention to Note No. 1(I) "Revenue Recognition" and Note No. 38 to standalone financial statement which describes that certain income will recognized on actual receipt or realization basis because reasonable certainty is lacking.
- (5) We draw attention to Note 40 of the standalone financial statements, as regards the management's evaluation of COVID-19 impact on the future performance of the Company.

Our opinion is not modified in respect of above matters.

Other Matter

We have placed reliance on technical/ commercial evaluation by the management in respect of categorization of various projects, their development, allocation of costs incurred on them, treatment of capitalization etc.

Responsibilities of Management and Those Charged with Governance for the Standalone Financial Statements

The Company's Board of Directors is responsible for the matters stated in section 134(5) of the Companies Act, 2013 ("the Act") with respect to the preparation of these financial statements that give a true and fair view of the financial position and financial performance of the Company in accordance with the accounting principles generally accepted in India, including the Accounting Standards specified under section 133 of the Act. This responsibility also includes maintenance of adequate accounting records in accordance with the provisions of the Act for safeguarding of the assets of the Company and for preventing and detecting frauds and other irregularities; selection and application of appropriate accounting policies; making judgments and estimates that are reasonable and prudent; and design, implementation and maintenance of adequate

internal financial controls, that were operating effectively for ensuring the accuracy and completeness of the accounting records, relevant to the preparation and presentation of the financial statements that give a true and fair view and are free from material misstatement, whether due to fraud or error.

In preparing the financial statements, management is responsible for assessing the Company's ability to continue as a going concern, disclosing, as applicable, matters related to going concern and using the going concern basis of accounting unless management either intends to liquidate the Company or to cease operations, or has no realistic alternative but to do so.

Those Board of Directors are also responsible for overseeing the Company's financial reporting process.

Auditor's Responsibilities for the Audit of the Financial Statements

Our objectives are to obtain reasonable assurance about whether the financial statements as a whole are free from material misstatement, whether due to fraud or error, and to issue an Auditor's Report that includes our opinion. Reasonable assurance is a high level of assurance, but is not a guarantee that an audit conducted in accordance with SAs will always detect a material misstatement when it exists. Misstatements can arise from fraud or error and are considered material if, individually or in the aggregate, they could reasonably be expected to influence the economic decisions of users taken on the basis of these financial statements.

As part of an audit in accordance with SAs, we exercise professional judgment and maintain professional skepticism throughout the audit. We also:

- Identify and assess the risks of material misstatement of the financial statements, whether due to fraud or error, design and perform audit procedures responsive to those risks, and obtain audit evidence that is sufficient and appropriate to provide a basis for our opinion. The risk of not detecting a material misstatement resulting from fraud is higher than for one resulting from error, as fraud may involve collusion, forgery, intentional omissions, misrepresentations, or the override of internal control.
- Obtain an understanding of internal control relevant to the audit in order to design audit procedures that are appropriate in the circumstances.
- Evaluate the appropriateness of accounting policies used and the reasonableness of accounting estimates and related disclosures made by management.
- Conclude on the appropriateness of management's use of the going concern basis of accounting and, based on the audit evidence obtained, whether a material uncertainty exists related to events or conditions that may cast significant doubt on the Company's ability to continue as a going concern. If we conclude that a material uncertainty exists, we are required to draw attention in our auditor's report to the related disclosures in the financial statements or, if such disclosures are inadequate, to modify our opinion. Our conclusions are based on

the audit evidence obtained up to the date of our auditor's report. However, future events or conditions may cause the Company to cease to continue as a going concern.

- Evaluate the overall presentation, structure and content of the financial statements, including the disclosures, and whether the financial statements represent the underlying transactions and events in a manner that achieves fair presentation.

We communicate with those charged with governance regarding, among other matters, the planned scope and timing of the audit and significant audit findings, including any significant deficiencies in internal control that we identify during our audit.

We also provide those charged with governance with a statement that we have complied with relevant ethical requirements regarding independence, and to communicate with them all relationships and other matters that may reasonably be thought to bear on our independence, and where applicable, related safeguards.

Report on Other Legal and Regulatory Requirements

1. As required by the Companies (Auditor's Report) Order, 2016 ("the Order"), issued by the Central Government of India in terms of sub-section (11) of section 143 of the Companies Act, 2013, we give in the "Annexure A" statement on the matters specified in paragraphs 3 and 4 of the Order, to the extent applicable.
2. In terms of Section 143(5) of the Companies Act, 2013, we give in Annexure '2(i) & 2(ii)' a statement on the directions issued under the aforesaid section by the Comptroller and Auditor General of India.
3. As required by Section 143 (3) of the Act, we report that:
 - a) We have sought and obtained all the information and explanations which to the best of our knowledge and belief were necessary for the purposes of our audit.
 - b) In our opinion, proper books of account as required by law have been kept by the Company so far as it appears from our examination of those books.
 - c) The Balance Sheet and the Statement of Profit and Loss dealt with by this Report are in agreement with the books of account.
 - d) In our opinion, the aforesaid financial statements comply with the Accounting Standards specified under Section 133 of the Act, read with Rule 7 of the Companies (Accounts) Rules, 2014.
 - e) Being a Government Company, Section 164(2) of Companies Act, 2013 regarding disqualification of Director is not applicable to the Company in view of MCA notification G.S.R. 463 (E) dated 05th June, 2015.
 - f) With respect to the adequacy of the internal financial controls with reference to financial statements of the Company and the operating effectiveness of such controls, refer to our separate Report in "Annexure B".

- g) With respect to the other matters to be included in the Auditor's Report in accordance with Rule 11 of the Companies (Audit and Auditors) Rules, 2014, in our opinion and to the best of our information and according to the explanations given to us:
- i. The Company has disclosed the impact of pending litigations on its financial position in its Standalone Financial Statement – Refer to Note 32, 32.1, 32.2 & 32.3 to the Standalone Financial Statement;
 - ii. The Company did not have any long-term contracts including derivative contracts for which there were any material foreseeable losses.
 - iii. There were no amounts which were required to be transferred to the Investor Education and Protection Fund by the Company.

For Inani & Inani
Chartered Accountants
(FRN: 120507W)

PLACE : Gandhinagar
DATE : 30th November, 2021
UDIN : 21145569AAAACD5500

(CA Ankit Shah)
PARTNER
M.No. 145569

Annexure 'A'

The Annexure referred to in paragraph 1 of Our Report on "Other Legal and Regulatory Requirements".

We report that:

1. PROPERTY PLANT AND EQUIPMENT

- a. The company has maintained proper records showing full particulars, including quantitative details and situation of its fixed assets.
- b. According to information provided by the management, fixed assets have been physically verified by the management at reasonable intervals and no material discrepancies were noticed.
- c. The Company does not have any freehold Property and Leasehold Property in its Fixed Assets.

2. INVENTORIES

Since the company is not holding any Inventories therefore clause (ii) of paragraph 3 of "the Order" is not applicable to the Company.

3. LOANS & ADVANCES

The Company has not granted any loans, secured or unsecured to companies, firms, limited liability partnerships or other parties covered in the register maintained under Section 189 of the Companies Act, 2013. Accordingly, clause (iii)(a), (iii)(b) & (iii)(c) of paragraph 3 of "the Order" is not applicable to the Company.

4. LOANS, INVESTMENT & GUARANTEES

According to information & explanation given to us, company has not given any loan or provided any guarantee to any person specified under section 185 of Companies Act 2013.

Further, the company has deposited excess funds available out of grant with GSFS as per Government of Gujarat GR No. JNV-10-2011-182910-A dated 29.10.2016 for which the company has complied with the provisions of section 186 of Companies Act, 2013. Total deposits with GSFS as on 31" March, 2021 is Rs. 278,43,17,857. The company has not made any investment other than GSFS nor provided any guarantee to any body corporate as specified under section 186 of Companies Act 2013. The Company has taken Financial Assistance of Rs 1847 Crore from GSFS on direction of R&B department, Govt. of Gujarat

for project of six lanning Ahmedabad-Rajkot Highway of National Highway. Disbursement of Rs. 172,42,97,556 is made during FY 2020-2021. The company has advanced Rs. 88,07,37,900 to Executive Engineer, National Highway Ahmedabad Division and Rs. 84,35,59,656 to Executive Engineer, National Highway Rajkot Division. Further, the company has also advanced Rs. 48,77,80,557 to M/s Valecha Kutchh Toll Road Pvt. Ltd. till 31st March, 2021.

5. FIXED DEPOSITS

According to the information and explanations given to us, the Company has not accepted any deposits, therefore, directive issued by the Reserve Bank of India and the provisions of Section 73 to 76 or any other relevant provisions of the Companies Act, 2013 and the rules framed there under, clause (v) of paragraph 3 of “the Order” is not applicable to the Company.

6. COST AUDIT RECORDS

The Central Government has not prescribed maintenance of cost records under section 148(1) of the Companies Act, 2013 therefore clause (v) of paragraph 3 of “the Order” is not applicable to the Company.

7. STATUTORY DUES

- a. According to the information and explanations given to us, and on the basis of our examination, the company is generally regular in depositing undisputed statutory dues including provident fund, Investor Education and Protection Fund, Employee’s State Insurance, Income Tax, Goods and Service Tax, Sales Tax, Wealth Tax, Service Tax, Duty of Excise, Value Added Tax and Cess and any other statutory dues with appropriate authorities. However there is no arrears of outstanding dues as on 31st March, 2021 for a period of more than 6 months from the date they became payable.
- b. According to the information and explanation given to us there are no disputed amounts payable in respect of Income Tax, Goods and Service Tax, Sales Tax, Wealth Tax, Service Tax, Duty of Excise, Value Added Tax and Cess **except as stated below:-**

Name of the status	Nature of dues	Amount under dispute not yet deposited(Rs)	Period to which the amount relates AY	Forum where the dispute is pending
Income Tax Act, 1961	Income tax including interest and penalty as applicable	37,97,07,650	2010-11	ITAT
Income Tax Act, 1961	Income tax including interest and penalty as applicable	33,97,85,280	2011-12	ITAT
Income Tax Act, 1961	Income tax including interest and penalty as applicable	4,97,96,250	2011-12	ITAT
Income Tax Act, 1961	Income tax including interest and penalty as applicable	2,07,24,010	2012-13	ITAT

8. DEFAULT IN PAYMENT OF DUES

According to the records of the Company examined by us and the information and explanations given to us, the Company does not have dues to bank or debenture holders as at the balance sheet date.

However, there is no direction with respect to repayment of Loan and interest thereon on Loan from R&B Department, Government of Gujarat, of Rs. 100,00,000. Therefore, we are not in a position to comment upon default in repayment of the same.

9. FUND RAISED BY PUBLIC ISSUE/ FOLLOW ON OFFER/ TERM LOAN

In our opinion and according to the information and explanations given to us, term loans were applied for the purpose for which the loans were obtained. The company did not raise any money by way of initial public offer or further public offer (including debt instruments).

10. FRAUD

During the course of our examination of the books and records of the Company, carried out in accordance with the generally accepted auditing practices in India, and according

to the information and explanations given to us, no fraud by the Company or any fraud on the company by its officers/ employees has been noticed or reported during the year.

11. MANAGERIAL REMUNERATION

The limits prescribed under section 197 of the Companies Act, 2013 for managerial remuneration have been adhered to during the year 2020-21.

12. NIDHI COMPANY

The company is not a Nidhi Company as defined under section 406 of Companies Act 2013. Therefore, clause (xii) of paragraph 3 of the order is not applicable to the company.

13. TRANSACTIONS WITH RELATED PARTY

As per the information and explanations given to us, all transactions with the related parties are in compliance with sections 177 and section 188 of Companies Act, 2013. The relevant disclosure as required by AS 18 "Related Parties" has been made as per Note No. 28 in the Financial Statements.

14. PREFERENTIAL ALLOTMENT/ PRIVATE PLACEMENT OF SHARE/ISSUE OF DEBENTURE

During the year company has not made any Preferential Allotment or private placement of shares/ Issue of Debentures therefore clause (xiv) of paragraph 3 of the order is not applicable to the company.

15. NON CASH TRANSACTIONS WITH DIRECTORS

As per the information and explanation given to us, company has not entered into non-cash transactions with directors or persons connected with him.

16. NBFC REGISTRATION

The company is not required to be registered under section 45-IA of the Reserve Bank of India Act, 1934 as NBFC. Therefore, clause (xvi) of paragraph 3 of "the order" is not applicable to the Company.

**For Inani & Inani.
Chartered Accountants
(FRN: 120507W)**

**PLACE: Gandhinagar
DATE : 30th November, 2021
UDIN : 21145569AAAACD5500**

**(CA Ankit Shah)
PARTNER
M.No. 145569**

Annexure 'B'

Report on Internal Financial Controls over Financial Reporting

Report on the Internal Financial Controls under Clause (i) of Sub-section 3 of Section 143 of the Companies Act, 2013 ("the Act")

We have audited the internal financial controls with reference to financial statements of **GUJARAT STATE ROAD DEVELOPMENT CORPORATION LIMITED** ("the Company") as of March 31, 2021 in conjunction with our audit of the standalone financial statements of the Company for the year ended on that date.

Management's Responsibility for Internal Financial Controls

The Company's management is responsible for establishing and maintaining internal financial controls based on the internal control over financial reporting criteria established by the Company considering the essential components of internal control stated in the Guidance Note on Audit of Internal Financial Controls Over Financial Reporting issued by the Institute of Chartered Accountants of India. These responsibilities include the design, implementation and maintenance of adequate internal financial controls that were operating effectively for ensuring the orderly and efficient conduct of its business, including adherence to company's policies, the safeguarding of its assets, the prevention and detection of frauds and errors, the accuracy and completeness of the accounting records, and the timely preparation of reliable financial information, as required under the Companies Act, 2013.

Auditors' Responsibility

Our responsibility is to express an opinion on the Company's internal financial controls over financial reporting based on our audit. We conducted our audit in accordance with the Guidance Note on Audit of Internal Financial Controls Over Financial Reporting (the "Guidance Note") and the Standards on Auditing, issued by ICAI and deemed to be prescribed under section 143(10) of the Companies Act, 2013, to the extent applicable to an audit of internal financial controls, both applicable to an audit of Internal Financial Controls and, both issued by the Institute of Chartered Accountants of India. Those Standards and the Guidance Note require that we comply with ethical requirements and plan and perform the audit to obtain reasonable assurance about whether adequate internal financial controls over financial reporting was established and maintained and if such controls operated effectively in all material respects.

Our audit involves performing procedures to obtain audit evidence about the adequacy of the internal financial controls system over financial reporting and their operating effectiveness. Our audit of internal financial controls over financial reporting included obtaining an understanding of internal financial controls over financial reporting, assessing the risk that a material weakness exists, and testing and evaluating the design and operating effectiveness of internal control based on the assessed risk. The procedures selected depend on the auditor's judgement, including the assessment of the risks of material misstatement of the financial statements, whether due to fraud or error.

We believe that the audit evidence we have obtained is sufficient and appropriate to provide a basis for our audit opinion on the Company's internal financial controls system with reference to financial statements.

Meaning of Internal Financial Controls Over Financial Reporting

A company's internal financial control over financial reporting is a process designed to provide reasonable assurance regarding the reliability of financial reporting and the preparation of financial statements for external purposes in accordance with generally accepted accounting principles. A company's internal financial control over financial reporting includes those policies and procedures that

1. pertain to the maintenance of records that, in reasonable detail, accurately and fairly reflect the transactions and dispositions of the assets of the company;
2. provide reasonable assurance that transactions are recorded as necessary to permit preparation of financial statements in accordance with generally accepted accounting principles, and that receipts and expenditures of the company are being made only in accordance with authorizations of management and directors of the company; and
3. provide reasonable assurance regarding prevention or timely detection of unauthorized acquisition, use, or disposition of the company's assets that could have a material effect on the financial statements.

Inherent Limitations of Internal Financial Controls Over Financial Reporting

Because of the inherent limitations of internal financial controls over financial reporting, including the possibility of collusion or improper management override of controls, material misstatements due to error or fraud may occur and not be detected. Also, projections of any evaluation of the internal financial controls over financial reporting to future periods are subject to the risk that the internal financial control over financial reporting may become inadequate because of changes in conditions, or that the degree of compliance with the policies or procedures may deteriorate.

Opinion

In our opinion, the Company has, in all material respects, an adequate internal financial controls system over financial reporting and such internal financial controls over financial reporting were operating effectively as at March 31, 2021, based on the internal control over financial reporting criteria established by the Company considering the essential components of internal control stated in the Guidance Note on Audit of Internal Financial Controls Over Financial Reporting issued by the Institute of Chartered Accountants of India.

**For Inani & Inani.
Chartered Accountants
(FRN: 120507W)**

**PLACE : Gandhinagar
DATE : 30th November, 2021
UDIN : 21145569AAAACD5500**

**(CA Ankit Shah)
PARTNER
M.No. 145569**

Annexure to the Independent Auditors' Report of Gujarat State Road Development Corp. Ltd

To
The Members
Gujarat State Road Development Corp. Ltd.

In continuation of our Independent Audit Report on Standalone Financial Statement of Gujarat State Road Development Corp. Ltd. ("The Company") dated have reported on Directions and Sub-direction under section 143(5) of the Companies Act, 2013 applicable for the year 2020-21, as under:

ANNEXURE-2(i)

Directions under Section 143(5) of Companies Act, 2013 Applicable for the year 2020-21

Sr. No.	Directions/Questions u/s 143(5)	Action Taken	Impact on Accounts and Financials
1	Whether the Company has system in place to process all the accounting transactions through IT system? If Yes, the implication of processing of accounting transactions outside IT system on the integrity of the accounts along with the financial implications, if any, may be stated.	Yes, The Company has system in place to process all the accounting transactions through IT system i.e. TALLY. However source documents from which accounting transactions are done are maintained in hard copy, In the form of register, MS Word documents and MS Excel documents.	No impact
2	Whether there is any restructuring of an existing loan or cases of waiver/write off of debts/loans/interest etc. made by a lender to the company due to the company's inability to repay the loan? If yes, the financial impact may be stated. Whether such cases are properly accounted for? (In case, lender is a Government company, then this direction is	There is no such case restructuring or waiver of debts/loan/interest etc.	No impact

	also applicable for statutory auditor of lender company).		
3	Whether funds (grants/subsidy etc.) received/receivable for specific schemes from Central/State Government or its agencies were properly accounted for/utilized as per its term and conditions? List the cases of deviation.	As per the information and according to the explanations given to us the company has received/ receivable funds for specific scheme from R&B Department, Gandhinagar during the year 2020-21 which were properly accounted for/ utilized as per the terms and conditions.	No impact

**For, Inani & Inani
Chartered Accountants
(FRN.120507W)**

**Place : Gandhinagar
Date : 30th November, 2021
UDIN : 21145569AAAACD5500**

**(CA Ankit Shah)
Partner
M.No.145569**

ANNEXURE-2(ii)

Sector Specific Sub-directions under section 143(5) of Companies Act, 2013

Sr. No.	Sub Directions issued/Questions u/s 143(5)	Action Taken	Impact on financials
Infrastructure Sector			
1	Whether the company has taken adequate measures to prevent encroachment of idle land owned by it. Whether any land of the Company is encroached, under litigation, not put to use or declared surplus? Details may be provided.	According to the information given to us, the Company does not own any land. Therefore, this is not applicable.	No impact
2	Whether the system in vogue for identification of projects to be taken up under Public Private Partnership is in line with the guidelines/ policies of the Government? Comment on deviation if any.	Yes, the Company has undertaken 9 projects under Public Private Partnership till date and the system in vogue for identification of projects to be taken up under Public Private Partnership is in line with the guidelines/ policies of the Government.	No impact.
3	Whether system for monitoring the execution of works vis-à-vis the milestones stipulated in the agreement is in existence and the impact of cost escalation, if any, revenues/losses from contracts, etc., have been properly accounted for in the books.	Yes, system for monitoring the execution of works vis-à-vis the milestones stipulated in the agreement is in existence. Also, the impact of cost escalation, if any, revenues/losses from contracts, etc., have been properly accounted for in the books.	No Impact
4	Whether funds received/ receivable for specific schemes from Central/ State agencies were properly accounted for/ utilized? List the cases	As per the information and according to the explanations given to us the company has received/ receivable funds for specific scheme from R&B Department, Gandhinagar during	No impact

	of deviations.	the year 2020-21 which were properly accounted for/ utilized as per the terms and conditions. However Grant balances as on 31st March, 2021 are subject to reconciliations and consequential adjustments, if any.	
5	Whether the bank guarantees have been revalidated in time?	Yes, wherever it is considered necessary.	No impact
6	Comment on the confirmation of balances of trade receivables, trade payables, term deposits, bank accounts and cash obtained.	The balances of Sundry Debtors, Sundry Creditors, Loans & Advances and any other Outstanding Balances including all squared up accounts are subject to confirmation. Balance Confirmations for term deposits, bank accounts and cash is obtained.	Unable to quantify the impact on financials, if any, until confirmations are received.
7	The cost incurred on abandoned projects may be quantified and the amount actually written-off shall be mentioned.	There is no such project which has abandoned during the financial year 2020-21	No impact

**For, Inani & Inani
Chartered Accountants
(FRN.120507W)**

**Place : Gandhinagar
Date : 30th November, 2021
UDIN : 21145569AAAACD5500**

**(CA Ankit Shah)
Partner
M.No.145569**

Gujarat State Road Development Corporation Limited

(CIN: U45200GJ1999SGC035995)

Balance Sheet as at 31st March, 2021

(Amount in ₹)

Particulars	Note No.	As at 31st March, 2021	As at 31st March, 2020
<u>EQUITY AND LIABILITIES</u>			
Shareholders' funds			
Share Capital	2	50,000,000	50,000,000
Reserves and Surplus	3	296,236,107	176,315,413
Sub Total		346,236,107	226,315,413
Non-Current Liabilities			
Long Term Borrowings	4	5,413,800,614	3,883,075,350
Deffered Tax Liabilities (Net)	12	18,898,324	16,715,475
Other Long Term Liabilities	5	143,405,146	160,091,120
Long Term Provisions	6	-	-
Sub Total		5,576,104,084	4,059,881,945
Current Liabilities			
Short Term Borrowings	7	600,422,291	-
Trade Payables	8	-	-
(a) Total outstanding dues of MSME		-	-
(b) Total outstanding dues of other than MSME		3,907,539	4,083,623
Other Current Liabilities	9	4,619,045,394	4,507,228,499
Short Term Provisions	10	34,672,305	-
Sub Total		5,258,047,529	4,511,312,122
Total		11,180,387,720	8,797,509,480
<u>ASSETS</u>			
Non-Current Assets			
Property, Plant and Equipment and Intangible Assets			
i. Property, Plant and Equipment	11	2,298,631	1,612,274
ii. Intangible Assets	11	205,205,964	247,082,746
Long term Loans and Advances	13	6,528,936,373	4,220,587,444
Other Non Current Assets	14	54,260	54,260
Sub Total		6,736,495,228	4,469,336,724
Current Assets			
Trade Receivables	15	1,344,054,984	400,628,798
Cash and cash Equivalents	16	2,984,887,008	3,597,723,402
Short Term Loans and Advances	17	91,982,772	165,596,834
Other Current Assets	18	22,967,727	164,223,722
Sub Total		4,443,892,492	4,328,172,756
Total		11,180,387,720	8,797,509,480

Significant Accounting Policies and Notes form an integral part of financial statements.
As per our report of even date attached.

FOR INANI & INANI
CHARTERED ACCOUNTANTS
FRN 120507W

FOR GUJARAT STATE ROAD DEVELOPMENT
CORPORATION LIMITED

(ANKIT SHAH)
PARTNER
M. NO. 145569

ASHOK K PATEL
MANAGING DIRECTOR
DIN: 0009403694

D B NIMAVAT
DIRECTOR
DIN: 08937010

PLACE:-GANDHINAGAR
DATED:-30-11-2021
UDIN NO 21145569AAAACD5500

SHEETAL SHAH
I/C COMPANY SECRETARY

Gujarat State Road Development Corporation Limited
(CIN: U45200GJ1999SGC035995)

Statement of Profit and Loss for the year ended 31st March, 2021

(Amount in ₹)

Particulars	Note No.	Year 2020-21	Year 2019-20
I INCOME			
1. Revenue from Operations	19	808,777,366	722,679,789
2. Other Income	20	42,628,921	58,941,773
Total Income		851,406,287	781,621,562
II EXPENDITURES			
1. Direct Expenses	21	588,098,163	671,719,284
2. Employee Benefit Expenses	22	14,963,709	13,214,191
3. Finance Costs	23	37,047	1,102,249
4. Depreciation	11	42,654,505	42,330,277
5. Other Expenses	24	35,693,109	38,658,900
Total Expense		681,446,533	767,024,901
III PROFIT BEFORE EXCEPTIONAL ITEMS AND TAX		169,959,754	14,596,661
IV Exceptional Items			
1. Prior Period Items	25	-	9,295,041
V PROFIT BEFORE EXTRAORDINARY ITEMS AND TAX		169,959,754	23,891,702
VI Extraordinary Items		-	-
VII NET PROFIT BEFORE TAX		169,959,754	23,891,702
VIII TAX EXPENSES			
1. Current Tax		48,221,246	3,988,003
2. Mat Credit Entitlement		(365,035)	(2,816,195)
3. Deferred Tax		2,182,849	5,738,753
4. Previous Year Tax		-	(448,763)
IX NET PROFIT AFTER TAX		119,920,694	17,429,904
X EARNINGS PER SHARE			
Basic		23.98	3.49
Diluted		23.98	3.49

Significant Accounting Policies and Notes form an integral part of financial statements.
As per our report of even date attached.

FOR INANI & INANI
CHARTERED ACCOUNTANTS
FRN 120507W

FOR GUJARAT STATE ROAD DEVELOPMENT
CORPORATION LIMITED

(ANKIT SHAH)
PARTNER
M. NO. 145569

ASHOK K PATEL
MANAGING DIRECTOR
DIN: 0009403694

D B NIMAVAT
DIRECTOR
DIN : 08937070

PLACE:-GANDHINAGAR
DATED:-30-11-2021
UDIN NO 21145569AAAACD5500

SHEETAL SHAH
I/C COMPANY SECRETARY

Gujarat State Road Development Corporation Limited
(CIN: U45200GJ1999SGC035995)

Cash Flow Statement for the year ending 31st March, 2021

(Amount in ₹)

Particulars	Year 2020-21	Year 2019-20
A. Cash Flow From Operating Activities		
Net Profit before Taxes as per Profit & Loss Account	169,959,754	23,891,702
Adjustments For: Non Cash and Non operating Items		
Depreciation	42,654,505	42,330,277
Interest Income	(41,800,801)	(55,792,218)
Other Interest Exps	37,047	1,102,249
Profit from Sale of Fixed assets	(1,983)	(11,735)
Operating Profit Before Working Capital Changes	170,848,522	11,520,275
Adjustment for Working Capital Changes:		
Trade Payables	(176,084)	(132,128,710)
Other Liabilities	95,130,920	592,987,512
Trade Receivables	(943,426,187)	(104,595,391)
Other Current Assets	84,063,418	(48,672,948)
	(593,559,410)	319,110,738
Less: Taxes Paid	13,183,906.00	18,718,644
NET CASH OUT FLOW FROM OPERATING ACTIVITIES [A]	(606,743,316)	300,392,094
B. Cash Flow From Investing Activities		
Purchase of Fixed Assets	(1,478,097)	(1,124,956)
Sale of Fixed assets	16,000	38,643
Interest Received	491,807,677	49,682,246
NET CASH FLOW FROM INVESTING ACTIVITIES [B]	490,345,580	48,595,933
C. Cash Flow From Financing Activities		
Interest paid on GSFS Loan	(319,200,237)	(144,316,665)
Other Interest Exps	(37,047)	(1,102,249)
Long Term Advances	(2,308,348,929)	(3,427,390,239)
Increase in Long term Borrowing	1,530,725,264	3,359,508,350
Increase in Short term borrowing	600,422,291	-
NET CASH OUT FLOW FROM FINANCING ACTIVITIES [C]	(496,438,658)	(213,300,803)
NET INCREASE/(DECREASE) IN CASH OR CASH EQUIVALENTS [D]=A+B+C	(612,836,394)	135,687,224
Cash & Cash Equivalents at the beginning of the year	3,597,723,402	3,462,036,178
Cash & Cash Equivalents at the end of the year	2,984,887,008	3,597,723,402

Notes:

- (1) Cash flow statement has been prepared following indirect method as prescribed in Accounting Standard -3, "Cash Flow Statement" issued under section 133 of the Companies Act, 2013 read with Rule 7 of Companies (Accounts) Rules, 2014.
(2) Details of Components of Cash and Cash Equivalents are available as per Note No. 14.

Significant Accounting Policies and Notes form an integral part of financial statements.
As per our report of even date attached.

FOR INANI & INANI
CHARTERED ACCOUNTANTS
FRN 120507W

FOR GUJARAT STATE ROAD DEVELOPMENT
CORPORATION LIMITED

(ANKIT SHAH)
PARTNER
M. NO. 145569

ASHOK K PATEL
MANAGING DIRECTOR
DIN: 0009403694

D B NIMAVAT
DIRECTOR
DIN: 08937010

PLACE:-GANDHINAGAR
DATED:-30-11-2021
UDIN NO 21145569AAAACD5500

SHEETAL SHAH
I/C COMPANY SECRETARY

Gujarat State Road Development Corporation Limited
(CIN: U45200GJ1999SGC035995)

Notes on Financial Statements for the year ended 31st March,2021

1. Significant Accounting Policies

A. Basis of Preparation of Financial Statements

The financial statements have been prepared in accordance with the Generally Accepted Accounting Principles (GAAP) in India under the historical cost conventions on accrual basis, unless otherwise stated, GAAP comprises applicable Accounting Standards specified under section 133 of the Companies Act, 2013, read with Rule 7 of The Companies (Accounts) Rules, 2014, other pronouncements of the Institutes of Chartered Accountants, relevant applicable provisions of the Companies Act, 2013. The accounting policies have been consistently adopted by the Company and are consistent with those used in the previous year.

The company undertakes Road Development Projects on behalf of the Government. The expenditure incurred for the purpose is adjusted against the grant as per the administrative approval given by the Government. Road so constructed being the assets of the Government and in absence of the Direction of the Government to adjust Road Project Cost if any against the Grant, the expenditure is charged to Profit & Loss Account.

B. Use of Estimates

The preparation of financial statements in conformity with Generally Accepted Accounting Principles (GAP) in India requires management to make estimates and assumptions that affect the reported amounts of assets and liabilities and the disclosures of contingent liabilities on the date of financial statements and reported amounts of revenue and expenses of that year.

Although these estimates are based upon management's best knowledge of current events and actions, accounting estimates could change from period to period. Actual results could differ from those estimates. Appropriate changes in estimates are made as the management becomes aware of changes in circumstances surrounding the estimates. Changes in estimates are reflected in the financial statements in the period in which changes are made and, if material, their effects are disclosed in the notes to accounts to the financial statements.

C. Cash Flow Statement

Cash and cash equivalents for the purpose of cash flow statement comprise cash at bank and in hand and short-term investments with an original maturity period of three months or less.

Cash flows are reported using the indirect method, whereby net profit before tax is adjusted before the effects of transactions of a non-cash nature and any deferrals or accruals of past or future cash receipts and payments and items of income or expenses associated with investing or financing flows. The cash flows from operating, investing and financing activities of the Company are segregated.

D. Prior Period and Extra Ordinary Items

Prior period items and Extra Ordinary items having material impact on the financial affairs of the Company are disclosed separately.

E. Event Occurring after Balance Sheet Date

Material adjusting events (that provides evidence of condition that existed at the balance sheet date) occurring after the balance sheet date are recognised in the financial statements. Non adjusting events (that are inductive of conditions that arose subsequent to the balance sheet date) occurring after the balance sheet date that represents material change and commitment affecting the financial position are disclosed in the Director's report.

E. Property Plant & Equipment

(i) Tangible Assets

Fixed assets are stated at their original cost of acquisition less accumulated depreciation and impairment losses. Cost comprises of all costs incurred to bring the assets to their location and working condition and includes all expenses incurred up to the date of commercial utilization.

Subsequent expenditure related to an item of fixed assets is added to its book value only if it increases the future benefits from the existing asset beyond its previously assessed standard of performance. All other expenses on existing fixed assets, including day-to-day repair and maintenance expenditure and cost of replacing parts, are charged to statement of Profit and Loss for the period during which such expenses are incurred.

Gains or Losses arising from de-recognition of Fixed Assets are measured as the difference between net disposal proceeds and the carrying amount of the asset and are recognized in the statement of Profit and Loss.

(ii) Intangible Assets

Intangible assets are stated at cost of acquisition net of recoverable taxed less accumulated amortization and impairment loss, if any. The cost comprises purchase price and any cost directly attributable to bringing the asset to its working condition for the intended use and net charges on foreign exchange contracts and adjustments arising from exchange rate variations attributable to the intangible assets.

G. Depreciation/Amortizations

Depreciation/amortization in respect of all fixed assets has been calculated following written down value method. Depreciation is provided based on the useful life of the assets as prescribed in Schedule II to the Companies Act, 2013. On addition/ deductions of assets during the period depreciation has been provided on pro-rata basis.

Depreciation of assets having value of less than Rs. 5,000/- are provided @ 100%.

The right-to use asset (recognised under AS-26 "Intangible Assets) is amortized over its remaining period using the straight-line method from the date of commissioning of the respective right acquired.

In case of other intangible Assets, software, website development is amortized at 25% on written down value method and Intangible assets in respect of KIM-Mandvi Project BTA is amortized by considering useful life of 8 year on SLM.

H. Construction Contracts

Contract revenue associated with the construction of road are recognized as revenue by reference to the stage of completion of the projects at the balance sheet date. The stage of completion of project is determined by the proportion that contact cost incurred for work performed up to the balance sheet date bears to the estimated total contracts.

I. Revenue Recognition

Revenue arising out of various contracts are recognized on accrual basis as per the terms of the contract except in the cases where the ability to assess the ultimate collection with reasonable certainty is lacking at the time of raising any claim (because of disputes raised by the contractor) particularly with respect to, Project Development Fees, Toll Collection, Excess Revenue Sharing, Additional Concession Fees, Interest etc then such revenue is recognized on realization basis.

The Corporation has following kinds of Income:

Revenue from Services

1. Project Development Fees
2. Toll Collection/Premium
3. Additional Concession Fees
4. Material Testing Charges

Other Income

5. Tender Document Fees
6. Interest

1. Revenue from Project Development Fees

Revenue from Project Development Fees is recognized in accordance with terms of the relevant concession Agreement which is accounted as income on pro rata basis of tenure of project completion.

2. Revenue from Toll Collection

Revenue from Toll Collection Fees is recognized in accordance with terms of the relevant Agreement which is accounted as income on accrual basis except in the cases where the ability to assess the ultimate collection with reasonable certainty is lacking at the time of raising any claim than Revenue from Toll Collection Fees will be recognized as and when realized.

3. Revenue from Additional Concession Fees

Revenue from Additional concession Fees is recognized in accordance with terms of the relevant concession Agreement which is accounted as income on accrual basis except in the cases where the ability to assess the ultimate collection with reasonable certainty is lacking

at the time of raising any claim than Revenue from Additional Concession Fees will be recognized as and when realized.

4. Material Testing Charges, Supervision Charges, Tender Document Fees, Bid Security Fees, Misc. Income, Other Recovery, Road Damage imposed, Penalty receipt are recognized as and when realized in absence of ability to assess the ultimate collection with reasonable certainty.

5. Interest

Interest income is recognized on time proportionate basis except in the cases where the ability to assess the ultimate collection with reasonable certainty is lacking at the time of raising any claim then such revenue is recognized on realization basis

The interest earned on deposit made with Gujarat State Financial Services Limited (Government of Gujarat Enterprise) consists of deposit made out of the unutilized grant and own fund which is maintained under common pool account of Deposits. Interest Income earned during the year is apportioned between Grant Funds and Own Funds on the basis of Average of the Opening and Closing of such Balances. Interest income so earned to the extent of on the deposit of unutilized fund of the grant is treated as Current Liability under the head "Grant Funds" and may be required to be surrendered as per the direction of Government of Gujarat and Interest on deposit of own fund is treated as income of the year and accordingly credited to Profit & Loss Account.

Payment and receipts in relation to grants received for viability gap funding schemes are directly debited and credited against the said grant fund.

J. Direct Expenditure Recognition

Direct Expenses includes expenses in relation to Construction and Development of Roads and Bridges, Beautification work of Roads on accrual basis for which no grants are received and are required to be funded by the company from its own funds and not from Government Grant Funds.

K. Other Expenses Recognition

Other Expenses are recognized on accrual basis.

L. Accounting of Government Grants

Government grants are recognized when there is reasonable assurance that the Company will comply with the condition attached thereto and that the grant will be received.

The company receives various grants from Government of Gujarat for various purposes to be utilized as per the directions of Government of Gujarat. The company treats such grant funds as its liability and makes expenses out of such funds for specific purposes, which are debited to such grants/fund accounts. Unutilized amount of funds are kept as deposits with Gujarat State Financial Services Limited (Government of Gujarat Enterprise). Interest on deposits of such unutilized amount of grant is also treated as grant. The grant received for any specific purpose and the expenditure on such specific purpose if not matching with the amount of grant received and

exceeds the amount of grants received is treated as expenses of the year and to that extent debited to Statement of Profit & Loss of the Company.

Grants are used for the project for which they are sanctioned and in any case if required to be used for other project then permission is taken from the sanctioning authority.

M. Investments

Investments that are readily realizable and are intended to be held for not more than one year from the date, on which investments are made, are classified as current investments. All other investments are classified as long-term investments. Current investments are carried at lower of cost or fair value determined on an individual investment basis. Long term investments are carried at cost. However provision for diminution in value is made for diminution other than temporary in nature.

N. Employee Benefits

Short Term employee benefits are recognized as an expense in the profit and loss account of the year in which such actual payment is made.

Post employment and other long term employee benefits are recognized as an expense in the profit and loss account for the year when actual payment is made and no other provisions are made in respect of retirement benefits.

O. Borrowing Costs

Borrowing costs on working capital is charged to the statement of profit and loss in the year of incurrance. Borrowing costs that are attributable to the acquisition of tangible fixed assets are capitalized till the date of substantial completion of the activities necessary to prepare the relevant asset for its intended use. Borrowing costs that are attributable to the acquisition or development of qualifying intangible assets are capitalized till the date they are put to use.

P. Accounting for Leases

(i) Operating Lease

The company has leased certain tangible assets and such leases where the company has substantially retained all the risks and rewards of ownership are classified as operating leases. Lease income on such operating leases are recognized in the Statement of Profit & Loss on a straight-line basis over the lease term which is representative of the time pattern in which benefit derived from the use of the leased asset is diminished. Initial direct costs are recognized as an expense in the Statement of Profit & Loss in the period in which they are incurred.

(ii) Finance Lease

The assets given under the finance lease are recognized in the balance sheet date at an amount equal to the net investment in the leases. The recognition of finance income is based on a pattern reflecting a constant periodic rate of return on the net investment outstanding in respect of the finance lease.

Q. Earnings per Share

The Company reports basic and diluted Earnings per Share (EPS) in accordance with Accounting Standard- 20 "Earning per Share". The basic EPS is computed by dividing the net profit or loss for the period by the weighted average number of equity shares outstanding during the period. Diluted EPS is computed by dividing the net profit or loss for the period by the weighted average number of equity shares outstanding during the period as adjusted for the effects of all dilutive potential equity shares, except where the results are anti-dilutive.

R. Taxes on Income

Current tax is determined as the amount of tax payable in respect of taxable income for the period.

Deferred Tax Assets or Deferred Tax Liability is recognized on timing difference being the difference between taxable income and accounting income. Deferred Tax Assets or Deferred Tax Liabilities are measured using the tax rates and tax laws that have been enacted or substantively enacted at the Balance Sheet Date. Deferred Tax Assets arising from timing differences are recognized to the extent there is a reasonable certainty that the assets can be realized in future.

The Minimum Alternative tax (MAT) credit is recognized as an asset only when and to the extent there is convincing evidence that the Company will pay normal income tax during the specified period. In the year in which the MAT credit becomes eligible to be recognized as an asset in accordance with the recommendations contained in guidance note issued by the Institute of Chartered Accountants of India, the said asset is created by way of a credit to the Profit and Loss Account and shown as MAT Credit Entitlement. The Company reviews such credits at each balance sheet date and writes down the carrying amount of MAT Credit Entitlement, if warranted.

S. Impairment Of Assets

An asset is considered as impaired in accordance with AS-28 when at the balance sheet date, there are indications of impairment and the carrying amount of the asset, or where applicable the cash generating unit to which the asset belongs, exceeds its recoverable amount (i.e. the higher of the asset's net selling price and the value in use). In assessing the value in use, the estimated future pre-tax cash flow expected from the continuing use of the asset and its ultimate disposal are discounted to their present value using a weighted average cost of capital. The carrying amount is reduced to the recoverable amount and the reduction is recognized as an impairment loss in the Statement of Profit and Loss.

T. Provisions, Contingent Liabilities and Contingent Assets

A provision is recognized if, as a result of a past event, the Company has a present obligation that can be estimated reliably, and it is probable that an outflow of economic benefits will be required to settle the obligation at the reporting date. Where no reliable estimate can be made, a disclosure is made as contingent liability. A disclosure for a contingent liability is also made when there is a possible obligation or a present obligation that may, but probably will not, require an outflow of resources. Where there is a possible obligation or a present obligation in respect of which the likelihood of outflow of resources is remote, no provision or disclosure is made.

Gujarat State Road Development Corporation Limited

(CIN: U45200GJ1999SGC035995)

Notes on Financial Statements for the year ended 31st March, 2021

	(Amount in ₹)	(Amount in ₹)
	As at 31st March, 2021	As at 31st March, 2020
2 Share Capital		
Authorised Share Capital:		
50,00,000 Equity Shares of ₹ 10 each (50,00,000 Equity Shares of ₹ 10 each in previous year)	50,000,000	50,000,000
Issued, Subscribed and Paid up Capital		
50,00,000 Equity Shares of ₹ 10 each (50,00,000 Equity Shares of ₹ 10 each in previous year)	50,000,000	50,000,000
Total:>	50,000,000	50,000,000

2.1 Details of Shareholders holding more than 5% shares:

Name of the Shareholder	As at 31st March, 2021		As at 31st March, 2020	
	%	No of Shares	%	No of Shares
1 Hon. Governor of Gujarat	100%	49,99,993	100%	49,99,993

2.2 Reconciliation of Shares outstanding at the beginning and at the end of reporting period:

Particulars	As at 31st March, 2021		As at 31st March, 2020	
	No of Shares		No of Shares	
Equity Shares at the beginning of the year	5,000,000	50,000,000	5,000,000	50,000,000
Add: Shares Issued During the Year	-	-	-	-
Less: Shares Cancelled or Bought Back during the year	-	-	-	-
Equity Shares at the end of the year	5,000,000	50,000,000	5,000,000	50,000,000

2.3 Terms/Rights Attached to Equity Shares

The company has only one class of equity shares having a face value of Rs. 10 per share. Each equity shareholder is entitled to one vote per share.

In the event of liquidation of the company, the holders of equity shares will be entitled to receive the remaining assets of the company, after distribution of all preferential amounts.

2.4 Shares held by holding/ultimate company and/ or their subsidiaries/ associates: NIL

	As at 31st March, 2021	As at 31st March, 2020
3 Reserves and Surplus		
Profit & Loss Account		
As per Last Balance Sheet	176,315,413	158,885,509
Add: Profit/(Loss) during the year	119,920,694	17,429,904
Less: Appropriations during the year	-	-
Total:>	296,236,107	176,315,413

Gujarat State Road Development Corporation Limited
(CIN: U45200GJ1999SGC035995)

Notes on Financial Statements for the year ended 31st March, 2021

4 Long Term Borrowings	(Amount in ₹)		(Amount in ₹)	
	As at		As at	
	31st March, 2021	31st March, 2020	31st March, 2021	31st March, 2020
	Non-Current	Current	Non-Current	Current
Secured Long term Borrowings	-	-	-	-
Unsecured Long Term Borrowings:				
(a) From Banks				
(b) From Others				
Loan from Roads & Building Dept.	10,000,000		10,000,000	
Loan from Gujarat State Financial Services Limited	5,403,800,614		3,873,075,350	
	5,413,800,614	-	3,883,075,350	-
Total:>	5,413,800,614	-	3,883,075,350	-

4.1 Loan from Road & Building Department

The company has borrowed an amount of Rs. 1,00,00,000/- for the purpose of incurring establishment expenditure and preliminary expenditure respectively from Road & Building Department, Government of Gujarat at the time of incorporation of the company. The company does not have any confirmation/direction for repayment of this amount till date. However, in perception of the management as the amount is outstanding since long and there is unlikely of any demand being raised from the lender within next 12 months, the amount is shown as "Unsecured Long Term Borrowings" in the accounts. The amount is unsecured and no interest is payable on the same.

4.2 Loan from Gujarat State Financial Services Limited

GSFSL has sanctioned long term Loan of Rs. 1847.00 crore vide its Letter no. GSFS/credit/GSRDC/18-19/350 Dated 14.11.2018 for widening/upgradation of Ahmedabad-Rajkot NH No 8A(New NH No 47) and NH No. 8B(New NH No. 27) from four lane to six lane by R&B Department,GOG,Gandhinagar. Till 31.03.2021, an amount of Rs. 559.74 crore has been disbursed by the GSFSL (2018-19 - Rs. 51.36 crores, 2019-20 - Rs. 335.95 crores and 2020-21-Rs. 172.43 Crore). and the same amount has been Advanced to NH for the said project, on same terms and conditions on which loan has been taken from GSFSL. The term Loan is repayable to GSFSL in Forty quarterly installments along with interest @ 7.75% p.a. (Subject to change from time to time) after moratorium period of two years. The said Loan is confirmed by GOG,R&B Department,Gandhinagar vide its Letter No. NHR-10-2009-825036-PART-6-M Dated 29.12.2018. Further as per letter by GSFS, Interest amount **Rs.40,68,50,020** was capitalised upto 11/03/2021 (Interest of Rs.40,68,50,020 as per scheduled). Out off above Instalment payable in 2021-22 of Rs. 60.04 Crore is classified in short term borrowing.

5 Other Long Term Liabilities

	As at 31st March, 2021	As at 31st March, 2020
Security Deposit, Time Deposits and Withheld Monies- Unsecured	142,012,636	158,215,270
Earnest Money Deposits-Unsecured	1,392,510	1,875,850
Total:>	143,405,146	160,091,120

5.1 Security Deposit and Earnest Money Deposit are for Long Term Projects and in the perception of Management the same are not likely to be repaid within next 12 months.

Gujarat State Road Development Corporation Limited
(CIN: U45200GJ1999SGC035995)

Notes on Financial Statements for the year ended 31st March, 2021

	As at 31st March, 2021	As at 31st March, 2020
6 Long Term Provisions		
Provisions for Pensions & Leave Salary	-	-
Total:>	-	-

6.1 All the employees of the Corporation are outsourced, contractual or on deputation from Government of Gujarat therefore the Co. is not required to make provisions and Disclosures as per Accounting Standard-15, "Employee Benefits".

	As at 31st March, 2021	As at 31st March, 2020
7 Short Term Borrowings		
<u>Current Maturities of Long term Borrowings</u>		
Loan from Gujarat State Financial Services Limited	600,422,291	-
Total:>	600,422,291	-

GSFSL has sanctioned long term Loan of Rs. 1847.00 crore vide its Letter no. GSFS/credit/GSRDC/18-19/350 Dated 14.11.2018 for widening/upgradation of Ahmedabad-Rajkot NH No 8A(New NH No 47) and NH No. 8B(New NH No. 27) from four lane to six lane by R&B Department,GOG,Gandhinagar. Till 31.03.2021, an amount of Rs. 559.74 crore has been disbursed by the GSFSL (2018-19 - Rs. 51.36 crores, 2019-20 - Rs. 335.95 crores and 2020-21-Rs. 172.43 Crore). and the same amount has been Advanced to NH for the said project, on same terms and conditions on which loan has been taken from GSFSL. The term Loan is repayable to GSFSL in Forty quarterly installments along with interest @ 7.75% p.a. (Subject to change from time to time) after moratorium period of two years. The said Loan is confirmed by GOG,R&B Department,Gandhinagar vide its Letter No. NHR-10-2009-825036-PART-6-M Dated 29.12.2018. Further as per letter by GSFS, Interest amount Rs.40,68,50,020 was capitalised upto 11/03/2021 (Interest of Rs.40,68,50,020 as per scheduled). Out off above Instalment payable in 2021-22 of Rs. 60.04 Crore is classified in short term borrowing.

	As at 31st March, 2021	As at 31st March, 2020
8 Trade Payables		
Trade Payables		
Dues of micro enterprises and small enterprises	-	-
Dues of Trade Payable other than micro enterprises and small enterprises*	3,907,539	4,083,623
Total:>	3,907,539	4,083,623

* Includes Payable to Gujarat Industrial Development Board.

8.1 Amount Payable to Gujarat Industrial Development Board is with respect to various feasibility studies and outstanding since long.

	As at 31st March, 2021	As at 31st March, 2020
9 Other Current Liabilities		
Income Received in Advance	10	14
Balance of Grant Funds(Refer Note No: 31)	4,414,613,778	4,097,099,389
Other Current Liabilities*	204,431,606	410,129,096
Total:>	4,619,045,394	4,507,228,499

*The other current liabilities are inclusive of Statutory Dues

	As at 31st March, 2021	As at 31st March, 2020
10 Short Term Provisions		
Provision for Taxation	34,672,305.00	-
Total:>	34,672,305	-

12 Deferred Tax Assets/(Liabilities)(Net)

In view of Accounting Standard 22, the significant component and classification of Deferred Tax Asset on Account of Timing Difference comprises the following:

	As at 31st March, 2021	As at 31st March, 2020
Deferred Tax Assets/Liabilities related to Property Plant and Equipment		
Opening Balance(Deferred Tax Assets/(Liability))	(16,715,475)	(10,976,722)
Add: Addition/(Deduction) during the year	(2,182,849)	(5,738,753)
Total:>	(18,898,324.00)	(16,715,475.00)
	As at 31st March, 2021	As at 31st March, 2020
WDV as per books	207,504,595	248,695,020
WDV as per Income Tax	142,606,506	188,610,638
Timing Difference Due to Depreciation on Property Plant and Equipment	(64,898,089)	(60,084,382)
Provisions for Pensions & Leave Salary (B)	-	-
Total (A + B)	(64,898,089)	(60,084,382)
Tax @ 29.12	(18,898,324)	(16,715,475)
Net Deferred Tax Assets/(Liability)	(18,898,324)	(16,715,475)

Gujarat State Road Development Corporation Limited
(CIN: U45200GJ1999SGC035995)

Note No 11

Notes on Financial Statements for the year ended 31st March, 2021

(Amount in ₹)

Sr. No.	Description of Assets	Gross Block					Depreciation			Net Block	
		As at 1-04-2020 (Amount in ₹)	Additions (Amount in ₹)	Deductions / Adjustments (Amount in ₹)	Closing Balance on 31-03-2021 (Amount in ₹)	Upto 31-03-2020 (Amount in ₹)	For The Current Year (Amount in ₹)	Deductions/A adjustment (Amount in ₹)	Upto 31-03-2021 (Amount in ₹)	As at 31-03-2020 (Amount in ₹)	Closing Balance As on 31-03-2021 (Amount in ₹)
		3	4		5	6	7	8	9	10	11
I.	Property, Plant and Equipment.										
	Computer System	3,039,839	1,381,602	280,350	4,141,091	2,777,730	392,504	266,333	2,903,901	262,109	1,237,190
	Electrical Installations	206,523	-	-	206,523	196,196	-	-	196,196	10,327	10,327
	Furniture & Fixtures	2,435,506	-	-	2,435,506	1,797,295	146,939	-	1,944,234	638,211	491,272
	Vehicles- Motor Car	3,665,565	-	-	3,665,565	3,467,506	14,781	-	3,482,287	198,059	183,278
	Office Equipments	2,704,020	96,495	-	2,800,515	2,200,452	223,499	-	2,423,951	503,568	376,564
	Cycle	2,950	-	-	2,950	2,950	-	-	2,950	-	-
	Total Tangible Assets	12,054,403	1,478,097	280,350	13,252,150	10,442,129	777,723	266,333	10,953,519	1,612,274	2,298,631
II.	Intangible Assets										
	Computer Software	877,148	-	-	877,148	828,108	12,319	-	840,427	49,040	36,721
	Web Development	390,154	-	-	390,154	340,465	12,482	-	352,947	49,689	37,207
	Kinr- Mandvi Project BTA	330,000,000	-	-	330,000,000	63,015,984	41,851,981	-	124,867,965	246,984,016	205,132,035
	Total Intangible assets	331,267,302	-	-	331,267,302	64,184,556	41,876,782	-	126,061,338	247,082,746	205,205,964
	Total	343,321,705	1,478,097	280,350	344,519,452	94,626,685	42,654,505	266,333	137,014,857	248,695,020	207,504,595
	Previous year	342,734,919	1,124,956	538,170	343,322,705	52,807,610	42,330,277	511,262	94,626,685	289,927,249	248,695,020

Gujarat State Road Development Corporation Limited

(CIN: U45200GJ1999SGC035995)

Notes on Financial Statements for the year ended 31st March, 2021

	As at 31st March, 2021	As at 31st March, 2020
(Amount in ₹)		
13 Long Term Loans and Advances		
Loan to NH		
a. Loan to Executive Eng. NH Ahmedabad	2,391,023,755	1,345,984,895
b. Loan to Executive Eng. Rajkot	3,650,132,061	2,527,090,434
Advances to valechha kutchh toll road Pvt. Ltd.	487,780,557	347,512,115
Total:->	6,528,936,373	4,220,587,444
14 Other Non Current Assets		
(Unsecured and Considered Good)		
Security Deposit	54,260	54,260
Total:->	54,260	54,260
15 Trade Receivables		
(Unsecured and Considered Good)		
For the period Less than 6 months	994,554,268	71,291,714
Others	349,500,716	329,337,084
Total:->	1,344,054,984	400,628,798
16 Cash and Bank Balances		
Cash and cash Equivalents		
Balances with Banks:		
In current Accounts	200,567,067	8,458,742
In Other Bank Balance (ICD Matured within 3 to 12 Month)	2,683,455,574	3,448,389,710
Cash on Hand	2,084	2,770
Liquid Deposit	100,862,283	140,872,180
Total:->	2,984,887,008	3,597,723,402
17 Short Term Loans and Advances		
(Unsecured and Considered Good)		
Balance with Statutory/Government Authorities	41,079,319	46,937,705
Tax deducted at source	14,674,511	14,679,252
Prepaid Expenses	12,446	14,063
Loans and Advances		
Safety fund receivable from L&T	10,222,415	10,222,415
MSK Project(Himmatnagar) Pvt. Ltd.	-	235,122
Receivable from Railway for ROB Expense	25,922,581	25,922,581
PGVCL Bhuj Bhachau	71,500	71,500
Mobilisation Advance to feedback infra Pvt Ltd	-	3,244,999
Loan to Kalathia Bagodara tarapur highway Pvt Limited	-	59,769,197
Advance to Arbitrators	-	4,500,000
Total:->	91,982,772	165,596,834
18 Other Current Assets		
Interest Receivable	22,967,727	153,774,366
L&T Due Deligance Due A/c	-	260,550
Mat credit Receivable	-	9,184,663
TCS Receivable	-	4,063
Change of Scope Recovery from Kalathia Bagodara tarapur Highway Pvt Ltd	-	1,000,080
Total:->	22,967,727	164,223,722

Gujarat State Road Development Corporation Limited
(CIN: U45200GJ1999SGC035995)

Notes on Financial Statements for the year ended 31st March, 2021

	(Amount in ₹) 2020-21	(Amount in ₹) 2019-20
19 Revenue from Operations		
Sale of Services:		
Toll Collection Income	39,502,052	52,123,009
Toll Compensation (Premiure) Income	764,269,442	562,100,772
Material Testing Income	2,649,856	9,905,252
Concession Fees and Lease Fees	16	10
Project Permission Fees	2,300,000	3,094,746
ODC Fees (Transportation)	56,000	56,000
Change in scope of work	-	95,400,000
Total:>	808,777,366	722,679,789
20 Other Income	2020-21	2019-20
Miscellaneous Income	314,120	2,910,807
Interest on IE expense (BTV)	-	556,678
Interest on Construction support loan (Pack 1)	1,237,960	6,056,772
Interest on L & T Additional concessional fees	38,811,263	48,075,518
Interest other	1,620,035	1,103,250
Interest on Loan to NH	131,543	-
Tender Documents Fees	514,000	238,748
Total:>	42,628,921	58,941,773
21 Direct Expenses	2020-21	2019-20
Share of Bharuch dahej toll collection	-	167,254,844
Bagodara- Tarapur- Vasad Road Expenses	78,407,688	140,359,256
Kim Mandvai Road Expenses	11,494,674	5,770,267
Beautification Works Expenses	19,129	417,493
Independent engineer expenditure	2,038,053	2,469,467
Bhuj Nakhtrana Road Expense	8,287,664	113,947,957
Constrction support for BTV Road	487,850,955	241,500,000
Total:>	588,098,163	671,719,284
Note : CSR expenses	NIL	NIL
22 Employee Benefit Expenses	2020-21	2019-20
Salaries and Wages	14,963,709	13,214,191
Total:>	14,963,709	13,214,191
23 Finance Costs	2020-21	2019-20
Others		
Interest On Income Tax	360	751,334
Interest On GST	30	132,679
Interest on TDS/TCS	36,657	218,236
Total:>	37,047	1,102,249

Gujarat State Road Development Corporation Limited

(CIN: U45200GJ1999SGC035995)

Notes on Financial Statements for the year ended 31st March, 2021

	(Amount in ₹) 2020-21	(Amount in ₹) 2019-20
24 Other Expenses		
Advertising Expenses	2,714,576	3,245,082
Travelling Expenses	264,985	350,455
Electricity, Power and Fuel Expenses	736,095	805,031
Legal & Professional Fees	25,380,145	25,273,221
Administrative Expenses	5,178,382	5,172,781
Telephone Expenses	46,498	76,159
Repairs & Maintenance Expenses	216,652	519,844
Payment to Auditors(Refer Note: 25)	370,905	658,688
Material Testing Charges	128,462	1,285,705
Other Expenses	467,130	1,271,933
Vehicle Insurance Expenses	40,533	-
Municipale Tax	62,220	-
Website Expenses	86,526	-
Total:>	35,693,109	38,658,900
	2020-21	2019-20
25 Prior Period Items		
I. Prior Period Expenditure	-	-
II. Prior Period Income	-	-
IE Fees from concessionaire	-	9,295,041
Total:>	-	9,295,041

Gujarat State Road Development Corporation Limited
(CIN: U45200GJ1999SGC035995)

Notes on Financial Statements for the year ended 31st March, 2021

26 Earning Per Share	As at 31st March, 2021	As at 31st March, 2020
The details are as under		
1 Profit after Tax	119,920,694	17,429,904
2 No of Equity Shares	5,000,000	5,000,000
3 Nominal Value per Equity Shares	10.00	10.00
4 Basic and Diluted Earnings Per Share	23.98	3.49

27 Payment to Auditors	As at 31st March, 2021	As at 31st March, 2020
As an auditor		
Statutory Audit Fees	206,500	413,000
Internal Audit Fees	141,600	207,680
Tax Audit Fees	22,805	38,008
Total:>	370,905	658,688

28 Related Party Disclosure

Sr No	Name of the Related Party	Relationship	Date of Appintment	Date of Cessation
1	Governor of Gujarat	Holder of 99.99% of shares		Not Applicable
2	Shri Purneshkumar Ishwarbhai Modi	Director	Thursday 23rd September, 2021	Not Applicable
3	Shri Nitinkumar Ratilal Patel	Director	Friday, June 20, 2014	Saturday, September 11, 2021
4	Shri Hareshkumar Modi	Managing Director	Friday, September 6, 2019	Tuesday, October 12, 2021
5	Shri Ashok K Patel	Managing Director	Tuesday, October 12, 2021	Not Applicable
6	Shri Ashwini Kumar Yadav	Director	Friday, October 21, 2016	Thursday, November 11, 2021
7	Shri Sandeep Bhanubhai Vasava	Director	Wednesday, September 7, 2016	Not Applicable
8	Shri Prakash Makwana	Director	22nd August 2019	Not Applicable
9	Shri Sureshbhai Dahyabhai Patel	Director	Thursday, June 26, 2014	Not Applicable
10	Shri B G Vaghela	Director	Tuesday, December 4, 2018	Friday, April 30, 2021
11	Shri D B Nimavat	Director	Saturday, 01st May, 2021	Not Applicable

As per Accounting Standard 18, the disclosure of transactions with related parties are given as below:

Sr No	Name of the Related Party	Relationship	Related Party Transactions
1	Shri Hareshkumar Modi	Managing Director	Remuneration to Managing Director of Rs. 19.99 Lacs

No amount is outstanding which pretains to related parties at the balance sheet date.

29 The previous year figures are reqrouped and rearranged wherever necessary.

30 The cash flow statement has been prepared and presented according to the Indirect Method of Cash flow prescribed by Accounting Standard 3.

31 Details of Grant and Utilization during the year

(Amount in `)							
Sr No	Project	Opening Balance as on 01/04/2020	Grant Received/ (Returned)	Total Expenditure Incurred	Adjusted Against Grant	Inter head Adjustment During the year#	Closing Balance as on 31/03/2021
1	ROB Fund	318,774,575	-	-	-	-	318,774,575
2	Chhayapuri ROB	110,960,197	-	-	-	-	110,960,197
3	Nano Ahmedabad Virangam Maliya Tollway VGF	42,844,257	-	-	-	-	42,844,257
4	Bharuch Dahej GoG Fund	125,804,083	-	-	-	-	125,804,083
5	Budget head 3(GoG Fund for Administrative Expenses-GSRDC)	2,450,000	-	-	-	-	2,450,000
6	Interest on Grant Fund	1,598,171,085	182,871,005	-	-	-	1,781,042,090
7	VGF Utility Shifting Fund	251,493,352	-	-	-	-	251,493,352
8	VGF Construction Fund	185,833,000	-	-	-	-	185,833,000
9	GoG Road Privatisation Fund	1,396,771,648	401,700,000	267,899,075	(267,899,075)	-	1,530,572,573
10	Central Road Fund Surat Bardoli Dastan	49,895,468	-	-	-	-	49,895,468
11	GOG Grant for Toll Exemption*	-	1,132,000,000	1,117,055,817	(1,117,055,817)	-	14,944,183
12	19-GSRDC Government grant	14,101,724	609,000,000	623,101,724	(623,101,724)	-	-
	Total	4,097,099,389	2,325,571,005	2,008,056,616	(2,008,056,616)	-	4,414,613,778

32 Contingent Liabilities

32.1 Claims against the company not acknowledged as debts:

Sr No.	Name of Status	Nature of Dues	(Amount in ₹)		Releted A.Y.	Forum where dispuie is pending
			Total contingent Liability	Amount Deposited under protest upto 31st March,2021		
1	Income Tax Act, 1961	Income Tax including Interest and penalty as applicable.	397296770 (P.Y. 397296770)	17589120 (P.Y. 17589120)	2010-2011	ITAT
2	Income Tax Act, 1961	Income Tax including Interest and penalty as applicable.	339785280 (P.Y. 339785280)	-	2011-2012	ITAT
3	Income Tax Act, 1961	Income Tax including Interest and penalty as applicable.	62245320 (P.Y. 62245320)	12449070 (P.Y. 12449070)	2011-2012	ITAT
4	Income Tax Act, 1961	Income Tax including Interest and penalty as applicable.	20724010 (P.Y. 20724010)	-	2012-2013	ITAT

32.2 Following Arbitration Cases are pending against the corporation, which are disputed by the corporation:

Sr No	Name of Party	Forum where Dispute is pending	(Amount in ₹)	
			2020-2021	2019-2020
1	Ranjit Project Pvt. Ltd Chayapuri ROB	Dispute Resolution: Arbitration Tribunal Proceedings are on going.	Rs. 9.90 Crore + Interest	Rs. 9.90 Crore + Interest
2	Ranjit Toll Road Pvt. Ltd. Deesa Panthawada Gudri Road	Award is declared which is challenged by GSRDC before the Hon'ble Commercial court.	Rs. 45 Crore	Rs. 45 Crore
3	M S Khurana Infrastructure & Toll Road Pvt Ltd Nakhatrana Road	Award is declared which is challenged by GSRDC before the Hon'ble Commercial court.	Rs. 24.17 Crore+ interest	Rs. 24.17 Crore+ interest
4	M S Khurana Infrastructure & Toll Road Pvt Ltd Nakhatrana Road	Concessionaire has raised dsipute regarding calculation of fee on the basis of different interpretation done by corporation which resulted in invocation of Arbitration. The Arbitral proceeding is in progress.	Rs. 2.8 Crore and recurring	Rs. 2.8 Crore and recurring
5	Welspun Project Ltd. Bharuch Dahej Road	Arbitration case if filed before the Gujarat Public Works Contracts dispute Arbitration Tribunal, Ahmedabad having jurisdiction for the item Rate tender of R&B Department. The case is on trial.	Rs. 54.46 Crore	Rs. 54.46 Crore
6	JMC Infra - B&R Infra Bharat Deesa Toll Road Private Limited Deesa Panthawada Gundri Road	The award had been declared under Arbitration and the same had been challenged by GSRDC in District Court. Thereafter, the same has been transferred to commercial Court. The case is as under trial.	Rs. 9.04 Crore + Interest	Rs. 9.04 Crore + Interest
7	Welspun Project Ltd. Chirai Anjar Project	GSRDC. The matter was then transferred to Commercial court at Ahmedabad. The case has not come on board.	2.38Crore	2.38Crore
8	GVK Bagodara Vasad Expressway Ltd.	GSRDC has filled claim against concessionaire worth Rs. 1084.19 crore. Arbitration panel is constituted. Documents are filled by both the parties. GVK has filled counter claim worth Rs. 3480.79 crore.	3480.79 Crore	3480.79 Crore
9	M.S. Khurana Infrastructure & Toll Road Pvt. Ltd. Bhu Nakhatrana	GSRDC has filled claim against concessionaire worth Rs. 54.34 crore + Interest. Arbitration panel is constituted. Documents are filled by both the parties. concessionaire has filled counter claim worth Rs. 167.65 crore.	167.65 Crore + Interest	167.65 Crore + Interest
10	L&T Rajkot Vadinar Tollway Limited Rajkot Jammnagar Vadinar Road	The concessionaire has filed Arbitration case against GSRDC claim worth Rs. 27.55 Crore. GSRDC has filed counter claim against concessionaire worth Rs. 37.10 Crore. Arbitration panel is constituted. Documents are filed by both the parties. Matter is at hearing stage.	Rs. 27.55 Crore and recurring + Interest	
11	L&T Halol Shamlaji Tollway Limited Halol Godhra Shamlaji Road	The concessionaire has filed Arbitration case against GSRDC claim worth Rs. 22.44 Crore. GSRDC has filed counter claim against concessionaire worth Rs. 125.89 Crore. Arbitration panel is constituted. Documents are filed by both the parties. Matter is at hearing stage.	Rs. 22.44 Crore and recurring + Interest	
12	Ahmedabad Maliya Tollway Limited Ahmedabad Maliya Road	The concessionaire has filed Arbitration case against GSRDC claim worth Rs. 71.19 Crore. GSRDC has filed counter claim against concessionaire worth Rs. 203.23 Crore. Arbitration panel is constituted. Documents are filed by both the parties. Matter is at hearing stage.	Rs. 71.19 Crore and recurring + Interest	

32.3	Sr No	Following cases filed by the corporation against the various parties which are disputed by the parties and pending as on 31st March, 2021	2020-2021	2019-2020
	1	GVK Bagodara Vasad Expressway Ltd. Bagodara Vasad	Rs. 1084.19 crore	Rs. 1084.19 crore
	2	M.S. Khurana Infrastructure & Toll Road Pvt. Ltd. Bhu Nakhatrana	Rs. 54.34 crore	Rs. 54.34 crore

33 Borrowing cost capitalised during the year Rs. NIL (Previous year NIL).

34 Segment Reporting

The Company is engaged in one segment only which is of Road and Bridges Development and Maintenance Work. These, in the context of Accounting Standard 17 on the Segment Reporting, are considered to constitute one single primary segment. Hence disclosures as per Accounting Standard 17 are not required.

35 The balances of Unsecured Loan of Road & Bulding Department, Gujarat Industries Development Board, Sundry Debtors, Sundry Creditors, Loans & Advances and any other Outstanding Balances including all squared up accounts are subject to confirmation. In the opinion of Board of Directors, the current assets, loans and advances are approximately of the value stated, if released in the ordinary course of business.

36 Details of dues to Micro, Small and Medium Enterprise as defined under MSMED Act, 2006

The Company has not received any intimation from suppliers regarding their status under the Micro, Small and Medium Enterprises Development Act, 2006 and hence disclosure regarding:

- a) Amount due and outstanding to suppliers at the end of accounting year,
- c) Interest payable at the end of accounting year,
- d) Interest accrued and unpaid at the end of the accounting year, have not been given.

The company is making efforts to get the confirmation from the suppliers as regards their status under the Act.

37 Interest of Rs. 18,28,71,005.00 (Previous year : Rs. 24,86,56,228.00) received on Fixed Deposits and Liquid Deposits with GSFS is credited to Grant Fund as the Deposits are out of Grants received from Government of Gujarat.

38 As per significant Accounting policy no. i," Revenue Recognition" Flowing income has recognised on actual receipt/realisation basis because reasonable certainty is lacking earlier.

- 1.L&T AVM project in current FY Rs. 42,92,89,197.00 (Rs. 42,27,61,150.00 upto FY 2019-20).
- 2.L&T RJV project in current FY Rs. 12,78,49,619.00 (Rs. 8,44,48,484.00 upto FY 2019-20).
- 3.L&T HGS project in current FY Rs. 24,59,41,889.00 (Rs. 5,46,67,327.00 upto FY 2019-20).

39 GOG, R&B Department, Gandhinagar given approval vide its letter no. NHR-10-2009-825036-PART 6-M Dated 09.05.2018 and NHR-10-2009-825036-PART 6-M Dated 03.11.2018 to avail Loan from GSFS towards financial assistance of 1847 crore for widening/upgradation of Ahmedabad-Rajkot NH No 8A(New NH No 47) and NH No. 8B(New NH No. 27) from four lane to six lane by R&B Department,GOG,Gandhinagar. During the year 2020-2021 an amount of Rs. 213.11 crore (Including Interest Capitalised amounting of Rs. 40.69Crore) has been disbursed by the GSFS and the amount received from GSFS has been Advanced to NH for the said project on the same terms and conditions on which loan has been obtained from GSFS, hence, interest expense incurred on loan from GSFS and interest income earned from NH has been netted off in the finance cost.

40 ESTIMATION OF UNCERTAINTIES RELATING TO THE GLOBAL HEALTH PANDEMIC FROM COVID-19

The Company has considered the possible effects that may result from the pandemic relating to COVID-19 on the carrying amounts of receivables. In developing the assumptions relating to the possible future uncertainties in the global economic conditions because of this pandemic, the Company, as at the date of approval of these financial statements has used internal and external sources of information including credit reports and related information, economic forecasts The Company has performed sensitivity analysis on the assumptions used and based on current estimates expects the carrying amount of these assets will be recovered. The impact of COVID-19 on the Company's financial statements may differ from that estimated as at the date of approval of these financial statements. Company expects that considering the steps taken by the Central and the State Government for the revival of economy, the impact on the demand of lignite due to lock-down may be for short duration only. The management does not expect any medium to long term risks at this stage in company's ability to continue as a going concern and meeting its liabilities as and when they fall due.

FOR INANI & INANI
CHARTERED ACCOUNTANTS
FRN 120507W

FOR GUJARAT STATE ROAD DEVELOPMENT
CORPORATION LIMITED

(ANKIT SHAH)
PARTNER
M. NO. 145569

ASHOK K PATEL
MANAGING DIRECTOR
DIN: 0009403694

D B NIMAVAT
DIRECTOR
DIN : 08937070

PLACE:-GANDHINAGAR
DATED:-30-11-2021
UDIN NO 21145569AAAA500

SHEETAL SHAH
I/C COMPANY SECRETARY

Roads & Buildings Department

Administrative Report

2020-21

According to Companies Act, 2013 – Section - 395

**Gujarat State Road Development Corporation Ltd
for the year ending on 31.03.2021**

Prepared by

**Shri S.B.Vasava
Secretary
Roads and Buildings Department**

Roads & Buildings Department

Gujarat State Road Development Corporation Ltd
(A Govt of Gujarat Undertaking)

Administrative Report

1. Aim of Establishment:

The State Government has taken an approach to increase development of infrastructure in the State through private sector participation. Main activities of GSRDC relate to development of roads and bridges through private sector participation. Preparation of feasibility studies for road and bridge projects, preparation of bidding documents for projects on Build, Operate & Transfer (BOT) basis/Viability Gap Funding Scheme of Government of Gujarat on Public Private Partnership (PPP) Model and working in close co-ordination with Gujarat Infrastructure Development Board (GIDB) and Roads and Buildings Departments for necessary approvals in the above matters.

Further ahead, GSRDC has to undertake the work of Improvement and Widening of Road on BOT Basis and also has to undertake the work on B1-B2 basis and all other works entrusted by Roads and Buildings Dept.

2. Main Objectives :

- Develop road and bridge projects with private sector investment.
- Preparation of feasibility studies for projects.
- On the recommendation of studies, interact with the State Government and GIDB to develop projects on BOT basis and undertake related activities.
- Undertake public bidding as per provisions of GID Act, 1999 and finalize the bidder for projects.

3. Capital Structure:

- Share Capital: Authorised Share Capital of GSRDC is Rs. 5 Crore which is fully paid-up.
- State Government has contributed Rs. 1 crore as Equity Fund to GSRDC in the year 1999.

4. Review of Activities :

Your Company was established as a wholly owned Company of Government of Gujarat with a prime objective of developing roads on PPP mode as well as the other feasible modes involving optimally least public fund. The Company undertakes all the activities related to such projects including pre- construction activities.

During the year 2020-21 under the review; the Company has mainly carried out the following projects/activities:

- Total 7 projects - Himmatnagar Bypass, Bhuj Nakhatrana, Kim Mandvi and Deesa Panthawada Gundri & 3 VGF Road Projects under Operation and Maintenance are taken care. Bhuj Bhachau Road is in partial commercial operation and been taken care of.
- The Concession Agreements for the project of Six laning of Bagodara Vasad Road was executed with Concessionaire on 13-02-2011 was terminated owing to non- achievement of required progress and abandoned by the Concessionaire. Arbitration was invoked by GSRDC against the concessionaire owing to non-fulfillment of obligations by the concessionaire.
- New tenders in two packages on Modified Annuity basis were approved and the construction work has been commenced.
- The Concession Agreements for the Bhuj- Bhachau Road Project was signed on 12-07-2011. The work was under progress and it was monitored and issues related to the project were addressed so as to pave the way for its earliest completion.
- The Concession Agreement for Bhuj Nakhatrana road executed with the Concessionaire MSK Bhuj Nakhatrana Toll Road Pvt Ltd. (amalgamated with MSK Projects Ltd.) is terminated owing to non-fulfillment of operation and maintenance obligations by the concessionaire. Arbitration was invoked by GSRDC against the concessionaire owing to non-fulfillment of obligations by the concessionaire.
- User fee collection on Bharuch- Dahej Road, which is developed to six lane configuration by GSRDC is ongoing (in force from 16th February, 2017), resulting into an additional source of income to the Corporation. The maintenance is being taken care by GSRDC.
- The work of 4 laning of Surat Bardoli Road (Road Works of approx. 15 m length) was completed way back. The work of Four Lane Railway Over Bridge (ROB) in lieu of LC 17 near Dastan village was taken up on cost sharing basis where approaches were to be taken up by GSRDC and bridge proper was to taken up by Railway Authority. The work of approaches is almost completed.
- The consultant Highway Engineering has been appointed for preparation of DPR for Chikhli -Saputara Road. Consultant Geo designs & Research Pvt Ltd is appointed, for preparation of DPR for sachana ROB. Land acquisition is completed on dated 19-03-2021.

5. Board of Directors:

During the year under review, the change in the directors and the details of the Board of Director is mentioned hereunder.

Sr. No.	Name, Father Name, Address	DIN/PAN	Designation	Date of Appointment	Date of Cessation
1.	Shri Purneshkumar Ishwarlal Modi S/o Ishwarlal Modi Address: 4, Saidham Raw House, Near Adajan Fire Station, Adaan, Surat-395009	09424900	Director	23/09/2021	Continue
2	Shri Nitinkumar Ratilal Patel S/o Shri Ratilal Maganlal Patel Address: No 8- Manichandra Part-4, Nr. Surdhara Circle, Thaltej, Ahmedabad Gujarat-380059	06936838	Director	20/06/2014	23/09/2021
3.	Shri Ashokbhai K Patel Address: 201 E-1 Tower, Samarpan Flats Govt officers, Colony Opp IDBI Qtrs, Gulbai Tekra Ahmedabad	009403694	Managing Director	12/10/2021	Continue
4.	Shri Hareshkumar C. Modi S/o Shri Chandulal Modi Address: 31/b, Tulip Bungalows Part 2, Near Surdhara Circle, Thaltej, Ahmedabad Gujarat -380054	08626316	Managing Director	06/09/2019	12/10/2021
5.	Shri Ashwini Kumar Yadav S/o Shri Rajendra Prasad Yadav Address: Bungalow No. 215/A KH Type, Sector 19, Gandhinagar Gujarat-382019	06581753	Nominee Director	21/10/2016	11/11/2021
6.	Shri Sandeep Bhanubhai Vasava S/o Shri Bhanubhai Vasava Address: KH-18, Sector -19, Gandhinagar Gujarat-382019	02037918	Nominee Director	07/09/2016	Continue

Sr. No.	Name, Father Name, Address	DIN/PAN	Designation	Date of Appointment	Date of Cessation
7	Shri D.B.Nimavat S/o Shri Hematram Godia Address: "Spandan", Plot No. 116/1 Behind Enquiry Office, Sector 7/C, Gandhinagar Gujarat- 382019	08937010	Nominee Director	01/05/2021	Continue
8.	Shri Babuji Gulabji S/o Shri Gulabji Vaghela Address Plot No. 1228/2, Sector No. 4C, Gandhinagar	-	Nominee Director	07/09/2020	30/04/2021
9.	Shri Prakash Makwana S/o Shri Naranbhai Makwana Address: 2, Chandan SBI Staff Society, Near ST Workshop, Behrampura, Ahmedabad. Gujarat-380021	08672682	Director	22/08/2019	Continue
10.	Shri Sureshbhai Dahyabhai Patel S/o Shri Dahyabhai Purushottamdas Patel Address: 25, Shalin Bungalows, Opp. Someshwara Park - III, Nr. Gulab Tower, Thaltej, Ahmedabad, Gujarat – 380054	01666959	Director	26/06/2014	Continue

6. Administrative setup:

20 Persons were working in the organization during the year.

7. Conclusion:

During the year 2020-21, Company has earned Rs.85.14 crore as income from various sources like Interest on Deposits, Projects Development Fees, Bid processing fee etc. During the year, the Company has incurred and amount of Rs. 68.14 Cr as total expenditure which including feasibility study expensed, depreciation etc.



Registered Office :
Ground Floor, Nirman Bhawan, Sector 10-A,
Gandhinagar-382010, Gujarat.
Contact No : +91 79-23252912,23252915.
Email : cosec-gsrdc@gujarat.gov.in , gsrdcl@gmail.com
Web : www.gsrdc.com